

શુદ્ધ સોના અને ચાંદીમાં વિક્રમજનક ભાવ નોંધાયા

સોનું ૮૮,૦૦૦ને પાર, ચાંદી ૧,૦૦,૦૦૦ ઉપર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ચાંદી અને પહેલી જ વાર કિલોએ એક લાખ રૂપિયાની સપાટી વટાવીને નવો ઇતિહાસ સર્જ્યો છે. યુએસ ટેરિફ અંગે અનિશ્ચિતતા, ટ્રેડ વોર તથા ભૂરાજકીય સંકટ ફરી ટ્રાટકવાની આશંકા તેમ જ ફેડરલ રિઝર્વ દ્વારા નાણાકીય નીતિમાં છૂટછાટની વધતી અપેક્ષાઓ વચ્ચે વૈશ્વિક બજારોમાં મજબૂત વલણોને પગલે સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવ નવા વિક્રમી સ્તરે પહોંચ્યા છે. અલબત્ત દિલ્હી અને ગુજરાતના અમુક શહેરોમાં ચાંદીએ સોમવારે જ એક લાખ રૂપિયાની સપાટી વટાવી નાંખી છે.

સિનિયર કોમોડિટી એનાલિસ્ટના જણાવ્યા અનુસાર, કિંમતી ધાતુઓમાં રેકોર્ડિંગ તેજ માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદી અને વૈશ્વિક આર્થિક અસ્થિરતાનો સમાવેશ થાય છે. વધુમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર અને આર્થિક નીતિઓને કારણે વિશ્વભરમાં આર્થિક અનિશ્ચિતતામાં વધારો થવાથી સેફ હેવન એસેટની માગમાં વધારો થયો છે.

ફુગાવામાં ઘટાડો થવાને કારણે યુએસ ફેડરલ વ્યાજ દરમાં વધુ ઘટાડો કરશે એવી અપેક્ષાઓ મજબૂત થતાં સોનાચાંદીના ભાવ રોજ નવી વિક્રમી સપાટી નોંધાવી રહ્યા હોવાનું બજારના સાધનો જણાવે છે. અમેરિકાએ યમનના હુથીઓ લાલ સમુદ્રના શિપિંગ પર હુમલા બંધ ન કરે ત્યાં સુધી તેમના પર હુમલા ચાલુ રાખવાની વાત કરી છે, તો આ તરફ ઇઝરાયેલ હુમાસ પર હુમલો કર્યો છે. આવા કારણોસર ભૂરાજકીય જોખમોએ સોનાના ભાવમાં વધારો કર્યો છે.

મુંબઈના ઝવેરી બજારમાં સત્રને અંતે શુદ્ધ સોનું રૂ. ૨૫૩ના વધારા સાથે રૂ. ૮૮,૩૫૪ની સપાટી પર સ્થિર થયું હતું, જ્યારે સ્ટાન્ડર્ડ સોનું દસ ગ્રામે રૂ. ૨૫૨ના વધારા સાથે રૂ. ૮૮,૦૦૦ની સપાટીએ પહોંચ્યું હતું. એ જ સાથે ઇઝરાયેલ ચાંદી કિલોએ રૂ. ૬૩૩ના ઉછાળા સાથે રૂ. ૧,૦૦,૪૦૦ની સપાટીએ સ્થિર થઈ હતી. ■

શૌરબજારમાં બે મહિના બાદ સૌથી મોટો ઉછાળો

સેન્સેક્સે ૧૧૩૧ની છલાંગ સાથે ૮.૬૭ લાખ કરોડ રૂપિયા વરસાવ્યા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: શૌરબજારમાં સોમવારે એક ડગલું માંડ્યા બાદ આખલાએ મંગળવારે જાણે તેજનો તરખાટ મચાવી દીધો હતો. સેન્સેક્સે ૭૫,૦૦૦ની સપાટી પાછી મેળવી લીધી છે, તો નિફ્ટી ૨૩,૦૦૦ નિકટ સરક્યો છે. સેન્સેક્સે ૧,૧૩૧.૩૧ પોઈન્ટ અથવા ૧.૫૩ ટકાના ઉછાળા સાથે ૭૫,૩૦૧.૨૬ પોઈન્ટની સપાટી પર સ્થિર થયો છે. દિવસ દરમિયાન, તે ૧,૨૧૫.૮૧ પોઈન્ટ અથવા ૧.૬૩ ટકાના ઉછાળા સાથે ૭૫,૩૦૧.૬૬ પર પહોંચ્યો હતો. નિફ્ટી ૩૨૫.૫૫ પોઈન્ટ અથવા ૧.૪૫ ટકા ઉછાળીને ૨૨,૮૩૪.૩૦ પર બંધ થયો છે. મંગળવારે માર્કેટ કેપ રૂ. ૭.૦૫ લાખ કરોડ વધીને રૂ. ૩૮૮.૮૫ લાખ કરોડની સપાટીએ પહોંચ્યું હતું. બે દિવસમાં, બેન્ચમાર્ક ૧,૪૭૨.૩૫ પોઈન્ટ અથવા ૧.૮૮ ટકાના ઉછાળા સાથે ૧,૮૬૭ લાખ કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો છે. આ સત્રમાં મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઘણાં વનખતે તેજનો સળવળાટ જોવા મળ્યો હતો. મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં બે ટકાથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને ૨૮૦ શેરો કેતેમની બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. અમેરિકાના યુનફૂળ ડેટાને જોતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરશે એવી વ્યાપક અપેક્ષાએ વિશ્વબજારના શૌરબજારોમાં તેજનો પવન ફૂંકાયો હતો અને એ સાથે સ્થાનિક બજારમાં પણ તેજીએ જોર પકડ્યું હતું. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ કરારની વધતી આશાઓ અને ચીનના ઉત્પાદન પગલાં પર વૈશ્વિક બજારોમાં બીજા દિવસે પણ વધારો જોવા મળતા સકારાત્મક વૈશ્વિક સંકેતોએ બજારોને ઝડપથી તેજમાં મદદ કરી હતી.

બાર્લેન ઇન્ટિંગ અને આરબીઆઈ વ્યાજદર ઘટાડશે એવી આશાએ પણ સેન્ટિમેન્ટમાં તેજીને ઇંધણ આપ્યું હતું. ઇઝરાયેલ હુમાસ પર સવારે હુમલો કર્યો હોવા છતાં તેની ચિંતા બજારે ફગાવી દીધી હતી. જોકે, નજીકના ભવિષ્યમાં ટ્રેડ વોર, રશિયા-યુક્રેન શાંતિ કરાર અને યુએસ ફેડરલ રેટ આઉટલુક જેવા વૈશ્વિક પરિબળો બજાર પર અસર કરશે. (જુઓ પાનું ૨) ►►

શસ્ત્રવિરામનો ભંગ કરી ઇઝરાયલનો પેલેસ્ટાઈન પર હુમલો: ૪૧૩નાં મોત

ગાઝા પટ્ટી: ઇઝરાયેલે મંગળવારે વહેલી સવારે ગાઝા પટ્ટી પર કરેલા હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૪૧૩ જણનાં મોત થયાં હોવાનું હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું હતું.

ગાઝાના આરોગ્ય ખાતાના જણાવ્યાનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા ૪૧૩નાં મોત થયાં હોવા ઉપરાંત સેંકડો જણ ઘાયલ થયા હતા.

આ હુમલાહુમલા સાથે જ ઇઝરાયેલે જાન્યુઆરીથી અમલી બનેલા શસ્ત્રવિરામનો ભંગ કર્યો હતો અને ૧૭ મહિના જૂનું યુદ્ધ ફરી ભડકાવવાની ધમકી આપી હતી.

શસ્ત્રવિરામના કરારમાં ફેરફાર કરવાની ઇઝરાયેલની માગણી હુમાસે નકાર્યા બાદ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હવાઈહુમલાનો આદેશ આપ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલે કાર્યવાહી ફરી આરંભી છે અને એનો વ્યાપ વધે તેવી શક્યતા છે. અમેરિકાએ કહ્યું હતું કે હુમલા અગાઉ ઇઝરાયેલે અમારી સાથે ચર્ચાવિચારણા કરી હતી અને તેને અમારું સમર્થન છે.

ઈઝરાયેલની સેનાએ પૂર્વ ગાઝાના લોકોને એ વિસ્તાર ખાલી કરી દેવાનો આદેશ આપ્યો હતો જે બાબત ઇઝરાયેલ નવેસરથી જમીની કાર્યવાહી શરૂ કરે તેવી શક્યતાના સંકેત આપે છે.

નેતન્યાહુના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ઇઝરાયેલ હવે હુમાસ પર વધુ લશ્કરી તકાત સાથે હુમલા કરશે. મુસ્લિમોના પવિત્ર મહિના રમઝાન દરમિયાન ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલો આ હવાઈહુમલો યુદ્ધને ભડકાવશે. અત્યાર સુધી આ યુદ્ધને કારણે ઇઝરાયેલ પેલેસ્ટાઈનવાસીઓએ જીવ ગુમાવ્યા છે અને ગાઝા પટ્ટીમાં વ્યાપક વિનાશ વેરાયો છે. હુમાસ દ્વારા બાનમાં રખાયેલા બે ઝડન કરતાં પણ વધુ ઇઝરાયેલીઓ હજુ જીવતા હોવાનું માનવામાં આવે છે.

હુમાસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે યુદ્ધ ફરી શરૂ કરવાનો નેતન્યાહુનો નિર્ણય બાનમાં રખાયેલા બાકીના લોકો માટે મૃત્યુદંડની સજા પુરવાર થઈ શકે છે. ઇઝરાયેલ દ્વારા મંગળવારે કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા ચાર વરિષ્ઠ અધિકારીઓનાં મોત થયાં હોવાનું હુમાસે કહ્યું હતું.

ઈઝરાયેલના હુમલાનો હુમાસે કોઈ વળતો જવાબ આપ્યો નથી એ બાબત (જુઓ પાનું ૨) ►►



સંમ્માન: દિલ્હીના નવા ચૂંટાયેલા વિધાનસભ્યો માટે મંગળવારે યોજવામાં આવેલા બે દિવસના ઓરિયન્ટેશન પ્રોગ્રામના ઉદ્ઘાટન દરમિયાન દિલ્હી વિધાનસભાના સ્પીકર વિજેન્દર ગુપ્તા, મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા અને વિધાનસભાનાં વિપક્ષના નેતા આતિશીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાનું સન્માન કર્યું હતું. (એજન્સી)

ઈટાહમાં મંદિરની મૂર્તિ ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી, હિન્દુ જૂથનો વિરોધ

ઈટાહ (ઉત્તર પ્રદેશ) : ઈટાહ જિલ્લાના મોહલવા બડા બજાર વિસ્તારમાં એક મંદિરમાં શિવલિંગ અને એક મૂર્તિ ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. આને પગલે હિન્દુ જૂથોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સર્કલ ઓફિસર (જાલેસર) નીતીશ ગર્ગે કહ્યું હતું કે મંદિરની નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસ તપાસી રહી છે અને આરોપીને તુરંત પકડવામાં આવશે.

પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રાચીન રાધાકૃષ્ણ મંદિરમાં મંગળવારે સવારે દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુને કહ્યું અજુગતું લાગ્યું નહોતું, પરંતુ સવારે આઠ વાગ્યે અમુક ઘણાઓખાયેલા ઈસમોએ શિવલિંગ અને નંદીની મૂર્તિ તોડી નાખી હતી. તરત જ સેંકડો લોકોએ મંદિર જઈને દેખાવ કર્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બીજા હિન્દુ સંગઠનોએ બડા બજારના ચોકમાં વાહનવ્યવહાર અટકાવી દીધો હતો. દેખાવકારોએ તાલુકા વહીવટીતંત્ર અને પોલીસ સામે સુનોચ્યાર કર્યો હતો. હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે ઘટના બન્યાના પાંચ કલાક સુધી સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને બીજા વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા નહોતા.

બપોરના એક વાગ્યે એસડીએમ ભાવના વિમલ, સીઓ નીતીશ ગર્ગે અને તહેસિલદાર અરવિંદ ગોતમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે મંદિરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને દેખાવકારોને શાંત પાડ્યા હતા. દેખાવકારો રોડ ખોલવા તૈયાર થયા હતા.

ગર્ગે જાલેસર પોલીસ સ્ટેશનના એસએચઓ સુધિર કુમારને બનાવની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. (એજન્સી) ■

ટ્રમ્પનો મુકાબલો કરવા કેનેડાના પીએમ બ્રિટન અને ફ્રાન્સના સમક્ષને મળ્યા

લંડન: કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ને સોમવારે તેમની પ્રથમ સત્તાવાર વિદેશ યાત્રા દરમિયાન બ્રિટન અને ફ્રાન્સના નેતાઓને મળ્યા હતા, જેમાં યુએસ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે કેનેડાની સાર્વભૌમત્વ અને અર્થવ્યવસ્થાને નિશાન બનાવતા ઓછાવાના બે સૌથી જૂના સાથીઓ પાસેથી સમર્થન માગ્યું હતું.

કેનેડિયનોએ ટ્રમ્પના હુમલાઓ માટે તેમના મૌન પ્રતિસાદ માટે કેનેડાની સ્થાપના કરનાર બે દેશોના નેતાઓની ટીકા કરી હતી.

ટ્રમ્પે કેનેડિયન સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ લાદ્યા છે અને કેનેડાને ૫૧ મું રાજ્ય બનાવવા અંગે વારંવાર ટિપ્પણી કરી છે. કાર્ને અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા, અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્ટ સાથે સંયુક્ત સમાચાર પરિષદ પણ યોજાઈ ન હતી.

આ બાબતથી પરિચિત એક અધિકારી, જેમણે નામ જાહેર ન કરવાની શરતે વાત કરી હતી કારણ કે તેઓ જાહેરમાં બોલાવા માટે અધિકૃત ન હતા, એમણે જણાવ્યું હતું કે કેનેડાએ પેરિસમાં પ્રેસ કોન્ફરન્સનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ ફ્રાન્સે એનો ઇનકાર કર્યો હતો.

સ્ટાર્ટમેરે કેનેડાને યુ.કે.નો મિત્ર અને સાથી ગણાવ્યો છે, પરંતુ ટ્રમ્પ સામે સૌથી રીતે બોલાવવાનો ઇનકાર કર્યો છે - જો કે કેનેડાની સાર્વભૌમત્વ પર ભાર મૂકીને તે પહેલા કરતાં વધુ આગળ વધ્યા હતા.

એમણે જણાવ્યું હતું કે “અમારે બે દેશો વચ્ચેના સંબંધો હંમેશાં મજબૂત રહ્યા છે.”

સ્ટાર્ટમેરે બ્રિટિશ નેતાના ૧૦ ડાઉનિંગ સેન્ટ નિવાસની અંદર કાર્નેને કહ્યું કે “બે સાર્વભૌમ સાથી છે, જેમાં ખૂબ સમાનતા છે. સમાન ઇતિહાસ, સમાન મૂલ્યો, સમાન રાજા છે.” ■

લોકશાહી દેશે પોલીસ રાજ્યની જેમ કામ ન કરવું જોઈએ: સુપ્રીમ

નવી દિલ્હી: તપાસ પૂર્ણ થવા છતાં અને “ખૂબ ગંભીર કેસ ન હોય” તેમ છતાં ટ્રાયલ કોર્ટ દ્વારા જામીન અરજીઓ નકારવા પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

ન્યાયાધીશ અભય એસ ઓકા અને ઉજ્જવલ ભુયાનની બનેલી બંને સોમવારે કહ્યું હતું કે લોકશાહી દેશે પોલીસ રાજ્યની જેમ કામ ન કરવું જોઈએ, જ્યાં કાયદા અમલીકરણ એજન્સીઓ વાસ્તવિક જરૂરિયાત વિના વ્યક્તિઓને અટકાયતમાં રાખવા માટે મનસ્વી સત્તાનો ઉપયોગ કરે છે. તેમણે અવલોકન કર્યું હતું કે બે દાયકા પહેલા, નાના કેસોમાં જામીન અરજીઓ ભાગ્યે જ હાઈકોર્ટમાં પહોંચતી હતી, ટોચની કોર્ટની વાત તો હોડો.

“તે આઘાતજનક છે કે સુપ્રીમ કોર્ટ એવા કેસોમાં જામીન અરજીઓ પર ચુકાદો આપી રહી છે જેનો ટ્રાયલ કોર્ટના સ્તરે નિકાલ થયો જોઈએ. સિસ્ટમ પર બિનજરૂરી રીતે બોજ નાખવામાં આવી રહ્યો છે,” એમ જસ્ટિસ ઓકાએ જામીન અરજી પર સુનાવણી કરતી વખતે જણાવ્યું હતું. આ પહેલીવાર નથી જ્યારે સર્વોચ્ચ અદાલતે આ મુદ્દો ઉઠાવ્યો હોય. તેણે વારંવાર ટ્રાયલ કોર્ટ અને ઉચ્ચ અદાલતોને જામીન આપવા માટે વધુ ઉદાર વલણ અપનાવવા વિનંતી કરી છે, ખાસ કરીને નાના કેસોમાં.

કસ્ટોડિયલ અટકાયતની આવશ્યકતા ન હોય ત્યારે વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણના મહત્ત્વ પર ભાર મૂકતા બહુવિધ નિર્દેશો હોવા છતાં, જામીન નકારવામાં નીચલી અદાલતો દ્વારા “બૌદ્ધિક અપ્રમાણિકતા” તરીકે ઓળખાવી સર્વોચ્ચ અદાલતે અગાઉ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

સુનાવણી દરમિયાન, બેન્ચે એક આરોપીને જામીન આપ્યા હતા જે છેતરપિંડીના કેસમાં બે વર્ષથી વધુ સમયથી કરડીમાં હતા.

તપાસ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી તોય આરોપીની જામીન અરજી ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ બંને દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

ન્યાયાધીશ ઓકાએ કહ્યું કે, “આ દુર્ભાગ્યપૂર્ણ છે કે મેજિસ્ટ્રેટ દ્વારા ટ્રાયલ કેસોમાં જામીનની બાબતો સુપ્રીમ કોર્ટ સમક્ષ લાવવામાં આવે છે. અમને એ કહેતા દુ:ખ થાય છે કે લોકોને જ્યારે જોઈએ ત્યારે જામીન મળી રહ્યા નથી.”

૨૦૨૨માં, સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીઓ પર કસ્ટોડિયન આવશ્યકતા ન હોય તો મહત્તમ સાત વર્ષ સુધીની સજા ધરાવતા સંજ્ઞાપાત્ર ગુનાઓમાં ધરપકડ કરવા પર પ્રતિબંધ લાદ્યો હતો. ■

રાબડી દેવી અને તેજપ્રતાપ યાદવ ઈડી સમક્ષ હાજર થયા

પટણા : બિહારનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવી અને તેમના પુત્ર અને વિધાનસભ્ય તેજપ્રતાપ યાદવ મંગળવારે ‘નોકરીના બદલામાં જમીન’ના મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સિમેન્ટ ડિરેક્ટરેટ સમક્ષ હાજર થયાં હતાં. બીજા બાજુ રાબડી દેવીના પતિ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવને હાજર રહેવાનું સમન્સ મોકલવામાં આવ્યું છે.

૬૬ વર્ષનાં રાબડી તેમની મોટી પુત્રી અને પાટલીપુત્રનાં સાંસદ મિસા ભારતી સાથે બેન્ક રોડ પર આવેલી ઈડીની ઓફિસમાં પહોંચ્યાં હતાં. આરજેડીના સેંકડો કાર્યકર્તાઓ પણ ઈડીની ઓફિસની બહાર ભેગા થયા હતા અને તેમણે મા-બેટીની તરફેણમાં સુનોચ્યાર કર્યો હતો. ૩૬ વર્ષના તેજપ્રતાપ યાદવ પણ તપાસકારો સમક્ષ હાજર થયા હતા.

ઈડીએ અગાઉ આ કેસમાં લાલુ અને તેમના નાના પુત્ર તેજસ્વી યાદવની પૂછપરછ કરી હતી. ગયા વર્ષે ઈડીએ દિલ્હી અદાલતમાં પ્રસાદના કુટુંબીજનો સામે તહોમતનામું નોંધાવ્યું હતું. આમાં રાબડી દેવી અને તેમની પુત્રીઓ મિસા ભારતી તથા હેમા યાદવને બીજાઓ સાથે આરોપી કહેવામાં આવ્યા છે. લાલુ યુપીએ-એક સરકારમાં રેલવેપ્રધાન હતા ત્યારે ૨૦૦૪-૨૦૦૮માં ભારતીય રેલવેના ગ્રુપ ડીના સબસ્ટિટ્યુટની નિમણૂકમાં કથિત ભ્રષ્ટાચાર કરાયો હતો એવા આક્ષેપની તપાસ થઈ રહી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ નોંધાવેલા એફઆઈઆર પ્રમાણે ઉમેદવારોને રેલવેમાં નોકરીના બદલામાં લાંચ તરીકે જમીન ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું. સીબીઆઈની ફરિયાદના આધારે મની લોન્ડરિંગ કેસ કરવામાં આવ્યો છે. ઈડીના તહોમતનામું પ્રમાણે જે આરોપી છે એ રાબડી દેવી, મિસા ભારતી અને હેમા યાદવને જે ઉમેદવારને પસંદ કરાયા છે તેમના કુટુંબીએ નજીવી રકમમાં લેન્ડ પાર્સલ આપ્યા હતા. (એજન્સી) ■



એક્સટ્રા અફેર

ભરત ભારદ્વાજ
feedback@bombaysamachar.com

હિંદુઓ કોના વારસ? મરાઠાઓના કે ઔરંગઝેબના?

મહારાષ્ટ્રના ખુલદાબાદમાં આવેલા મોગલ બાદશાહ ઔરંગઝેબની કબરનો વિવાદ ધારણા પ્રમાણે જ વકર્યો છે અને હિંસા શરૂ થઈ ગઈ છે. નાગપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતનાં કહેવાતાં હિંદુવાદી સંગઠનોએ ઔરંગઝેબના પૂજાનું દહન કરીને તેમની કબર તોડી પાડવાની માગ કરી પછી પથરમારો અને તોડફોડ શરૂ થઈ ગઈ તેમાં નાગપુરમાં તણાવ છે. તોફાનીઓએ ઘરો પર પથરમારો કર્યો અને રસ્તાની બાજુમાં આવેલા વાહનોને આગ પણ ચાંપી દીધી.

પોલીસ પર પણ હુમલો થયો અને કુહાડીથી થયેલા હુમલામાં ડીસીપી નિકેતન કદમ ઘાયલ થયા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા. ૩૦૦ વર્ષ પહેલાં મરી ગયેલા એક અત્યાચારી બાદશાહની કબરના કારણે અત્યારે જીવતા લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે.

ઔરંગઝેબની કબરનો વિવાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવાં હિંદુવાદી સંગઠનોને હિંદુત્વ સાથે કંઈ લેવાદેવા નથી પણ હિંદુઓની લાગણીના નામે પોતાનો રોટલો શેકવામાં રસ છે તેનો વધુ એક પુરાવો છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો નાગપુરમાં શૂરાતન બતાવી રહ્યા છે કેમ કે તેમને ખબર છે કે, મહારાષ્ટ્રમાં મોસાળમાં જમણવાર ને મા પિરસે એ ઘાટ છે. મહારાષ્ટ્રમાં ગમે તે કરો, દેવેન્દ્ર ડાણવીસની સરકાર કશું કરવાની નથી કેમ કે ઔરંગઝેબની કબરના વિવાદનો પલિતો ચાંપવામાં ડાણવીસને મોખરે છે. મહારાષ્ટ્રમાં હિંદુત્વના નામે ચરી પાવામાં ડાણવીસને રસ છે તેથી આ વિવાદ ઊભો કરી રહ્યા છે એટલે વિશ્વ હિન્દુ પરિષદ હોય કે બીજું કોઈ કહેવાતું હિંદુવાદી સંગઠન હોય, બધાં સલામત છે.

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવાં હિંદુવાદી સંગઠનોને હિંદુત્વ અને હિંદુઓની રક્ષામાં રસ હોય તો તેમણે જમ્મુ અને કાશ્મીર જઈને હિંદુઓની રક્ષા કરવી જોઈએ કે જ્યાં આતંકવાદીઓ હિંદુઓને ટાંગેટ કરી કરીને મારી રહ્યા છે. મણિપુર જઈને હિંદુઓની રક્ષા કરવી જોઈએ કે જ્યાં ખ્રિસ્તી મિશનરીઝના ઈશારે આતંકવાદીઓ મેઈતેઈ હિંદુઓને ભગાડી રહ્યા છે અને મારી પણ રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં પહેલાં બંધારણની કલમ ૩૭૦

હતી ત્યારે બહારનાં લોકોને કાશ્મીરમાં જઈને રહેવાની છૂટ નહોતી. નરેન્દ્ર મોદી સરકારે ૨૦૧૮માં કલમ ૩૭૦ હટાવી દીધી પછી તો દેશનો કોઈ પણ નાગરિક કાશ્મીરમાં જઈને રહી શકે છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવાં કહેવાતાં હિંદુવાદી સંગઠનોને ખરેખર હિંદુઓની ચિંતા હોય તો તેમણે કાશ્મીરના હિંદુઓની રક્ષા કરવા કાશ્મીર જવું જોઈએ, આતંકવાદીઓએ જેમને ભગાડી મૂક્યા છે એ કાશ્મીરી પંડિતોને ફરી તેમના વતનમાં વસાવીને તેમની પડખે ઊભા રહેવું જોઈએ પણ અત્યાર સુધીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવાં કહેવાતાં હિંદુવાદી સંગઠનોએ કેટલા હિંદુઓને ફરી કાશ્મીરમાં વસાવ્યા? કહેવાતા કેટલા હિંદુવાદી મણિપુર જઈને હિંદુઓને સધિયારો આપવા માટે ઊભા રહ્યા? એક પણ નહીં.

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવાં કહેવાતાં હિંદુવાદી સંગઠનો પાસે કરોડો કાર્યકરો હોવાના દાવા થાય છે. તેમાંથી ખાલી દસ હજાર કાર્યકરો પણ કાશ્મીર ખીણમાં હિંદુઓની સાથે જઈને રહે તો કોઈની તાકાત નથી કે હિંદુઓને કશું કરી શકે. આ જ વાત મણિપુરના હિંદુઓને પણ લાગુ પડે છે.

અસલી મદનગી જમ્મુ અને કાશ્મીર કે મણિપુર જઈને હિંદુઓના પડખે ઊભા રહેવામાં છે પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવાં કહેવાતાં હિંદુવાદી સંગઠનોથી એ નથી થતું. ૩૦૦ વર્ષ પહેલાં મરી ગયેલા એક મુસ્લિમ બાદશાહની કબરના મામલો તોડફોડ કરીને એ લોકો મદનગી બતાવી રહ્યા છે કેમ કે સામે કોઈ જવાબ નથી આવવાનો. ધર્મ માટે, હિંદુત્વ માટે જાન સુધમાં આપી દેવાની વાતો કરનારાને જીવની ચિંતા છે તેથી કાશ્મીર કે મણિપુર જતા નથી ને અહીં શૂરાતન બતાવ્યા કરે છે.

આ શૂરાતનથી કશું વળવાનું નથી. માનો કે ઔરંગઝેબની કબર દૂર કરી દેવાશે તો પણ ઈતિહાસ થોડો બદલાઈ જવાનો છે? ઔરંગઝેબ આ દેશ પર શાસન કરનારો એક મુસ્લિમ શાસક હતો એ હકીકત થોડી બદલાવાની છે? કબરો તોડવાથી ઈતિહાસ બદલાતા હોત તો ભૂંસાઈ જતા હોત તો શું જોઈતું હતું?

કહેવાતાં હિંદુવાદી સંગઠનો ઔરંગઝેબની કબર તોડવાનો

ઉપાયો લઈને ઔરંગઝેબ સહિતના મુસ્લિમ આક્રમણખોરોની જેમ જ વર્તી રહ્યા છે. મુસ્લિમ આક્રમણખોરો પોતાની અસભ્યતા અને જંગલીપણું બતાવવા માટે હિંદુ મંદિરો તોડેલાં, હિંદુઓનાં પવિત્ર સ્થાનો તોડેલાં ને કહેવાતા હિંદુવાદીઓ તેમના રસ્તે ચાલી રહ્યા છે.

ધાર્મિક ઉન્માદ ઊભો કરીને પોતાનો સ્વાર્થ સાધવા કૂદી પડેલા એ લોકોમાં એક સાદી સમજ પણ નથી. ઔરંગઝેબની કબર મહારાષ્ટ્રમાં સંભાળનગરથી લગભગ ૨૫ કિમી દૂર આવેલા ખુલદાબાદમાં છે. ઇતિહાસકારોના મતે, ૧૭૦૭માં ઔરંગઝેબનું નિધન થયું ત્યારે તેની ઇચ્છા મુજબ તેને ખુલદાબાદમાં તેના અધ્યાત્મિક ગુરુ મનાતા શેખ ઝૈનુદ્દીનની દરગાહ પાસે દફનાવવામાં આવ્યો હતો. પહેલાં ઔરંગઝેબની કબર એક સાદો માટીનો મકબરો હતો. પાછળથી બ્રિટિશ વાઈસરોય લોર્ડ કર્ઝન દ્વારા તેને આરસપટ્ટાણથી સજાવ્યો હતો.

વિચારવા જેવી વાત એ છે કે, મરાઠા શાસકોએ ઔરંગઝેબની કબર કેમ ના તોડી? શિવાજી મહારાજ તો ઔરંગઝેબની પહેલાં ગુજરી ગયેલા પણ તેમણે હિંદુપત પાદશાહીનો જે મજબૂત પાયો નાખ્યો હતો તેના પર એક હિંદુ રાષ્ટ્ર ઊભું થયું. ઔરંગઝેબના મોત પછી મોગલ સામ્રાજ્યનું પતન થયું અને પેશવાઓએ હાલનું મહારાષ્ટ્ર જ નહીં પણ હાલના ભારતના મોટા ભાગનો વિસ્તાર કબજે કરી લીધો હતો.

મરાઠા શાસકોએ ધાર્યું હોત તો એ વખતે જ ઔરંગઝેબની જ નહીં પણ બીજા ઘણા મુસ્લિમ શાસકોની કબરોને કે મકબરાઓને દૂર કરી શક્યા હોત પણ મરાઠા શાસકોએ એવું કેમ ના કર્યું? કેમ કે એ હિંદુ સંસ્કાર નથી. કબરો કે ધર્મસ્થાનો તોડવાં તેમાં હિંદુઓને મદનગી નથી લાગતી. જેની સત્તા હોય એ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને નિર્જીવ ઈમારતોને તોડી નામે એ મદનગી ન કહેવાય, કાયરતા કહેવાય ને આ કાયરતા મુસ્લિમ આક્રમણખોરોએ બતાવી હતી, મરાઠા શાસકોએ નહીં. શિવાજી મહારાજે નવો ઈતિહાસ લખ્યો, જૂનાને ભૂંસવામાં શક્તિ નહોતી વેડફી ને મરાઠા તેમના રસ્તે ચાલ્યા.

ઔરંગઝેબની કબર તોડવાનો ઉપાયો લેનારા નક્કી કરે કે, પોતે કોના વારસ છે? મરાઠાઓના કે ઔરંગઝેબના? ■

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

ઉત્તરાયણ - સૌર વસંતઋતુ, બુધવાર, તા. ૧૯-૩-૨૦૨૫, રંગ પંચમી, શ્રી જયંતી

- ભારતીય હિંદી ૨૮, માહે ફાગણ, શકે ૧૯૪૬
- વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, ફાગણ વદ - ૫
- જૈન વીર સંવત ૨૫૫૧, માહે ફાગણ, તિથિ વદ-૫
- પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માહે ૮મો આવાં, સને ૧૩૮૪
- પારસી કદમી રોજ ૭મો અમરદાદ, માહે ૮મો આદર, સને ૧૩૮૪
- પારસી ફસલી ગાથા-૪ બુદ્ધવ્રત, સને ૧૩૮૩
- મુસ્લિમ રોજ ૧૮મો, માહે ૮મો રમજાન, સને ૧૪૪૬
- મીસરી રોજ ૨૦મો, માહે ૮મો રમજાન, સને ૧૪૪૬
- નક્ષત્ર વિશાખા રાત્રે ક. ૨૦-૪૮ સુધી, પછી અનુરાધા.
- ચંદ્ર તુલામાં બપોરે ક. ૧૪-૦૬ સુધી, પછી વૃશ્ચિકમાં
- ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (૨, ૧), વૃશ્ચિક (ન, ય)
- સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૬, સ્ટા.ટા.,
- સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૮, સ્ટા. ટા.
- -: મુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
- ભરતી: બપોરે ક. ૧૪-૫૫, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૩૫ (તા. ૨૦)
- ઓટ: સવારે ક. ૦૮-૧૮, રાત્રે ક. ૨૦-૩૭
- વ્રત પર્વાઈ: વિક્રમ સંવત ૨૦૮૧, 'અનલ' નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૬, 'કોદી' નામ સંવત્સર, ફાગણ કૃષ્ણ - પંચમી, રંગ પંચમી, શ્રી જયંતી, બીજોય ગોવિંદ હલદંકર (મણિપુર), શુક પશ્ચિમમાં અસ્ત, વિંછુકો પ્રારંભ બપોરે ક. ૧૪-૦૬. અમૃતસિદ્ધિગો રાત્રે ક. ૨૦-૫૦થી સૂર્યાસ્ત.
- શુભાશુભ દિશાશુક્રિ: સામાન્ય દિવસ.
- મુહૂર્ત વિશેષ: મહારાષ્ટ્ર, કલ્યાંટક આદિ દક્ષિણના પ્રદેશોમાં રંગપંચમી ઉત્સવની ઉજવણી, ઈશ્રવૈવતાનું પૂજન, બુધ-ગુરુ દેવતાનું પૂજન, નવાં વસો, આભૂષણ, ધાન્ય ઘરે લાવવું, પશુ લે-વેવં, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
- આયમન: ચંદ્ર-શનિ ત્રિકોણ કરકસરિયા ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ સ્વતંત્ર પ્રકૃતિના, ચંદ્ર-રાહુ ત્રિકોણ કાળજીવાળા, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ પ્રતિષ્ઠાવાળા, ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ સ્વપ્નદષ્ટા, સૂર્ય-નેપ્ચૂન ત્રિકોણ કાલ્પનિક સૃષ્ટિમાં રહેનારા.
- ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-સૂર્ય ત્રિકોણ (તા. ૨૦), ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ (તા. ૨૦) સૂર્ય-નેપ્ચૂન ત્રિકોણ (તા. ૨૦) શુક પશ્ચિમમાં અસ્ત થાય છે.
- ગ્રહગોચર: સૂર્ય-મીન, માર્ગ મંગળ-મિથુન, વક્રી બુધ-મીન, માર્ગ ગુરુ-વૃષભ, વક્રી શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, માર્ગ હર્ષલ-વૃષભ, માર્ગ નેપ્ચૂન-મીન, માર્ગ પલુટો-મકર. ■

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ઈલેક્શન કાર્ડ અને આધાર કાર્ડ લિન્ક કરાશે

નવી દિલ્હી: ચૂંટણી પંચે મંગળવારે કહ્યું હતું કે પ્રવર્તમાન કાયદા તેમ જ સુપ્રીમ કોર્ટના આદેશને અનુસરીને જ ઈલેક્શન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવામાં આવશે.

ઈલેક્શન કમિશન (ઈસી) અને યુઆઈડીએઆઈ ઈલેક્શન કાર્ડ સાથે આધારને લિન્ક કરવા ટેકનીકલ બાબતો અંગે જલદી જ ચર્ચા વિચારણા શરૂ કરશે, એમ તેમણે કહ્યું હતું.

ઈલેક્શન કાર્ડ સાથે આધારને લિન્ક કરવાને મામલે ચર્ચા કરવા ચૂંટણી પંચે મંગળવારે કેન્દ્રના ગૃહ સચિવ, કાયદા ખાતાના સચિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેકનોલોજી ખાતાના સચિવ અને યુઆઈડીએઆઈના સીઈઓ સાથે બેઠક કરી હતી. ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે બંધારણની કલમ ૩૨૬ અંતર્ગત માત્ર ભારતના નાગરિકોને જ મતદાનનો અધિકાર આપી શકાય છે અને આધાર માત્ર વ્યક્તિની ઓળખ સ્થાપિત કરે છે. આ કારણે જ બંધારણની કલમ ૩૨૬ અને ડિગ્રેગ્રેશન ઓફ ધ પીપલ એક્ટ ૧૯૫૦ની કલમ ૨૩ (ઠ), ૨૩(પ) અને ૨૩ (દ)ની જોગવાઈ તેમ જ વર્ષ ૨૦૨૦ના સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જ ઈલેક્શન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે આ કાર્ય માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા મુકરર કરવામાં નથી આવી કે નથી એ માટેનું કોઈ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું. સરકારે ભારપૂર્વક કહ્યું હતું કે જે લોકો ઈલેક્શન કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક નહીં કરાવે તેમનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં નહીં આવે. (એજન્સી) ■

મતદાનના આંકડાઓની યાદી વેબસાઈટ પર મૂકવા અમે તૈયાર: ચૂંટણી પંચ

નવી દિલ્હી: પ્રત્યેક મતદાન મથકમાં થયેલા મતદાનના આંકડાઓની યાદી વેબસાઈટ પર મૂકવાની માગણીને મુદ્દે ચર્ચા કરવા અમે તૈયાર છીએ એ પ્રકારની ચૂંટણી પંચની રજૂઆતની સુપ્રીમ કોર્ટે મંગળવારે નોંધ લીધી હતી અને અરજતકની આ મામલે ૧૦ દિવસની અંદર ચૂંટણી સમિતી સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું હતું. ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રા ડેમોક્રેટિક રિફોર્મ્સના એનજીઓ એસોસિયેશન દ્વારા વર્ષ ૨૦૧૯માં દાખલ કરવામાં આવેલી જનહિંતની બે અરજીની મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજયકુમાર અને કે.વી. વિશ્વનાથનની બનેલી ખંડપીટ સુનાવણી કરી રહી હતી. જનહિંતની અરજીમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન પૂરું થયાંનાં ૪૯ કલાકની અંદર પ્રત્યેક મતદાન મથકમાં થયેલા મતદાનના આંકડાઓની યાદી વેબસાઈટ પર મૂકવાની માગણી કરવામાં આવી હતી. (એજન્સી) ■

દેહુલી નરસંહાર: ૨૪ દલિતની હત્યા કરનાર ત્રણને મૃત્યુદંડની સજા

મૈનપુરી (ઉત્તર પ્રદેશ) : ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાની ખાસ અદાલતે ૧૯૮૧ના દેહુલી હત્યાકાંડમાં મંગળવારે ત્રણ ઈસમને દેહાંતંદંડની સજા ફટકારી હતી. આ હત્યાકાંડમાં મહિલા અને બે બાળક સહિત ૨૪ દલિતની કત્લેઆમ કરાઈ હતી. ખાસ જજ ઈંદિરા સિંહે ૧૨ માર્ચે કપ્ટાન સિંહ (૬૦), રામપાલ (૬૦) અને રામ સેવક (૭૦)ની ત્રિપુટીને દોષી જાહેર કરી હતી. અદાલતે તેમને ફાંસીની સજા ઉપરાંત ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ કર્યો હતો, એવી માહિતી સરકારી વકીલ રોહિત શુક્લે આપી હતી. ૧૮ નવેમ્બર, ૧૯૮૧એ બપોરે સાંડાત્યાર વાગ્યે ૧૭ ડાકુઓ ખાખી ગણવેશ પહેરીને દેહુલી ઘસી આવ્યા હતા.

તેઓએ એક દલિત કુટુંબને લશ્કર બનાવ્યું હતું. ડાકુઓએ છ મહિનાના અને બે વર્ષના બાળક સહિત ૨૪ જણને ઠાર માર્યા હતા. મૂળ એફઆઈઆરમાં ૩૦૨ કલમ (હત્યા), ૩૦૭ કલમ (હત્યાનો પ્રયાસ અને ૩૯૬ કલમ (હત્યા સાથે લૂંટ) તથા બીજી કલમો હેઠળ ૧૭ આરોપી સામે ગુના નોંધવામાં આવ્યા હતા. ૧૭માંથી ૧૪ આરોપી મૃતલો ચાલુ થાય એ પહેલાં જ મરણ પામ્યા હતા. એક જણને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.

સ્થાનિક રહેવાસી લૈક સિંહે એફઆઈઆર નોંધાવ્યો હતો. તપાસ બાદ ટોળકીના નેતા સંતોષ અને રાધે સહિતના ડાકુઓ સામે તહોમતનામું નોંધાયું હતું. (એજન્સી) ■

કામદાર સંગઠનોની ખાનગીકરણ અને લેબર કોડની વિરુદ્ધમાં ૨૦ મેએ રાષ્ટ્રવ્યાપી હડતાળની હાકલ

નવી દિલ્હી : અનેક કામદાર સંગઠનોએ શ્રમિક સહિત કાઠી નાખવાની, ખાનગીકરણને રોકવાની અને ઈન્ડિયન લેબર કોન્ફેડરેન્સના માધ્યમથી નિયમિત વિચારવિમર્શ કરવા સહિતની માગણીના સમર્થનમાં ૨૦ માર્ચે રાષ્ટ્રવ્યાપી હડતાળ કરવાની હાકલ આપી છે. સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ અને ઈન્ડિપેન્ડન્ટ સેક્ટરલ ડેવરેશન અને એસોસિયેશનના મંચથી બોલાવવામાં આવેલા કામદારોના રાષ્ટ્રીય સંમેલનમાં બે મહિના ઝુંબેશ ચલાવવાના જાહેરનામાને સ્વીકારવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો અંત ૨૦ મેએ સામાન્ય હડતાળ વડે

આવશે. સંમેલનને સંબોધનાર નેતાઓએ જાહેરનામાને સમર્થન આપ્યું હતું. સંમેલનને ઈન્ટરકના અશોક સિંહ, આઈટુકના અમરજિત કૌર, એચએમએસના હરભજન સિંહ, આયટુકના હરિશ ત્યાગી, ટીયુસીસીના પ્રકાશ મેનને, સેવાના લતાબેન, એઆઈસીસીટીયુના રાજીવ ડિમરી, એલડીએફના જવાહર પ્રસાદ અને યુટીયુસીના અશોક ઘોષે સંબોધી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ભવિષ્યના ખેડૂતો અને કામદારોના રાષ્ટ્રવ્યાપી નિર્ણાયક આંદોલનની શ્રેણીનો પાયો ૨૦ મેની હડતાળ હશે. (એજન્સી) ■

મહાકુંભે દેશમાં એકતાની માનસિકતાને વધુ મજબૂત બનાવી: પીએમ

નવી દિલ્હી: મહાકુંભે દેશમાં એકતાની માનસિકતાને વધુ મજબૂત બનાવી હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું. મહાકુંભના સફળ આયોજને આયોજકોની ક્ષમતા સામે સવાલ ઉઠાવનારાંઓને જડખાતોડ જવાબ આપ્યો છે, એમ તેમણે કહ્યું હતું. લોકસભામાં નિવેદન કરતાં મોદીએ કહ્યું હતું કે સરકાર અને સમાજના અગણિત લોકોનું યોગદાન જ મહાકુંભના સફળ આયોજન પાછળનું મુખ્ય કારણ છે. લગભગ દોઢ મહિના જેટલો સમય અમે લોકોમાં મહાકુંભ માટે ઉત્સાહ અને ઉત્તેજનાની લાગણી નિહાળી હતી. સગવડ-અગવડને ધ્યાન પર લીધા વિના જે ભક્તિભાવથી લોકો મહાકુંભ

માટે ઊમટી પડ્યા હતા એ બાબત જ અમારી સૌથી મોટી તાકાત હતી, એમ મોદીએ કહ્યું હતું. એકતાનો અર્ક જ મહાકુંભને આપવામાં આવેલી સૌથી પવિત્ર ભેટ હતી. મહાકુંભ એવો પ્રસંગ હતો જેમાં ભાગ લેવા વિવિધ જાતિ, ધર્મ અને કોમના લોકો દેશના ખૂણેખૂણેથી આવ્યા હતા. લોકો તેમનો અહંકાર બાજુએ મૂકીને 'હું' નહીં પરંતુ 'અમે'ના ભાવ સાથે પ્રયાગરાજમાં ભેગા થયા હતા અને એમ કરીને તેમણે એકતા દર્શાવી હતી જે મહાકુંભની સૌથી મોટી તાકાત હતી. મહાકુંભ દરમિયાન એકતાની ભાવના એટલી મજબૂત હતી કે અન્ય કોઈ ભાગત-પ્રયાસો તેને તોડી નહોતા શક્યા. અમે હંમેશાંથી જ કહેતા આવ્યા છીએ કે વિવિધતામાં એકતા એ ભારતની ખાસિયત છે અને પ્રયાગરાજમાં અમે તેની અનભૂતિ કરી હતી એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે આ માનસિકતા જાળવી રાખવાની અને તેને વધુ મજબૂત કરવાની આપણી જવાબદારી છે. જુદી જુદી ભાષા બોલતા લોકોએ સંગમના તટે એક સૂરમાં 'હર હર ગંગે'ના કરેલા સૂત્રોચ્ચારે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નું દર્શન કરાવ્યું હતું અને આ બાબતે લોકોની એકતાની ભાવનાને વધુ મજબૂત કરી હતી. ૧૮૫૭નો બળવો હોય, ભારતની સ્વતંત્રતાનો દિવસ હોય કે પછી મહાકુંભ હોય આ દરેક પ્રસંગે દેશ વધુ જાગૃત બન્યો હોવાની ઝાંખી કરાવી હતી, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી) ■

ઈડીના સોરોસની ફિફિંગ એજન્સી પર દરોડા દક્ષિણ સ્પેનમાં અચાનક પૂરના કારણે ૩૫૦થી વધુ ઘરો ખાલી કરાવાયાં

નવી દિલ્હી (બેંગલુરુ : એન્ફોર્સમેન્ટ રિસ્કટરેટ (ઈડી)એ મંગળવારે અમેરિકાના અબજોપતિ જ્યોર્જ સોરોસે સ્થાપેલી 'પ્રાઈવેટ ફિફિંગ એજન્સી' ઓએસએફ અને એની ઈન્વેસ્ટમેન્ટની કંપની ઈડીએફના વિદેશી હુડિયામણના ભંગના કથિત કેસના ભાગરૂપે બેંગલુરુમાં દરોડા પાડ્યા હતા, એવી માહિતી ઈડીના સાધનોએ આપી હતી. સૂત્રોએ કહ્યું હતું કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (કેમા) હેઠળ ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સ (ઓએસએફ) અને ઈકોનોમિક ડેવલપમેન્ટ ફંડ (ઈડીએફ)ના લાભાર્થી અને અસ્પદા ઈન્વેસ્ટમેન્ટને લિમિટેડના આઠ ટેકાણા પર દરોડા પાડ્યા હતા. આમાં ઈન્ટરનેશનલ હુમન રાઈટ્સની અમુક બોડીનો સમાવેશ થાય છે. ઈડીના સૂત્રોએ અસ્પદા ઈન્વેસ્ટમેન્ટને સોરોસ ઈડીએફ (એસઈડીએફ)ની રોકાણની સલાહકાર કે ફંડ મેનેજર તથા મોરિશસની કંપનીની સંપૂર્ણ માલિકીની સ્વિસ્સિયરી ગણાવી હતી. એસઈડીએફ ઓપન સોસાયટી ફાઉન્ડેશનનો 'ઈમ્પેક્ટ ઈન્વેસ્ટમેન્ટ આર્મ' છે. સોરોસની બે એન્ટિટીના સોર્સથી કરાયેલા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) તથા અમુક લાભાર્થીએ કેમાની માર્ગદર્શિકાનો ભંગ કરીને આ ફંડનો ઉપયોગ કર્યો છે કે નહીં એ અંગેની આ તપાસ છે. ઈડીના સાધનોએ કહ્યું હતું કે ગુહ મંત્રાલયે ૨૦૧૬માં ઓએસએફને 'પ્રાયરર રેકરન્સ કેટેગરી' હેઠળ મૂકી હતી. આને લીધે એના પર ભારતની એનજીઓને 'અનિચંચિત' ડોનેશન આપવા પર અંકુશ હતો. આ હુકમને ચાલતી જવા ઓએસએફએ ભારતમાં સ્વિસ્સિયરી શરૂ કરી હતી અને એફડીઆઈના અને કન્સલ્ટન્ટ્સીના રૂપમાં ફંડ લાવી હતી અને આ ફંડનો ઉપયોગ કેમાનો ભંગ કરીને એનજીઓની પ્રવૃત્તિને નાણાં આપવામાં કરાયો હતો. (એજન્સી) ■

મેડ્રિડ: ભારે વરસાદથી શરૂ થયેલા અચાનક પૂરને કારણે દક્ષિણ સ્પેનમાં અધિકારીઓએ મંગળવારે ૩૫૦થી વધુ ઘર ખાલી કરાવ્યાં, રસ્તાઓ બંધ કરાવ્યા અને વર્ગો રદ કરવાની ફરજ પડી હતી. પ્રાદેશિક અધિકારીઓએ સોમવારે મોડી રાત્રે મલાગા શહેરની નજીકના કેમ્પનીલાસ ગામમાં ૩૬૫ ઘરને ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો કારણ કે નજીકની નદી તેના બેઉ કાંઠે વહી રહી હતી. સ્થળાંતર કરનારાઓએ મ્યુનિસિપલ સ્પોર્ટ્સ હોલમાં રાત વિતાવી હતી. આંદાલુસિયાના આંતરિક વડા એન્ટોનિયો સાન્એ જણાવ્યું હતું કે આંદાલુસિયામાં ૧૯ નદીઓ મંગળવારે પૂર માટે રેડ એલર્ટ પર હતી, કારણ કે ખરાબ હવામાન દક્ષિણ કિનારે માલાગાથી સેવિલા અને કોર્ડોબા નજીકના લેન્ડલોક વિસ્તારોમાં ફેલાયું હતું. આંદાલુસિયામાં કુલ ૪૦ હાઉસે તેમજ કેટલીક રેલ લાઈનો વધતા પાણીને કારણે બંધ કરવી પડી હતી. નવેમ્બરમાં માલાગાના સમાન વિસ્તારને ફટકો પડ્યો હતો જ્યારે ભારે વરસાદને કારણે દેશના પૂર્વમાં વિનાશક પૂર આવ્યું હતું, જેમાં મોટે ભાગે વેલેસ્સિયામાં ૨૩૦ લોકોનાં મોત થયાં હતાં. સ્પેન, જે તાજેતરનાં વર્ષોમાં લાંબા સમયથી વૃષ્ટકાળથી પીડાય છે, ખાસ કરીને તેના દક્ષિણમાં છેલ્લા બે અઠવાડિયાથી સતત વરસાદ પડ્યો છે, અને તાજેતરનું વાવાઝોડું જળાશયો અને નદીકાંઠાઓ માટે ઘણું વધારે આકરું સાબિત થયું છે. ■

પહેલા પાનાનું ચાલુ શેરબજારમાં શરૂઆ

ગુજરાતના ૧૮૦ ધારાસભ્યોની કુલ સંપત્તિ ₹ ૩૦૦૯ કરોડ

૫૫ ટકા ધારાસભ્યો ગ્રેજ્યુએટ પણ નથી

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: ચૂંટણી મોનિટરિંગ સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઇલેક્શન વોચ (એનઈડીવચ્યુ) એ રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વર્તમાન ધારાસભ્યોના સ્વ-સોગંદનામાનું વિશ્લેષણ કર્યું હતું કે, આ વિશ્લેષણમાં ગુજરાતના ધારાસભ્યો અંગે કેટલાક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હતા. જે મુજબ ગુજરાતના વર્તમાન ૧૮૦ ધારાસભ્યોની કુલ સંપત્તિ ૩૦૦૯ કરોડ રૂપિયા છે. રાજ્યમાં સૌથી વધુ ૬૬૧ કરોડની સંપત્તિ માણસાના ધારાસભ્ય જયંતી પટેલ પાસે છે. જ્યારે રાજ્યમાં ૨૧ ટકા એટલે કે ૩૭ ધારાસભ્ય સામે ગુના દાખલ થયેલા છે. ગુજરાતના ૨૬ ધારાસભ્ય સામે મહિલાવિરોધી ગુના,

હત્યા, હત્યાની કોશિશ, અપહરણ જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. દેશમાં સૌથી ઓછું ભણતર ધરાવતા ધારાસભ્યો ગુજરાતના છે. એડીઆર રિપોર્ટ મુજબ ગુજરાતના ૫૫ ટકા ધારાસભ્યો ગ્રેજ્યુએટ પણ થયેલા નથી. ગુજરાતના ૯૮ ધારાસભ્યો ધો.પથી ઓછું અથવા ધો.પથી ૧૨ અથવા ડિપ્લોમા સુધી અભ્યાસ કર્યો છે. ગુજરાત વિધાનસભામાં માત્ર ૧૪ મહિલા જ ધારાસભ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ૩૯ ધારાસભ્યો દ્વારા તેમની છેલ્લી ચૂંટણી લડતા પહેલા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાંથી લેવામાં આવ્યો છે. ધારાસભ્યોના સ્વ-સોગંદનામાના વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે દેશના ૧૮૬૧ ધારાસભ્યોએ પોતાના વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે. ■

સુરતના ગુનેગારો પર તંત્રની તવાઈ: મકાન પર બુલડોઝર ફરી વળ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરી વધી છે, અસામાજિક તત્ત્વો બેકામ બની જાહેરમાં હત્યા, લૂંટ, ચોરી, બળાત્કાર અને મિલકતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સમગ્ર રાજ્યમાં સક્રિય હોય તેવી અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરવા અને યાદી બનાવવા સૂચના આપી હતી. જે અનુસંધાને અમદાવાદના વજાલમાં આતંક મચાવનારી ટોળકીના મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યા બાદ સુરત અને ખાતે રાહુલ એપાર્ટમેન્ટ ગેંગના મકાન પર બુલડોઝર ફરી વળ્યું હતું. પોલીસના કડક બંદોબસ્ત સાથે ૩ મકાન તોડી પાડવામાં આવ્યા હતા. આરોપી રાહુલ દીપે સામે ગુજરાતીક, મારામારી, હત્યા જેવા ૨૨ ગુના નોંધાયેલા છે. તેની

સામે ઉધના પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી વખતે આસપાસના પોલીસ મથકના અધિકારીઓ, મનપા અને એસ.આર.પી ની ટીમની મદદ લેવામાં આવી હતી અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરતના ઉધના વિસ્તારમાં ‘રાહુલ એપાર્ટમેન્ટ’ નામથી ગેંગ ચલાવતા રાહુલ દીપેએ સરકારી આવાસ નજીક ગેરકાયદે રીતે ત્રણ મકાનો બનાવ્યાં હતાં. જેનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો. રાહુલ દીપે સૂચ્યાં મરાઠી મર્ડર કેસ સહિત મારામારી અને હત્યા ૨૨ જેટલા ગુનામાં સંડોવાયેલો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત ક્રાઈમ બ્રાન્ચે વિશેષ તપાસ દરમિયાન ૧૩૦૦ જેટલા ગુનેગારોની યાદી બનાવી છે. જેઓ ૩૦૦ જેટલા ગંભીર ગુનાઓમાં સામેલ છે. ■

જમીન માપણીનો વિરોધ કરતું ટી શર્ટ પહેરીને વિધાનસભામાં આવેલા ધારાસભ્ય હેમંત ખપા સસ્પેન્ડ

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. આમ આઠમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખપાએ જમીન માપણીના વિરોધમાં સ્ટીકર લગાવેલું ટી શર્ટ પહેરીને આવ્યા હતા. જેને દૂર કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે દૂર ન કરતાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આપના ધારાસભ્ય હેમંત ખપા ગુલમાં ખોટી જમીન માપણી ૨૬ કરો તેવું સ્લોગન લખેલું ટી શર્ટ પહેરીને આવ્યા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને ગુલમાં આ પ્રકારના વિરોધને મંજૂરી નથી તેમ કહ્યું હતું. ધારાસભ્યએ તેઓ માત્ર ભાજપ સરકારનું ખેડૂતોના પ્રશ્ને ધ્યાન ખેંચવા માગે છે તેમ જણાવ્યું હતું. જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખપાએ જણાવ્યું હતું કે, છેલ્લાં ૧૦ વર્ષથી ગુજરાતના ખેડૂતો ભૂલ ભરેલી જમીન માપણીથી તકલીફ ભોગવી રહ્યા છે. વર્ષ ૨૦૧૬માં ૨૫,૦૦૦ જેટલી અરજીઓ

પહેલા જ થઈ હતી. હાલ છેલ્લાં ૧૦ વર્ષમાં ૮૩,૦૦૦ અરજીઓ સામે માત્ર ૧૩,૦૦૦ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જેથી આની તપાસ થવી જોઈએ કારણ કે ભાજપના મળતિયાઓને લાભ કરાવવા ઉદ્દેશીને માપણી થઈ છે. એક ખાનગી એજન્સી દ્વારા ગુજરાતમાં વર્ષ ૨૦૦૯-૧૦માં પ્રમોલગેશન હેઠળ માપણી ચાલુ કરવામાં આવી અને વર્ષ ૨૦૧૪માં એટલે કે માત્ર ૪ વર્ષમાં પ્રમોલગેશન પૂરું કરવામાં આવ્યું. જ્યારે તેમાં રહેલી ભૂલો સુધારવા માટે આપણી સરકાર ૧૦ વર્ષથી સુધારે છે અને હજુ કેટલા વર્ષ લાગશે તે કહેવું મુશ્કેલ છે. હેમંત ખપાએ તેમના બચાવમાં જણાવ્યું હતું કે, વિધાનસભામાં શાસક પક્ષ ભાજપના ૧૬૦ ધારાસભ્યો હોવાના કારણે મને કોઈ નિયમ વગર જ માત્ર ટી શર્ટ કે જેમાં ખોટી જમીન માપણી ૨૬ કરો લખેલો હોઈ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ■

ગુજરાતના ૨૨ જિલ્લાઓમાં પારો ઊંચકાયો: એપ્રિલમાં કમોસમી વરસાદની આગાહી

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: ગુજરાતમાં હોળી પછી રાજ્યમાં ગરમીનું સ્તર સતત વધી રહ્યું છે. રાજ્યના મોટાભાગનાં શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમી પડશે. હવામાન વિભાગે ૧૮ માર્ચથી ૨૦ માર્ચ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોના વિવિધ ભાગોમાં ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેવાની આગાહી કરી હતી. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં તીવ્ર ગરમીનો સમગ્રભાગે આખા માર્ચ મહિના સુધી ચાલુ રહેવાનો છે. જોકે એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. આગામી ૪ દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેવાની આગાહી છે. હાલમાં ગુજરાતમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતનાં

વણાં શહેરોમાં રાત્રિનું તાપમાન પણ વધી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ૧૯ એપ્રિલ પછી રાજ્યમાં ગરમી વધુ વધવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી પડશે. કચ્છમાં હજુ પણ તીવ્ર ગરમીની અસર ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે કચ્છના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું હતું. દીવમાં ગરમીની ચેતવણી અને યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું હતું. વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્વાત બની શકે છે, જે ગુજરાતના કેટલાક વિસ્તારોને અસર કરી શકે છે. એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદની સાથે ભારે પવન અને ચક્વાતની પણ શક્યતા છે. ૧૪ એપ્રિલથી જોરદાર પવન ફૂંકાઈ શકે છે, જ્યારે ૧૯, ૨૦ અને ૨૧ એપ્રિલે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન ઊંચું રહી શકે છે. ૨૬ એપ્રિલે ખૂબ ગરમી પડી શકે છે. ■

ધોલેરા ‘સર’ કાર્યરત થતાં આઠ લાખ જેટલી રોજગારીનું સર્જન થશે: જગદીશ વિશ્વકર્મા

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: વિધાનસભા ગુલમાં અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેથી ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અંગેના પ્રશ્નનો મુખ્યપ્રધાન વતી પ્રત્યુત્તર આપતાં રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે શ્રીન ક્લિડ અલોચમેન્ટમાં રૂ. ૩૫૦.૪૯ કરોડના ખર્ચે ૯.૫૬ કિ.મી. લંબાઇના લિંક રોડનું બાંધકામ હાથ ધરવામાં આવનાર છે. ધોલેરા ‘સર’ (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન)ની વિગતો આપતાં જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે આશરે ૯૨૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન તરીકે એક શ્રીનક્લિડ ઇન્વેસ્ટિગેટિવ સ્માર્ટ સિટી આકાર પામી રહ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં ૧૫૩ ચોરસ કિલોમીટર વિસ્તારમાં કામગીરી હાથ ધરી છે. ધોલેરા ‘સર’ ખાતે રિન્યુ દ્વારા સોલાર સેલ તેમજ સોલાર મોડ્યુલના ઉત્પાદનની ડેસિલિટી કાર્યરત છે તેમજ ટાટા પાવર દ્વારા ૩૦૦ મેગા વોટનો સોલાર પ્લાન્ટ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. આ જ પ્રકારે, પોલિટેક દ્વારા ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઉત્પાદન યુનિટના નિર્માણની તથા ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રા.લિ. દ્વારા સમગ્ર દેશમાં પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ડેસિલિટી નિર્માણની કામગીરી પણ પ્રગટિ હેઠળ છે. સમગ્ર ધોલેરા ‘સર’ દ્વારા ભવિષ્યમાં ૮ લાખ જેટલી રોજગારીનું સર્જન થવાની શક્યતા છે. ■

રાજ્યમાં ૧૩,૮૫૨ વિદ્યા સહાયકની ભરતી પ્રક્રિયાની કાર્યવાહી હાલ પ્રગતિમાં: ડો. કુબેર કિંડોર

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં શિક્ષણ વિભાગની વર્ષ ૨૦૨૪-૨૬ ની અંદાજપત્રીય માગણીઓ અંગે ચર્ચા કરતાં શિક્ષણ પ્રધાન ડો. કુબેર કિંડોરે જણાવ્યું હતું કે, ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ગુજરાતની શાળાઓમાં વર્લ્ડક્લાસ શિક્ષણ આપવું એ જ રાજ્ય સરકારનો નિર્ધાર છે. વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણના મહત્વને સમજાવે આ અંદાજપત્રમાં આ વર્ષે શિક્ષણ વિભાગને રૂ. ૫૯,૯૯૯ કરોડ જેવી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૪-૨૫ માં સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાહીકામાં કુલ ૫,૨૮,૩૬૯ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાયો છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો-૧ થી ૫ માં ૫,૦૦૦ અને ધો-૬ થી ૮ માં ૭,૦૦૦ તથા ૧૮૫૨ અન્ય માધ્યમ માટે મળી કુલ ૧૩,૮૫૨ વિદ્યા સહાયકની ભરતીની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે. જ્યારે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજિત ૯,૦૦૦ શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત કુલ ૨૪,૪૫૧ શાળાઓમાં કુલ ૧,૦૬,૮૦૪ જ્ઞાપકુજ

સ્માર્ટ ક્લાસ વિકસાવવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પીએમશ્રી (જીઓજી) શાળા યોજના શરૂ કરવા રૂ. ૧૦૬.૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે. ગુજરાતની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ઓલિમ્પિક માટે તૈયાર કરવા માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી સાથે રહી તૈયારી કરાવવા માટે રૂ. ૫.૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે. તે જ પ્રકારે રાષ્ટ્ર ટ્રુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત રાજ્યની ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે રૂ. ૭૮૧.૬૦ કરોડની જોગવાઈ, નમો લક્ષ્મી યોજના માટે રૂ. ૧.૨૫૦ કરોડની જોગવાઈ, રાજ્યના અભ્યાસ અર્થે એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને એસ.ટી.બસ. પાસ ફી કન્સેશન રૂ. ૨.૨૩.૦૦ કરોડની જોગવાઈ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે રૂ. ૨.૫૦ લાખ વિદ્યાર્થીઓને સહાય માટે રૂ. ૨.૨૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ હેઠળ અંદાજે ૭૫ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ યોજનાનો લાભ આપવા રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ■

આક્રમક બેટર-કેપ્ટન સૌરવ ગાંગુલી બની ગયો અગ્રેસિવ ‘પોલીસ અધિકારી’!

કોલકાતા: ‘બાકી: ધ બેન્ગોલ ચેપ્ટર’ નામની નીરજ પાને દિગ્દર્શિત વેબસીરીઝ થોડા દિવસથી ચર્ચામાં રહી છે અને હવે આ સિરીઝ ગુરુવાર, ૨૦મી માર્ચે રિલીઝ થવાને આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સૌરવ ગાંગુલીવાળો એનો રોમાંચક પ્રોમો વાહરલ થયો છે. આક્રમક બેટર તરીકે જાણીતા સૌરવ ગાંગુલીએ પોતાના નેતૃત્વ સાથે ભારતીય ટીમમાં મોટું પરિવર્તન લાવી દીધું હતું. ક્રિકેટના મેદાન પર આક્રમકતા માટે જાણીતો ગાંગુલી આ પ્રમોશનલ વીડિયોમાં ઇમાનદાર પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળે છે. નેટફ્લિક્સ પર ગાંગુલીના આ પ્રોમોએ સૌને ચોંકાવી દીધા છે. ખરેખર તો તે આ રોલ માટે ઓડિશન આપતો જોવા મળ્યો હતો. એક તબક્કે ગાંગુલી મજાકમાં એક કેદીની આકરી પૂછપરછ કરી રહેલો જોવા મળ્યો. જાણે



તેણે ભૂતકાળમાં ક્રિકેટના મેદાન પરના હરીફો સામેના ઝનૂનેને (ખાસ કરીને ભૂતપૂર્વ હેડ-કોચ ડેવિડ વોલે પરના ગુસ્સાને) ફરી યાદ કરી લીધા હોય એવું આ પ્રોમો પરથી લાગે છે. ગાંગુલીને કાઠમ ધ્રિવર અને પોલીસ અધિકારીના રોલ ખૂબ પસંદ છે અને એમાં તે ‘બાકી’ના પ્રોમો સાથે જોડાયો એ બદલ ખૂબ આનંદિત છે. ■

ગાવસકરની ‘સ્ટુપિડ, સ્ટુપિડ, સ્ટુપિડ...’ની ટકોરને રિષભ પંટે માર્કેટિંગમાં રમૂજી બનાવી



નવી દિલ્હી: જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસકર ટ્રોફીની એક મેચ દરમિયાન રિષભ પંટે ખરાબ શોટમાં વિકેટ ગુમાવી દીધી ત્યારે સુનીલ ગાવસકરે ‘સ્ટુપિડ, સ્ટુપિડ, સ્ટુપિડ...’ બોલીને પંટના એ અભિગમને ખૂબ વખોડ્યો હતો, પરંતુ હવે રિષભ પંટે એ જ ત્રણ શબ્દોનો ઉપયોગ માર્કેટિંગમાં કર્યો છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ ટેસ્ટની સિરીઝમાં ૧-૩થી હારી ગઈ હતી. આ વખતે પણ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ ખુદ બોર્ડર-લેજન્ડ સુનીલ ગાવસકરના નામે જ રમાઈ હતી. મેલબર્ન ખાતેની ચોથી ટેસ્ટના પ્રથમ દાવમાં રિષભ પંટે જોખમ ખેડીને સ્કોટ બોલેન્ડના એક બોલમાં સ્કૂપ મારવાના પ્રયાસમાં ક્રેંચ આપી દીધો હતો. ગાવસકર ત્યારે કોમેન્ટરી બોક્સમાં હતા અને તેઓ પંટના આ શોટથી ખૂબ નારાજ થયા હતા. ગાવસકરે ‘સ્ટુપિડ, સ્ટુપિડ, સ્ટુપિડ’ની કમેન્ટથી પંટની ઝાટકણી કાઢવાનું શરૂ કર્યું હતું અને કોમેન્ટરીમાં જણાવ્યું હતું કે ‘અરે ભાઈ, ડીપ ફાઈન લેગમાં બે ફીલ્ડર ઊભા હતા અને તારે ત્યાં જ શોટ મારવો હતો! હજી પાછલા જ બોલમાં તું આવા શોટમાં બચી ગયો હતો અને બીજા જ બોલમાં જોખમ ઊઠાવ્યું. આને તું તારી નેચરલ ગેમ કહે છે? તે તો વિકેટ ફેંકી દીધી. આ શોટ મારીને તે સાવ મૂકે જેવું કામ કર્યું. તે આ જે કર્યું એની ટીમ પર વિપરીત અસર પડી શકે. તારે હેમશાં પરિસ્થિતિ જોઈને રમવું જોઈએ.’ રિષભ પંટે વિકેટ ફેંકી દીધી એટલે ગાવસકરનો ક્રોધ સમાતો નહોતો. પંટે પેવિલિયનમાં પાછો આવી રહ્યો હતો ત્યારે ગાવસકર બોલ્યા, ‘તેણે આ (ભારતના) ડ્રેસિંગ રૂમમાં ન જવું જોઈએ. તેણે બીજા જ (ઓસ્ટ્રેલિયાના) ડ્રેસિંગ રૂમમાં જતા રહેવું જોઈએ.’ બીજો કોઈ ખેલાડી હોત તો તેણે ગાવસકરની સ્ટુપિડવાળી કમેન્ટને કદાચ મન પર લઈ લીધી હોત. જોકે રિષભ પંટે એ ટિપ્પણીનો માર્કેટિંગમાં ઉપયોગ કર્યો છે અને ચાહકોને હસાવ્યા છે. રિષભ પંટે બાવીસમી માર્ચે શરૂ થતી આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમની કેપ્ટન્સી સંભાળશે. આ ટીમ માટેની એક જાહેરખબરના શૂટિંગમાં રિષભ પંટે ગાવસકરની ‘સ્ટુપિડ, સ્ટુપિડ, સ્ટુપિડ’ કમેન્ટને મૂકી રીતે રીકેન્ડેટ કરી હતી જેનો વિડીયો વાઈરલ થયો છે. ■

પ્રવાસના ફર્સ્ટ હાફમાં માત્ર ક્રિકેટ અને સેકન્ડ હાફમાં પરિવારજનોનો સંગાથ: કપિલ દેવ વિદેશી ટૂરમાં ખેલાડીઓ સાથે ફેમિલી હોવી જોઈએ કે નહીં? એ મુદ્દે ૧૯૮૩ના ચેમ્પિયન કેપ્ટન કપિલે પોતાના સમયની રસપ્રદ વાત કરી

નવી દિલ્હી: ક્રિકેટ-લેજન્ડ કપિલ દેવના મતે વિદેશ પ્રવાસમાં પરિવારજનોને પોતાની સાથે લઈ જવાની ભારતીય ખેલાડીઓને છૂટ મળવી જોઈએ, પરંતુ આવા ચર્ચસ્પદ વિષયમાં સંતુલિત અભિગમ પણ હોવો જરૂરી છે. કપિલે આવું કહીને આ સંબંધમાં પોતાના સમયની રસપ્રદ વાત પણ કરી છે. ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં ભારતીય ટીમ ૧-૩થી ટેસ્ટ-સિરીઝ હારીને પાછી આવી ત્યાર બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે નવો નિયમ બનાવ્યો હતો જેમાં જણાવાયું હતું કે હવે પછી ટૂંકા પ્રવાસમાં ખેલાડીઓ પત્ની, ગર્લફ્રેન્ડ કે પરિવારજનોને ફક્ત એક અઠવાડિયા સુધી પોતાની સાથે રાખી શકશે અને જો પ્રવાસ ૪૫ દિવસ કે વધુ દિવસોનો હશે તો ખેલાડીઓ સાથે તેઓ વધુમાં વધુ ૧૪ દિવસ સુધી જ રહી શકશે. જોકે વિરાટ કોહલીએ તાજેતરમાં આ નિયમ વિશે આડકતરી રીતે અણગમો બતાવ્યો હતો અને એક ઇવેન્ટમાં કહ્યું હતું કે પ્રવાસમાં પરિવારજનોને પોતાની સાથે રાખવાથી ખેલાડીઓને મનોબળ મજબૂત કરવામાં મદદ મળે છે, પણ આ વાત કેટલાક લોકોને નથી સમજાતી. તાજેતરમાં ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા દુખઈ ગઈ હતી ત્યારે કોહલી તેમ જ રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી પોતાના પરિવારજનોને પોતાની સાથે ત્યાં લઈ ગયા હતા. એ ટૂરમાં પરિવારજનો આ ખેલાડીઓની ટીમની હોટેલમાં નહોતા રહ્યા અને પરિવારજનોનો રહેવા, જમવા સહિતનો બધો ખર્ચ બીસીસીઆએ નહીં, પણ સંબંધિત ખેલાડીઓએ ઉઠાવ્યો હતો. ૧૯૮૩ વર્લ્ડ કપના ચેમ્પિયન કેપ્ટન કપિલ દેવે અહીં ‘કપિલ દેવ ગ્રાન્ટ થોર્નટન ઇન્વિટેશનલ’ ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘ખેલાડીઓ માટેનો આ નિયમ ક્રિકેટ બોર્ડનો છે જે વિશે હું એટલું જ કહીશ કે પ્રવાસ દરમિયાન ખેલાડીને પોતાના પરિવારનો સંગાથ મળે એ જરૂરી છે, પરંતુ પ્રબળ ટીમભાવના જળવાય એ પણ અત્યંત જરૂરી છે. અમારા સમયમાં (ક્રિકેટ બોર્ડ નહીં, પણ...) અમે પોતે ખેલાડીઓ જ અંદરોઅંદર નક્કી કરી લેતા હતા કે ટૂરના ફર્સ્ટ હાફમાં ખેલાડીઓ માટે ક્રિકેટ જ સર્વસ્વ હોવું જોઈએ અને



દિલ્હીમાં ગઈ કાલે કપિલ દેવના નામની ગોલ્ડ ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું એ પ્રસંગે કપિલ ઉપરાંત દેશના યુવા ગોલ્ડ ખેલાડીઓ કરણ પ્રતાપ સિંહ તથા વ્લેસા મલિક તેમ જ અન્ય મહાગુભાવો ઉપસ્થિત હતા. (પીટીઆઇ)

સેકન્ડ હાફમાં ફેમિલીના મેમ્બર્સ ભલે પ્રવાસમાં તેમની સાથે જોડાય અને ક્રિકેટ એન્જોય કરે. ટૂંકમાં, ખેલાડીઓએ ક્રિકેટ રમવા પર અને ફેમિલી મેમ્બર્સના સંગાથ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું જોઈએ.’ કપિલ દેવ હાલમાં પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયા (પીજીટીઆઇ)ના પ્રમુખપદે છે. તેમનું એવું મંતવ્ય છે કે ‘ટૂર દરમિયાન ખેલાડીઓ સાથે તેમના પરિવારજનો હોવા જોઈએ. ખેલાડીને માનસિક દબાણમાંથી બહાર લાવવામાં તેમના પરિવારજનોની હાજરી ફાયદાકારક થઈ શકે. ખેલાડી પ્રેશરવાળી સ્થિતિમાં હોટેલની રૂમમાં ઉઠાસ લાવતાં એકલો બેઠો રહે એના કરતાં આસપાસ જો પરિવારના મેમ્બર્સ હોય તો તેને એ તંગ સ્થિતિમાંથી બહાર આવવામાં ઘણી મદદ મળી શકે.’ ■

ક્રિકેટરે ૪૦ ઓવર સુધી ૪૨ ડિગ્રી ગરમીમાં ફીલ્ડિંગ કરી અને પછી મેદાન પર જ છેલ્લા શ્વાસ લીધા

એડિલોઇડ: પાકિસ્તાની મૂળના ક્રિકેટર જુનેલ ઝફર ખાન નામનો ક્રિકેટર શનિવારે ઓસ્ટ્રેલિયાના એડિલોઇડ શહેરના કોન્કોર્ડિયા કોલેજ ઓવલ ગ્રાઉન્ડ પર લાભગમ ૪૨ ડિગ્રી તાપમાન વચ્ચે રમતી વખતે ઢળી પડ્યો હતો અને મૃત્યુ પામ્યો હતો. આ કલબ સ્તરની મેચ હતી જેમાં જુનેલે ૪૦ ઓવર સુધી ફીલ્ડિંગ કરી હતી અને પછી સાત ઓવર બેટર તરીકે કીઝ રહ્યો હતો. આ મેચ દરમિયાન તાપમાન ૪૧.૭ ડિગ્રી સુધી પહોંચ્યું હતું. ૪૦ વર્ષની ઉંમર ઓળંગી ચૂકેલો જુનેલ ઓલ્ડ કોન્કોર્ડિયન્સ

ક્રિકેટ ક્લબ વતી પ્રિન્સ આલ્ફ્રેડ ઓલ્ડ કોલેજિયન્સ સામેની મેચમાં રમી રહ્યો હતો ત્યારે આ કરુણ ઘટના બની હતી. સ્થાનિક મીડિયામાં જણાવાયું હતું કે રમણ મહિનો ચાલી રહ્યો છે અને જુનેલ ઉપવાસ કરી રહ્યો હતો. જોકે તબિયત સારી ન હોય તો થોડું-થોડું પાણી પી શકાય એવા પોતાના ધર્મમાં મળતી છૂટછાટને આધારે જુનેલે દિવસ દરમિયાન કેટલીક વાર પાણી પીધું હતું એટલે તેને હિડાઇગેશન જેવી કોઈ સમસ્યા નહોતી એવું જણાવાયું હતું. ■

હાર્ડ હિટર શેફાલી વર્મા ચમકી બોલિંગમાં, હેટ-ટ્રિક લીધી

ગુવાહાટી: સામાન્ય રીતે આક્રમક બેટિંગથી ભારતને તેમ જ સ્થાનિક ક્રિકેટમાં પોતાની ટીમને વિજય અપાવવા માટે જાણીતી મહિલા ઓપનિંગ બેટર શેફાલી વર્માએ સોમવારે કોડાની ફાઇનલ બતાડી હતી. તેણે અહીં વિમેન્સ અન્ડર-૨૩ વન-૨૦ ટ્રોફીમાં હેટ-ટ્રિક લીધી હતી. શેફાલી પાર્ટ-ટાઇમ

આંક સ્પિનર છે. સોમવારે તેણે હરિયાણા વતી રમતી વખતે કણ્ઠાટિક સામેની મેચમાં ઓવરના છેલ્લા બે બોલમાં સલોની પી. અને સોમ્યા વર્માની વિકેટ લીધી હતી અને ત્યાર પછીની પોતાની ઓવરના પહેલા જ બોલમાં નમિતા ડિસોઝાને કલીન બોલ્ડ કરીને હેટ-ટ્રિક નોંધાવી હતી અને હરિયાણાને વિજય અપાવ્યો હતો. ■

પાકિસ્તાન ફરી પટકાયું, હવે સિરીઝ ગુમાવવાની તૈયારીમાં જ છે બે કિવી ઓપનરે બાર બોલમાં કુલ સાત સિક્સર ફટકારીને ધમાલ મચાવી દીધી!

નેડેન: પાકિસ્તાનની ટીમ અહીં ગઈ કાલે સતત બીજી મેચ હારી ગઈ હતી. ન્યૂ ઝીલેન્ડ ફરી વિજય મેળવીને ૨-૦થી સરસાઈ મેળવી લીધી છે. પાકિસ્તાનની ટીમ ગઈ કાલે બેટિંગ મળ્યા પછી વરસાદને પગલે નિર્ધ

સંસ્થા સમાચાર

પ.પૂ. મુનિરાજ શ્રી વિશ્વનાંદવિજયજી મ.સા.ની આદિ થાણા-ની શ્રીકલ્યાણકારી રાજસ્થાન જૈન સંઘ આરાધના ભવનમાં સ્થિરતા

શ્રી પ્રેમ-ભુવન-જયઘોષ વિહાર કરતા કલ્યાણ (પ.)માં શ્રી સમુદાયના પ.પૂ. ગરુહાધિપતિ આચાર્ય ભગવંત શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞામાં જિનશાસનમાં અનેક ધાર્મિક કાર્યોના પ્રેરક-માર્ગદર્શક, પચાસ ચાતુર્માસની સફળ યાત્રા કરનારા પ.પૂ. વડીલ મુનિરાજ શ્રી વિશ્વનાંદવિજયજી મ.સા. અને પૂ. મુનિરાજજી શ્રી હેમકીર્તિ વિજયજી મ.સા. અને પ.પૂ. મુનિરાજજી પ્રિતયશવિજયજી મ.સા. આદિ થાણા-થાણા (પ.) શ્રી મુનિસુવ્રતસ્વામી નવપદ જિનાલયથી

મુંબઈમાં હિટવેપની ચેતવણી

મુંબઈ: છેલ્લા થોડા દિવસથી મુંબઈ અને પુણેમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં તાપમાન ઊંચું રહેવાની ધારણા છે. આગાહી મુજબ, હવામાનની પેટર્ન સ્થિર રહેશે, અને અઠવાડિયા દરમિયાન ગરમીમાં મહોત્સવ-સ્વદરવ્યથી નિર્માણ કરનારા શ્રી હીરાચંદજી ભગવાનજી ફોલ્દલામુખા (આહોરવાળા) એ શ્રી કલ્યાણકારી રાજસ્થાન જૈન સંઘને સુપરત કરી, જેની પચીસમી વર્ષગાંઠ ઉજવવામાં આવી. સંઘના આરાધના ભવનમાં મુનિરાજ શ્રી વિશ્વનાંદવિજયજી મ.સા. પચાસ વર્ષની ચાતુર્માસ દરમિયાન અનુભવોની ગાથા વ્યાખ્યાનમાં આપે છે.

હિન્દુ મરાઠ

સ્વ. મંજુલાબેન જેઠવા (ઉ.વ. ૬૭) મુંબઈ નિવાસી હાલ વાલેકંબર સ્વ. કાંતિભાઈના પત્ની-નીલમ, ભાવિનાના માતા. સ્વ. અનિલાભાઈ ગોહિલ તથા જાઓના સાસુ, અંશ, તનિયાના દાદી. યોગી, યશના નાની તા. ૯-૩-૨૫ના રવિવારે શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૦-૩-૨૫ના ગુરુવારે, ૧૨થી ૧. કે. ભારતીય વિદ્યાભવન, ચોપાટીમાં રાખેલ છે. સૌરાષ્ટ્ર વિવેક મેઘાડા સમાચાર સ્વ. વાસુદેવ કાનજીભાઈ દેસાઈ અને ગં. સ્વ. નીલાબેન વાસુદેવ દેસાઈના પુત્ર મહેલભાઈ દેસાઈ (ઉ.વ. ૫૨), રવિવાર, ૧૬-૩-૨૫ના રોજ દેવલોક પામ્યા છે. તે કોપાના પતિ. સ્તુતિના પિતા. અલ્યા તુષાર પાંક, મિલન, જગદીશ અને પંકજના ભાઈ. અનુપમાના જેઠ. પૂર્વી, ગીતાના દિયર. ગં. સ્વ. મીનાબેન કૌશિકભાઈ પટેલના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૦-૩-૨૫, ગુરુવાર, સાંજે ૫ થી ૭. દેહાણું: રોહીલી પાર્ક હાઈટ સ્કિંગ, 'એ' લેંગ, કોમ્પ્યુટરી હોલ બિલ્ડિંગના ૧લા માળે, માગધાણે મેટ્રો સ્ટેશનની પાસે, બોરીવલી (પૂર્વ).

પારસી મરાઠ

ગોલી કેડી કામા તે મરહુમ કેડીના ધણિયાની. તે મરહુમો ખોરશેઠ સોમણ અમરોલીલાલના દીકરો. તે માહતાબ, હોરમઝ તે મરહુમ ફરુજાનાના માતાજી. તે મરહુમ શેહરુઝા બેન. તે યોહાન તે શાહવીરના બપ્પ. તે સ્થાન તે સંદયાનાના મમજીજી. (ઉ.વ. ૮૦) તા. ૩. ઇ-૧૨, જરબાગ ભોંયતળિયે, ડો.અંબેડકર રોડ. ગલોરીયા ચર્ચ આગળ, ભાઇબલા, મુંબઈ ૪૦૦૨૦૭. ઉક્તપ્રાણીનિ: ક્રિયા તા. ૧૯-૩-૨૫ને દીને બપોરે ૩.૪૫ વાગે મઝગાવ પટેલ અગિયારીમાં.

જૈન મરાઠ

દેરાવાસી જૈન રાધનાપુત્રી નિવાસી હાલ કાંદિવલી સુશીલાબેન સિકલવાલ દાદીના સુપુત્ર હિરોભાઈ દોશી (ઉ.વ. ૭૫) તે બીનાબેનના પતિ. રીડું કેપન મહેતા અને કેપન બીનીતાના પિતાશ્રી. માનવ-દક્ષના-ક્રિયા-અશ્લતા દાદા. જયોરસના સ્વેચ્છા અને વર્ષા રાજેશ્વરના ભાઈ. તારાબેન સિકલવાલ જવેરીના જમાઈ તા. ૧૯-૩-૨૫ના મંગળવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ઔરંગઝેબની કબર તોડનારને ઈનામ આપીશું: શિવસેના

મુંબઈ: શિવસેનાના કાર્યકરોએ મંગળવારે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનમાં મોગલ સમ્રાટ ઔરંગઝેબની કબર તોડનાર કોઇ પણ વ્યક્તિને પાંચ વિઠા ખેતીની જમીનનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, એવી માહિતી જિહ્વાપ્રમુખ બિહુ શીખેશને જણાવ્યું હતું. ઔરંગઝેબ સાથે સંકળાયેલાં ઐતિહાસિક સ્થળોને દેશમાંથી દૂર કરવા જોઇએ અને એવો આરોપ પણ લગાવ્યો હતો કે મોગલ શાસકે હિન્દુઓ પર ગાસ ગુજાઈ હતો. ઔરંગઝેબના નામ પર રાખવામાં આવેલા તમામ સ્થળોને દૂર કરતું એક મેમોરેન્ડમ પણ વડા પ્રધાનને મોકલવામાં આવ્યું હતું. ઔરંગઝેબ મામલે નાગપુરમાં સોમવારે રાતે જ હિંસા થઈ હતી એમાં આ ઇનામની જાહેરાતથી તાણ વધશે.

તેમણે કહ્યું હતું કે કુરિયર કંપનીઓની કચેરીમાં તપાસ કરવામાં આવી છે અને તેમને ચેતવણી આપવામાં આવી છે કે જો તેમના માધ્યમથી ડ્રગ્સની હેરાફેરી થઈ હોવાનું જણાશે તો તેમને જવાબદાર ઠેરવવામાં આવશે. ફંડાણીસે કહ્યું હતું કે સરકાર નાર્હિજિરિયનો અને અન્ય દેશનું નાગરિકવ ધરાવતા લોકોનું સરકાર ટ્રેકિંગ કરી રહી છે. જોકે, જ્યાં સુધી તેમની સામેના કેસનું નિરાકરણ ન થાય ત્યાં સુધી તેમનું પ્રત્યાર્પણ કરી શકાતું નથી. પુણેમાં સાત પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી તેમણે ગુલને આપી હતી અને ડ્રગ્સના મામલે રાજ્ય સરકારની નીતિ ઝીરી ટોલરન્સની હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો.

હિન્દુ મરાઠ

મોરબી નિવાસી હાલ બોરીવલી, સ્વ.જયંતીલાલ મગનલાલ ગાંધીના ધર્મપત્ની પદમાબેન (ઉ.વ. ૭૯) ૧૭/૩/૨૫ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.રતિલાલ પાંચબના દીકરી. જીનેન્દ્ર, દીપ્તિ, ચેતના અમિત દેહિયા, સ્વ.રેખા જીનેન્દ્ર ગાંધી તથા સંગીતા તુષાર નેતરીયાના માતૃશ્રી. રમી જીનેન્દ્ર ગાંધીના સાસુ. દેવાંશના દાદી. અલિય, દર્શન, ધર્મના નાની. સાહરૂ તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. દશા સોરકિયા વર્ણિક પોરબંદર નિવાસી હાલ ગોરંગેઝ, અ. સો. અરુણાબેન વિરેન્દ્રભાઈ ધ્રુવ તા. ૧૭-૩-૨૫ના શ્રીજીશરણ પામ્યા છે. તે રાધિકા, નિકિતા અને હિમાંશુના માતૃશ્રી. ગોપાલ જવેરી, ભાવિક સંઘવી, રિયા હિમાંશુ ધ્રુવના સાસુ. સ્વ.વિલાસભાઈ, સ્વ.રજનીકાંતભાઈ, ચેતનાબેન, અરુણાબેન, પ્રતિભાબેન, જયંતિભાઈ શાહના ભાભી. પીયરપબે સ્વ.દ્વારકાશ્ય સ્મીતચંદ સાંગાણીના દીકરી. સ્વ.જયંતિભાઈ, સ્વ.અરવિંદ ભાઈ, સ્વ.હરમુખભાઈ, લલિતાભાઈ, સ્વ.પુષ્પાબેન ચીમનલાલ ઘાળખીયા, સુસ્માબેન વસંતભાઈ

પારસી મરાઠ

ગામ તાજપરવાળા હાલ મલા, શૈલેષભાઈ હરસોરના ધર્મપત્ની. અ.સૌ. ચૈતા હરસોરા (ઉ.વ. ૭૮) તા. ૧૭/૦૩/૨૫ના શ્રીજીશરણ પામ્યા છે, તે સ્વ. છગનભાઈ માલજીશરણ હરસોરા, ગં.સ્વ. હંસાબેન હરસોરના પુત્રવધૂ. સ્લીક અને મંરના માતૃશ્રી, અ.સૌ કિયંચદા અને રહેશભાઈ પોંઘાની સુપુત્રી. અરૂણભાઈ, છગનભાઈ, આરતી કીરીટભાઈ પ્રવેલીયા, કલિતા મુકેશભાઈ કવાના ભાઈના પત્ની. નયાબેનના દેરાણી. બેસણું ગુરુવાર તા. ૨૦/૦૩/૨૫ને ૫ થી ૭. શ્રી હુણાર વેલ્ડેર સેન્ટર, ક્રદર રોડ નં ૩, અંબાજીમંદિર પાસે, બોરીવલી પૂર્વ.

જૈન મરાઠ

દશા શ્રીમાળી સ્વા. જૈન ચલગા ઉનાવા નિવાસી હાલ અમદાવાદ, સ્વ. રમાબેન નરેન્દ્રભાઈ લાલશંકર મહેતાના સુપુત્ર. દર્શનાબેનના પતિ. સ્વ. જાનકિકા મિલનકુમાર દક્કરી, મુંજાલ મહેતાના માતાભાઈ. ધર્મશ અને શિલિજાના પિતા. દેવાંગ દિનેશ્વર ઉપાધ્યાયના સસરા. મંજુલાબેન ચંડુલાલ ભાવસારના જમાઈ આદેશ મહેતા (ઉ.વ. ૬૯) તા. ૧૬-૩-૨૫ના હાટકેશ શરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

સક્ષમ અને દિવ્યાંગ એમ બેઉ રીતે પૂજા ખેડકર પરીક્ષા ન આપી શકે: સુપ્રીમ કોર્ટ

મુંબઈ: સુપ્રીમ કોર્ટે ગઇ કાલે ભૂતપૂર્વ આઇએએસ પ્રોબેશનર પૂજા ખેડકરને જણાવ્યું હતું કે તે પરીક્ષા પાસ કરવા માટે સક્ષમ ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવાર તરીકે અલગ-અલગ પ્રયાસોનો લાભ લઈ શકે નહીં. પૂજા ખેડકર પર સિવિલ સર્વિસીસ

શર્માની બેન્ચે તેમની અરજી પર વધુ સુનાવણી ૧૫ એપ્રિલના રોજ મુલતવી રાખી હતી. સુપ્રીમ કોર્ટે ૧૫ જાન્યુઆરીએ ખેડકરને ધરપકડથી મળેલી સુરક્ષાને ૧૫ એપ્રિલ સુધી લંબાવી દીધી હતી. દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ

સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ જણાવ્યું હતું કે યુપીએસસી ઉમેદવારો માટે નક્કલી ડિસએબિલિટી સર્ટિફિકેટ તૈયાર કરવાના કથિત કૌભાંડમાં સંડોવાયેલા વચેદિયાઓની ઓળખ મેળવવા માટે ખેડકરની કરડટીમાં પૂછપરછ કરવાની જરૂર છે.એડિશનલ

સોલિસિટર જનરલે વધુમાં જણાવ્યું હતું કે ખેડકરને નિયમિત અભ્યાસક્રમમાં યુપીએસસી પરીક્ષા પાસ કરવા માટે નવ પ્રયાસોની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ નક્કલી દિવ્યાંગ પ્રમાણપત્ર તૈયાર કરીને, તેણે પરીક્ષા માટે વધારાના પ્રયાસો કર્યા.

નવમા પાનાનું ચાલુ

પોલીસ પર હુમલો

અને આઝાદ મેદાનમાં પણ આ પ્રકારના વિરોધ પ્રદર્શનો યોજાયા ત્યારે પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ વખતે અમારો 'દેવા ભાઉ' એવી કાર્યવાહી કરશે કે આ લોકોને પાકિસ્તાનમાં તેમના 'અબ્બા' યાદ આવશે.' શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેની ટિપ્પણીનો જવાબ આપતા નીતેશ રાણેએ કહ્યું હતું કે 'આદિત્ય ઠાકરેને આક્ષેપો કરવાનો કોઈ અધિકાર નથી કારણ કે ઉદ્ભવ ઠાકરેના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનની તરફેણમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.' આદિત્ય ઠાકરેએ અગાઉ આરોપ કર્યો હતો કે ભાજપ મહારાષ્ટ્રને મણિપુરમાં ફેરવવાનો મથાસ કરી રહ્યો છે. રાણેએ નાગપુરમાં થયેલી હિંસા માટે સમાજવાદી પક્ષના વિધાનસભ્ય અબુ આઝમીને જવાબદાર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ પૂર્વઆધોજિત હિંસા છે. મુંબઈમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે 'આના માટે અબુ આઝમી જવાબદાર છે. તેમણે આ મુદ્દાની શરૂઆત કરી હતી. સરકારને બદનામ કરવા માટે આ એક પૂર્વઆયોજિત હિંસા હતી. જેમણે અમારા પોલીસ કર્મચારીઓ પર હાથ ઉપાડ્યો છે તેમને અમે છોડીશું નહીં. આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.' સમાજવાદી પક્ષના વિધાન સભ્યએ અહેવાલ આપ્યો હતો કે મોગલ જુલમી ઔરંગઝેબ 'કૂર વહીવટકર્તા' ન હતો અને તેણે "ઘણાં મંદિરો બનાવ્યાં હતાં."

નાગપુર હિંસા

કાર્યવાહી કરવામાં આવશે, અને જેણે પણ પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો છે તેને બક્ષવામાં આવશે નહીં. સામાન્યતા પુન:સ્થાપિત કરવામાં આવી રહી છે,' એમ ફંડાણીસે કહ્યું હતું. આવી જ લાગણીઓ વ્યક્ત કરતા, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વિધાન પરિષદમાં કહ્યું હતું કે, ચોક્કસ સમુદાયને નિશાન બનાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ઘટનાઓનો ક્રમ આપતા, ફંડાણીસે કહ્યું કે સોમવારે સવારે ૧૧.૩૦ વાગ્યે, વિષ હિન્દુ પરિષદ (વીએચપી) અને બજરંગ દળના કાર્યકરોએ નાગપુરના મહેલ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં ઔરંગઝેબની કબર દૂર કરવાની માગણી કરવામાં આવી હતી. તેમણે ઘાસની એક પ્રતીકાત્મક કબર પણ બનાવી અને તેને આગ લગાવી દીધી, એવી માહિતી તેમણે આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, બપોરે ગણેશ પેઠ પોલીસ સ્ટેશનમાં કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને ધાર્મિક લાગણીઓ દુભાવવાના હેતુથી ઇરાદાપૂર્વક અને દુર્ભાવનાપૂર્ણ કૃત્યો સંબંધિત કલમ તેમના વિરુદ્ધ લાગુ કરવામાં આવી હતી. સાંજ સુધીમાં, એક એવી અફવા ફેલાઈ ગઈ હતી કે આગ લગાડવામાં આવેલી પ્રતીકાત્મક કબર પર કેટલીક ધાર્મિક સામગ્રી મૂકવામાં આવી હતી. આ પછી, ૨૦૦-૩૦૦ લોકોએ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું અને હિંસા કરવાની ધમકી આપી, જેના પગલે પોલીસે હળવો બળપ્રયોગ કર્યો, એમ તેમણે જણાવ્યું હતું. ફંડાણીસે જણાવ્યું હતું કે, વિરોધીઓને ગણેશ પેઠ પોલીસ સ્ટેશનમાં આવવાનું પણ કહેવામાં આવ્યું હતું કારણ કે તેઓ વીએચપી અને બજરંગ દળના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માગતા હતા. 'જ્યારે પોલીસ કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે હંસાપુરીમાં ૨૦૦-૩૦૦ લોકોએ પથ્થરમારો કર્યો. તેમના ચહેરા ઢાંકલા હતા. કેટલાક લોકો પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો,' એમ તેમણે કહ્યું હતું. તેમણે આપેલી માહિતી મુજબ, ત્રીજી ઘટના સાંજે ૭.૩૦ વાગ્યે ભલદાપુરામાં બની હતી, જ્યાં ૮૦ થી ૧૦૦ લોકોના ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. તેથી, તેમને નિર્ધનપ્રણમાં રાખવા માટે ટીયર ગેસ અને હળવો બળપ્રયોગ કરવામાં આવ્યો હતો.

સ્થાનિક વિધાનસભ્ય

આ દરમિયાન હિંસાગ્રસ્ત નાગપુર સન્ટ્રલ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દટ્ટેએ કહ્યું હતું કે ચિટનીસ પાર્ક વિસ્તારમાં હિન્દુઓ અને મુસ્લિમો ઘણા દાયકાઓથી શાંતિથી રહી રહ્યા છે. ચિટનીસ પાર્ક ખાતે પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે હિંસા પૂર્વ-આયોજિત હતી અને હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. 'આ એક સુનિયોજિત કૃત્ય હતું, જેમાં મુસ્લિમોના ઘરો અને દુકાનોને નહીં પણ ચોક્કસ સમુદાય (હિન્દુ)ના ઘરો અને દુકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા,' એવો આરોપ તેમણે લગાવ્યો હતો. દટ્ટેએ કહ્યું કે હિંસા અચાનક નહોતી ફાટી નીકળી કારણ કે એવું હોત તો પછી બંને સમુદાયોને નિશાન બનાવવામાં આવ્યા હોત. મુખ્ય પ્રધાન પર વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે સરકાર ગુનેગારોને ઓળખવા માટે ડીવીઆર અને સીસીટીવી ફૂટેજ સ્કેન કરશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. 'શું ગૃહ વિભાગ સૂઈ રહ્યો હતો?' ફંડાણીસ ફરી એકવાર ઉદ્ભવ ઠાકરેના નિશાન પર મુંબઈ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફંડાણીસે નાગપુરમાં થયેલી હિંસા પુર્વનિયોજિત હતી એવું નિવેદન કર્યા બાદ શિવસેના (યુબીટી)ના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ભવ ઠાકરેએ ફંડાણીસની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં એવા સવાલ કર્યા હતા કે 'શું નાગપુરમાં હિંસા થઈ રહી હતી ત્યારે ગૃહ વિભાગ સૂઈ રહ્યું હતું?', 'મુખ્ય પ્રધાન નાગપુરના છે. શું તેમને આ વિશે કંઈ ખબર નહોતી?' નાગપુરમાં બનેલી ઘટના માટે રાજ્ય સરકાર જવાબદાર છે. રાજ્ય સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. શું નાગપુરમાં હિંસા થઈ રહી હતી ત્યારે ગૃહ વિભાગ સૂતો હતો?

જૈન મરાઠ

લતા મહેતા (ઉ.વ. ૮૫) તા. ૧૬-૩-૨૫ના રવિવારના શ્રીચરણ પામેલ છે. સ્વ. રોહિત ડી. મહેતાના પત્ની. મોનિયા અને રાહા પરીખ, આનંદ મહેતા અને મેરી ડ્રમિંગના માતા-સાસુ. અલીશા પરીખ અને અભિષેક પરિદાના દાદી. અશોક અને મીના શ્રોક, વર્ષા મહેતાના ભવન-નર્ણક. પ્રાર્થનાસભા રાખેલ નથી. કચ્છી લોહાણા ગામ ઢોરી હાલ મુલુંડ તે સ્વ. ગંગારામ નરસિંહ પલાણાના પુત્ર. સ્વ. રાજેન્દ્રના ધર્મપત્ની ગં. સ્વ. લીલાવતી (ઉ.વ. ૬૦) તે ઘનશ્યામ, ફાલ્ગુની ક્ષ્મ, ફિરણ ભીંના માતૃશ્રી. તે સોનલાના સાસુમાં. તે સ્વ. રાધાબેન ખીમજી તન્ના, મુળ બેલાના હાલે આદિપુરના પુત્રી. લક્ષ્મીબેન અમૃતલાલ, ગં.સ્વ. મંગલાબેન વાલજી, લતાબેન નવીન, મધુબેન પ્રતાપ, ગ. સ્વ. હિનાબેન પ્રવીણના દેરાણી-જેઠાણી. તે સ્વ. સરસ્વતીબેન લાલજી ગણાના અને સ્વ. નર્મદાબેન જેઠાલાલ અનમના ભાભી. તા. ૧૭-૩-૨૫ સોમવારના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૯-૩-૨૫ના પથી ૭, ગોપુરમ હોલ, જ્ઞાનસંહિતા શાળાની બાજુ, મુલુંડ, લૌકિક વ્યવહાર બંધ છે. વૈષ્ણવ ગામ ખામઘોળ (જૂનાગઢ) નિવાસી હાલ ઘાટકોપર તે સ્વ. હરીશભાઈ નાથાલાલ બગધલિયાના સુપુત્ર ધર્મશભાઈ (ઉ.વ. ૪૯) તા. ૧૬-૩-૨૫ના રવિવારના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૦-૩-૨૫ના ગુરુવારે ૪.૩૦થી ૬. કે. ભલ્લનજી ભારી, રાજાવાડી ગાંડન પાસે, ઘાટકોપર (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે. નવમ્યા ભાટીયા ધ્રોલ નિવાસી હાલ મુંબઈ કુ. શોભાના (ઉ.વ. ૭૯) તે સ્વ. જવેરબેન નરભોરામ વેદના સુપુત્રી. ભાનુબેન તથા સ્વ. ચંપાબેન ધીરજીશરણ બેન. સ્વ. ગોવિંદજી ગોકલદાસ વેદના પૌત્રી. તે સ્વ. ગોકલદાસ નારાયણજી સંપના દોહિત્રી. તા. ૧૯-૩-૨૫ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ગોભવા મોઢ વર્ણિક ગં. સ્વ. મંજુલાબેન પ્રતાપરાય પરીખ (ઉ.વ. ૯૪) તે સ્વ. પ્રતાપરાય માધવજી પરીખના કલ્પનાના માતૃશ્રી. તે નિશાબેન, ઉમાબેન, સુધીરાબેન અને સ્વ. રાજેશભાઈના સાસુ. તે પથીક-કૃતિ, ઉભંગ-માનસી અને પૂજા-હરિયાના માતૃશ્રી. ચિંતન, ઋષી, સ્નેહા, આલોકના નાની તા. ૧૯-૩-૨૫ના મંગળવારના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. દમણીયા દરજી ગં. સ્વ. લતાબેન (ઉ.વ. ૭૦) તે સ્વ. નવીનચંદ્ર વલ્લભાસ દમણીયાના ધર્મપત્ની. તે સ્વ. તરવેણીબેન વલ્લભદાસ દમણીયાના પુત્રવધૂ. સ્વ. લલિતાબેન ઉત્તરવાલા દેલ્હના પુત્રી. ભાવેશ અને બિનાના માતૃશ્રી. ભાવિકા અને શૈલેષકુમારના સાસુ. સ્વ. જવાહરભાઈ, દિલીપીભાઈ, નરેન્દ્રભાઈના ભાભી તા. ૯-૩-૨૫ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૨૧-૩-૨૫ના હુણાર સુતાર શ્રાંતિ હિતેચ્છક મંડળ, ૧લે માળે, કાંટર રોડ, નંબર-૩, દત્તાપાઝ મેઠન રોડ, અંબાજી મંદિર પાસે, બોરીવલી (પૂર્વ), સમય સાંજે ૫ થી ૭. હાલાલ ભાટિયા અ. સૌ. પારુલ કપિલ ઉદેશી (ઉ.વ. ૫૭) તે સ્વ. જયંતી જયસિંહ ઉદેશીના પુત્રવધૂ. આદિત્યના માતૃશ્રી. અ. સૌ. અનેરીના સાસુ. સ્વ. નલિની જયસિંહ પોરેશીના પુત્રી. યશોના બેન. અ. સૌ. મીતા સુનિલ, ગં. સ્વ. પૂજા ભરત, અ. સૌ. નીના મુકેશ, અ. સૌ. ભાવના હિરેશના ભાભી તા. ૧૫-૩-૨૫ના શનિવારના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૦-૩-૨૫ના પથી ૬, ૩૦, કે. સંન્યાસ આશ્રમ, બજાજ કોસ રોડ, વિલેપાલ (પશ્ચિમ), લૌકિક વ્યવહાર બંધ છે. દશા પ્રત્યાષતા વર્ણિક સ્વ. તારાબેન માણેકલાલ ચોકસીના પુત્ર ભરત (ઉ.વ. ૮૧) તા. ૧૬-૩-૨૫ના રવિવારે શ્રીજીશરણ પામ્યા છે. તે નમાબેનના પતિ. વિશાલ હિમતાના પિતાશ્રી. સેજાજ ગોરનાના દર્શનાકુમાર મહેતા (કાંધીયાવાળા)ના માતૃશ્રી. મેથાના સાસુ. શૈલી અને સિદ્ધાના નાની. વિંચર પક્ષે સ્વ. પાનાચંદ કરસનદાસ દોશી (વાલરગાળી)ની દાસી. સોમવાર, તા. ૧૭-૩-૨૫ના અરિહંતશરણ પામેલ છે. રવિવાર, તા. ૨૩-૩-૨૫ના સરનાના માલવંદના ૧૦થી ૧૨. કે. જીવરાજ ભાણુભાઈ, અશોક નગર, મેહુલ ટોકીઝની પાસે, મુલુંડ (વેસ્ટ), સાહડી, પાર (વેસ્ટ).

ડોમેસ્ટિક પ્રવાસ

ડોમેસ્ટિક પ્રવાસીઓ પાસેથી ૩૨૫ રૂપિયા યુટીએફ ફી વસૂલવાનો પ્રસ્તાવ મુક્યો છે. એનો અર્થ એવો થયો કે મુંબઈથી ઉપનગરી દરેક એરલાઇન્સે એરપોર્ટને ૩૨૫ યુટીએફ ફી ચુકવવી પડશે. આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસીઓની યુટીએફ ફી પણ ૧૮૭ રૂપિયાથી વધારીને ૬૫૦ રૂપિયા કરવામાં આવી છે. આ ચાલ્સરૂં પહેલી જૂનથી વસૂલવાનું શરૂ થશે. બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોના, તેમજ ફરજ પરના રાજદ્રારીઓ, એરલાઇન્સ-કુ, સંરક્ષણ કર્મચારી અને સંયુક્ત રાષ્ટ્રસંઘના અધિકારીઓને આ ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે આ દેરિફમાં કરાયેલા સુધારાને કારણે મુંબઈ એરપોર્ટ પર ઇન્ક્રાફ્ટચર ડેવલપમેન્ટ અને ટેકનોલોજી એન્હાન્સમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં મદદ મળશે.

છત્રપતિ શિવાજી અને છત્રપતિ સંભાજી મહારાજનું અપમાન સહન નહીં કરાય: એકનાથ શિંદે

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિધાનપરિષદમાં જણાવ્યું હતું કે, વિરોધ પ્રદર્શન પછી, પોલીસે બે સમુદાયો વચ્ચે મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી હતી. 'રાત્રે ૨ વાગ્યે ૨,૦૦૦ થી ૫,૦૦૦ લોકોનું ટોળું કેવી રીતે એકઠું થાય છે? લોકોના ઘરોમાં મોટા પથ્થરમારો કરવામાં આવ્યો. એક હોસ્પિટલની તોડફાડ કરવામાં આવી. હોસ્પિટલમાં દેવી-દેવતાઓના કોલા સજાવવામાં આવ્યા. પેટ્રોલ બોમ્બ ક્યાંથી આવ્યા? પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા, કાર, મોટરબાઈક સળગાવવામાં આવ્યા. ૧૦૦-૧૫૦ બાઇક ચોક્કસ વિસ્તારમાં નિયમિત પાર્ક કરવામાં આવતી હતી અને ગઈકાલે કોઈ બાઇક પાર્ક કરવામાં આવી નહોતી. આનો અર્થ એ છે કે, આ ચોક્કસ સમુદાયને નિશાન બનાવવાનું પૂર્વઆયોજિત પલ્ક હતું, એમ શિંદેએ કહ્યું હતું. છત્રપતિ શિવાજી અને છત્રપતિ સંભાજીનું અપમાન રાજ્ય સહન કરશે નહીં, એવા શબ્દોમાં તેમણે વિધાનપરિષદમાં તોફાની તત્વોને ચેતવણી આપી હતી. તેમણે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાબેને મુખ્ય પ્રધાન ફંડાણીસની સરખામણી

જૈન મરાઠ

ગોભવા મોઢ વર્ણિક ગં. સ્વ. મંજુલાબેન પ્રતાપરાય પરીખ (ઉ.વ. ૯૪) તે સ્વ. પ્રતાપરાય માધવજી પરીખના કલ્પનાના માતૃશ્રી. તે નિશાબેન, ઉમાબેન, સુધીરાબેન અને સ્વ. રાજેશભાઈના સાસુ. તે પથીક-કૃતિ, ઉભંગ-માનસી અને પૂજા-હરિયાના માતૃશ્રી. ચિંતન, ઋષી, સ્નેહા, આલોકના નાની તા. ૧૯-૩-૨૫ના મંગળવારના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. દમણીયા દરજી ગં. સ્વ. લતાબેન (ઉ.વ. ૭૦) તે સ્વ. નવીનચંદ્ર વલ્લભાસ દમણીયાના ધર્મપત્ની. તે સ્વ. તરવેણીબેન વલ્લભદાસ દમણીયાના પુત્રવધૂ. સ્વ. લલિતાબેન ઉત્તરવાલા દેલ્હના પુત્રી. ભાવેશ અને બિનાના માતૃશ્રી. ભાવિકા અને શૈલેષકુમારના સાસુ. સ્વ. જવાહરભાઈ, દિલીપીભાઈ, નરેન્દ્રભાઈના ભાભી તા. ૯-૩-૨૫ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૨૧-૩-૨૫ના હુણાર સુતાર શ્ર

જગજિતના ક-મોતની કથા સાંભળવા પછી ફરી ગયેલા તાપણને સંકોરતા નિર્કુમ્ભઆનંદ મને પૂછ્યું:

“અધોરીઓનો આવો ભયાનક અનુભવ હોવા છતાં તમે અહીં આ અધોરીઓ વચ્ચે આવવાની હિંમત કેમ કરી?”

મેં ઠંડા અને સ્વસ્થ અવાજે કહ્યું: “જગજિતના મોતનો બદલો લેવા હું અહીં આવ્યો છું !”

કોઈ પાગલને જોઈ રહ્યો હોય એમ નિર્કુમ્ભઆનંદ મને તાકી રહ્યો.

“કોઈ પાગલ જ આવી હિંમત કરી શકે. તમે અધોરીઓની શક્તિઓનો ખૂબ ઓછો અંદાજ આંક્યો લાગે છે. મહાશય, ગઈ કાલે તમારો હાથ ચોટાડી દેનાર નિર્મળઆનંદ તો અમારો એક સાવ નવો અને સામાન્ય અધોરી છે એ ન ભૂલશો.” નિર્કુમ્ભના શબ્દોમાં ચેતવણી સાથે થોડો ઉપહાસ પણ સ્પષ્ટ વર્તાતો હતો.

પરોઢની ગુલાબી ઠંડી વાતાવરણના કારણે જરા કઠોર લાગવા લાગી હતી. ઠંડી ઉડાડવા કે પછી જગજિતની યાદના અંતે થયેલા સોભને ખંભેરવા મેં મારા હાથ ફરી રહેલા તાપણ પર ફેલાવી શેકવા માંડ્યા.

“નિર્કુમ્ભઆનંદ!” હું હસવાનો પ્રયત્ન કરતાં બોલ્યો:

“હું અહીં તમારા અધોરીઓ સાથે કુસ્તી કરવાનો નથી, નથી એમને અખાડામાં ઊતરવાનું આહ્વાન કરવાનો. બદલો લેવાની મારી રીત મારી છે. સમય આવે તમને એ સમજશે. અત્યારે તો ફક્ત હું તમને મારી તૈયારીઓ વિશે જ કંઈક કહેવા ઈચ્છું છું.”

‘એ પહેલાં હું તમને ચેતવવા ઈચ્છું છું કે હું પણ એક અધોરી છું એ ન ભૂલશો.’ નિર્કુમ્ભઆનંદ કંઈક આશ્ચર્યમાં આવી બોલ્યો.

‘તમે ખબર છે ને યાદ પણ છે એટલે જ તમને હું આ કહેવા ઈચ્છું છું.’

‘કહો.’ એના અવાજમાં નરી શુષ્કતા હતી.

‘જગજિતનો કાંડ બન્યો એ પહેલાં હું મારી જાતને ‘રેશનલ’-બુદ્ધિવાદી’ માનતો હતો. ચૈતન્યાનંદના સહવાસ પછી મને એમની કૃપાથી કેટલીક શક્તિઓ પ્રાપ્ત થઈ હતી. એમની આજ્ઞા અનુસાર એ શક્તિઓનો મેં વધુ અભ્યાસ-ઊંડાણપૂર્વકના અભ્યાસ અર્થે જ ઉપયોગ કર્યો હતો. કણ્ણિપિશાચીની-અન્યાના મનની વાત જાણવા કરતાં મને કલ્પનાઓ-પોતાના મનની વાત અને શક્તિ જાણવામાં વધુ સાર્યકતા લાગી. વાંચવું-વિચારવું-ચર્ચવું-આચરવું વગેરે અનેક પ્રકારે સંસારમાં જીવતાં હું પરમ ચેતનાની શક્તિઓ અનુભવવા લાગ્યો. બૌદ્ધિકતા પર વધુ અવલંબના કારણે દરેક કિયાને હું બુદ્ધિના ત્રાજવા પર મૂલવતો બૌદ્ધિકોની જેમ મને હું પણ ચમત્કારો શક્ય નથી એમ માનતો હતો, પણ એ માડું અજ્ઞાન હતું એ મને જગજિતની ઘટના પછી સમજાયું. આ ઘટના મેં જેને પણ કહી છે એ મારા પર હસ્યા છે. આજે પણ એ પ્રસંગોની સત્યતા પર હસનારા અનેક છે. મને એનો શોભ નથી, કારણ કે હું જાણું છું જગજિતની ઘટના નહોતી બની ત્યારે હું પણ એનામાંનો જ એક હતો. અહીં ગઈ કાલે મેં જોયેલા અનેક પ્રસંગોને પણ ન માનનારા મને મળશે,

કારણ કે એમને મનની પ્રચંડ શક્તિ વિશે ખબર નથી.

મને પણ નહોતી. કણ્ણિપિશાચીની-કલ્પનાઓના કારણે હું એમ માનવા લાગ્યો હતો કે હું મન વિશે સંપૂર્ણ જાણું છું, પણ એ પછી મને સમજાયું કે હું જેને ઓળખતો હતો એ તો મનની પ્રચંડ શક્તિનો એકમાત્ર અંશ-હજારમો કે લાખમો અંશ જ હશે.

‘જગજિતના પ્રસંગને હું મારા જીવનનો શાપ સમજવા લાગ્યો હતો. પાછળથી મને સમજાયું કે એ ભીષણ-દર્દનાક ઘટના એ મારી દ્રષ્ટિ બદલવામાં એક મોટો ભાગ ભજવ્યો છે... દેખીતી રીતે હું ખૂબ જ વિચલિત બન્યો હતો, કારણ જાણ્યે- અજાણ્યે માડું અભિમાન વધાર્યું હતું. આ ઘટના મારા જીવનમાં અને મારા જ મિત્ર સાથે શા માટે બની એ ત્યારે મને સમજાયું નહોતું’ વાત કરતાં કરતાં હું સહેજ થોભ્યો. ઊંડો શ્વાસ લઈ મારી વાત આગળ વધારી :

‘ચિંતન અને મનની ગેહરૂંટી સુધિમાં ખૂબ મથ્યા પછી મને અહમ અને અકસ્માત નામના પ્રકૃતિના બે ગુણનો પરિચય થયો. મેંસૂરના પેલા વૃદ્ધ પંડિતે મને અહમ વિશે થોડો પરિચય તો કર્યો જ હતો. વધુ ચિંતન પછી આ અહમના વિસ્મયજનક ચમત્કારો, ભ્રમણા ઉપજાવવાની એની ગજબનાક શક્તિનો મને અનુભવ થયો.

‘મનુષ્ય વિચારે છે, કલ્પનાના ઘોડા દોડાવે છે, આત્મા કે પરમાત્માની વાત કરે છે, અરે, જ્યારે ‘હું’ને ભુલાવવાની વાત કરે છે ત્યારે પણ



પ્રકરણ ૧૧

કેન્દ્રમાં એનો અહમ હોય છે. અહમથી છૂટકારો પામવો અતિ મુશ્કેલ છે. ચેતના શરીરથી મુક્ત થઈ શકે છે, ‘પ્રજાનં બ્રહ્મ’ અર્થાત જ્ઞાનતત્ત્વ એ જ બ્રહ્મ છે. બ્રહ્મને ઓળખવા માટે ઉપયોગમાં આવતી બુદ્ધિને જ એમણે બ્રહ્મ માની. એ પછી શ્રુતિ ઊદાલક આરુણિએ સામવેદના છાંદોગ્ય ઉપનિષદમાં ‘તત્ત્વમસિ’ તું જ બ્રહ્મ છે એમ કહ્યું. આ વધુ સરળ અને સચોટ તત્ત્વજ્ઞાન હતું, કારણ કે બ્રહ્મને જ બ્રહ્મ કહેવું એનાથી બીજી વાત કઈ હોઈ શકે? એ પછી દેવર્ષિ વરુણે આનંદને બ્રહ્મ કહ્યો, કારણ કે આનંદની ભાવના જ મનુષ્યજીવનમાં શ્રેષ્ઠ છે અને બ્રહ્મ આનંદ ન હોય તો અન્ય શું થઈ શકે? હવે પછી આલ્યા યાજ્ઞવલ્કય યોગેશ્વર, જેમણે કહ્યું ‘અહં બ્રહ્માસ્મિ’ આ આખરી અને અંતિમ ફેસલો હતો. બધા જ પ્રશ્નોનો એક માત્ર ઉત્તર બુદ્ધિ કોણ છે? કોની છે? તું શાના આધારે છી? આનંદ કોના માટે છે? બધું જ મારા માટે તો પછી મારા સિવાય અન્ય બ્રહ્મ કેવી રીતે હોઈ શકે? ‘અહં બ્રહ્માસ્મિ’ બ્રહ્માંડના કેન્દ્ર સુધી પહોંચાડીને માનવીનો અહમ એને ફરી પાછો પોતા પાસે લાવ્યો. એક મહાન શોધની એને ભ્રમણા થઈ આવી. બધું જ જ્ઞાન અટકી ગયું, અને અંત આવી ગયો.

આ છે અહમની શક્તિ ભ્રમણા...! ‘માનવી બુદ્ધિનો ઉપયોગ કરી વિચારે છે ત્યારે એ પોતાથી આગળ વધી શકતો નથી. એ પોતાને જ કેન્દ્ર માને છે. એ પોતાની સામે એક ઈશ્વરને-પરમેશ્વરને ઊભો કરી દે છે- પોતાની સેવા કરવા માટે, જન્મ આપવા માટે, પોષણ કરવા માટે અને સંહાર કરવા માટે પણ એ પરમેશ્વરને- એક વ્યક્તિ પોતાની જ પ્રતિષ્ઠિતિ ગણે છે. મનુષ્ય શરીર અને બુદ્ધિથી જ્યારે સાધના કરે છે ત્યારે આ જ પરિણામ આવે છે.

હકીકતમાં આપણે શક્તિને શોધવાની જરૂર છે. ચેતનાનું મૂળ શોધવાની જરૂર છે. અંધકાર સામે પ્રકાશને મૂકીને આપણે પ્રકાશને વખાણીએ છીએ. આ ભૂલ છે. સાધના પ્રકાશ પાછળની શક્તિની હોવી જોઈએ. ઝળાહળમાં થતાં વીજળીના ગોળામાં કરી જ શક્તિ નથી, શક્તિ છે વીજળીમાં, ઈશ્વર એ પણ ચેતના છે, શક્તિ છે. એ શક્તિ પણ પ્રચંડ છે. એના કરોડમાંના પણ કરોડમાં ભાગના અંશની શક્તિનો પણ આપણને પરિચય નથી.

આપણું મન એ શક્તિનો અંશ છે અને એ અંશના પણ કરોડમાં ભાગને આપણે ઓળખતા નથી.

એ પ્રચંડ શક્તિને જે ઓળખતા નથી એ ચમત્કારમાં શંકા ઉઠાવે છે.

‘હું પણ એમ જ કરતો હતો. જેવી એ મહાશક્તિની એક ઝલક પામ્યો કે મારો ગર્વ

ઓગળવા લાગ્યો અને સ્વાભિમાન જાગૃત થયું. બૌદ્ધિકો ફક્ત બુદ્ધિની શક્તિને ઓળખે છે. વિજ્ઞાન અને વિજ્ઞાનીઓ એની સીમા છે. મનોવિજ્ઞાનીઓ મનની ફક્ત થોડી, બહુ જ થોડી સીમિતશક્તિને ઓળખે છે. ફક્ત થોડીઓ જ એ અગાધ શક્તિનો પરિચય પામે છે, નથી સમજતા એ ઉપહાસ કરે છે.’ હું ફરી અહીં અટક્યો... થોડીક ક્ષણો બાદ વાતનો દોર ફરી સાધી લીધો : ‘અહીં એક અજબ કિસ્સો તમને કહેવા ઈચ્છું છું. અવારનવાર તમે ક્યાંક પથ્થર પડવાના, ભૂતના વળગાડના કિસ્સા સાંભળ્યા હશે. પુનર્જન્મની સ્મૃતિના પણ અનેક કિસ્સાઓ સાંભળવા અને જોવા મળશે. આવા અનેક કિસ્સામાં મેં જાતવ્યાસ કરી હતી. સંતોષ થાય એવું પરિણામ, એવું કારણ ક્યાંયથી જાણવા મળ્યું નહીં. આ દરમિયાન, કુંભ મેળામાં એક યોગીનો પરિચય થયો. મનની અગાધ શક્તિનો એમને પરિચય હતો. સાધના પણ પુષ્કળ કરી હતી. મેં એમને મારી આશંકાઓ જણાવી. કરોડ જ જવાબ ન આપતાં એ યોગભૂદામાં સ્થિર થયા. અમારા બન્નેથી થોડું દૂર એક મોટો પથ્થર પડ્યો હતો. વીસેક કિલો વજન હશે. મને એમણે ત્યાં જોવા કહ્યું. પાંચેક મિનિટ પછી મારા આશ્ચર્ય વચ્ચે એ પથ્થર જમીનથી અધર ઊંચકાયો. હવામાં થોડી વાર સ્થિર રહ્યો. આ દરમિયાન કેટલાય નાના નાના પથ્થરો અમારી આસપાસ પડવા લાગ્યા હતા ! દસેક મિનિટ પછી બધું જ શાંત થઈ ગયું.

‘આ મનની શક્તિ છે.’ એમણે કહ્યું: ‘અનેક લોકો શંકા કરે છે ત્યારે અમે આને દેવીશક્તિ કહીએ છીએ. અલબત્ત, એ દેવી જ છે. તે તારી નજરે આ જોવું છે. મનની શક્તિનો આ અજબ ચમત્કાર ન માનનારને એક સવાલ પૂછી જોજે- આ પૃથ્વીનો ગોળો, આ પ્રચંડ સૂર્ય, અનેક ગ્રહો અને ઉપગ્રહો નિહાદિકાઓ અને વિશ્વો અને બ્રહ્માંડનો અવકાશમાં અધર ઝૂમી રહ્યા છે. પ્રચંડ વેગથી ઝૂમી રહ્યા છે અને કોઈ અગોચર સ્થળે ધસમસી રહ્યા છે એમ તમે માનો છો ખરા? કઈ પ્રચંડશક્તિના કારણે એ શક્ય બન્યું છે? એ શક્તિની તમે કલ્પના કરી શકતા હો, એમાં તમે વિશ્વાસ મૂકી શકતા હો તો આ નાનકડા મને કરેલા નાનકડા ચમત્કારમાં અવિશ્વાસ મૂકવાની જરૂર જરૂર નથી. મનની આ અજબ શક્તિ અને અહમ જ્યારે ટકરાય છે ત્યારે ભૂપ્રેત જન્મે છે અને મનની શક્તિ અને અહમ જ્યારે હાથ મિલાવે છે ત્યારે ભગવાન પેદા થાય છે !

‘પુનર્જન્મ, ભૂપ્રેતના વળગાડના અનેક કિસ્સાઓની પાછળ ઘવાયેલો અહમ પડ્યો હોય છે. મન સર્વ વ્યક્તિને છે અને એક સરખું જ શક્તિશાળી છે. સંસ્કારો અને અજ્ઞાન જ્યારે આ મનની શક્તિઓને દબાવે છે અને એ દબાવ અસહ્ય બને છે, ત્યારે એવી વ્યક્તિનું મન બળવો કરે છે. ક્યારેક ઢોંગ હોય છે પણ મહદ્ અંશે તો માનસિક ભ્રમણા હોય છે. આવી વ્યક્તિઓ

મૃતાત્માને બોલાવવાના પ્રયોગો તો તમે જરૂર જોયા જ હશે, પણ અમારા આ બાબા અલખઆનંદ જે પ્રયોગ કરે છે તેવો પ્રયોગ તમે તમારી જિંદગીમાં જોયો નહીં હોય..!

સાંભળેલી વાતોના આધારે અવનવી વાતો ઊપજાવી કાઢે છે. અજાણપણે એમનું કલ્પનાશીલ પણ અનિચ્છિત મન જ એમને આમ કરવા પ્રેરે છે.

‘એક ભૂતના વળગાડના કિસ્સામાં બ્રાહ્મણનો યુવાન છોકરો કકાટડ ઉઠું બોલવા લાગતો. એક મુસલમાન મૌલવીને બોલાવીને એ શું બોલે છે તે ચકાસવામાં આવ્યું ત્યારે ખબર પડી કે વર્ષો પહેલાં રેડિયો પર સાંભળેલું ઉઠુંમાં રજૂ થયેલું ભાષણ જ એ બોલતો હતો. એ ભાષણ સિવાય એને ઉઠું આવડતું નહોતું. એના અજ્ઞાત શક્તિશાળી મને સ્પષ્ટ અને સાચા ઉચ્ચારો સાથે એ ભાષણ યાદ કરી લીધેલું. જાગૃત અવસ્થામાં એ યુવાનની સ્મરણશક્તિ સામાન્ય હતી. પુનર્જન્મની યાદના અનેક કિસ્સાઓમાં ભૂતશક્તિમાં અજ્ઞાત મને નોંધવા અને યાદ રાખેલા કિસ્સાઓ એવી અજબ રીતે કલ્પનાશીલ મન સાંકળી લે છે કે એ વ્યક્તિ ભ્રમણાને સત્ય માનવા લાગે છે. બાહ્ય રીતે નબળા મનની લાગતી આવી વ્યક્તિઓનું શક્તિશાળી, અનિચ્છિત મન પોતાની પ્રચંડ શક્તિથી અનેક તોફાનો કરે છે. મનની શક્તિઓ આવા બનાવોમાં ઝંઝાવાતી વંદોળની જેમ કેન્દ્રિત થાય છે અને એવા ચમત્કારો કરે છે કે જોનાર એને ભૂપ્રેતનો ઉપદ્રવ જ સમજ બેસે છે..

‘અમારા જગજિતના કિસ્સામાં એના મને જ ભ્રમણાઓ ઉત્પન્ન કરી પોતાના મનમાં કોતરણી ગેલેલી અધોરીની છબીને દિલ્મની પટી પર ઉપસાવી હતી. એ જ તોફાની મને કલ્પનામાં અધોરીનું સર્જન કરી એને ઘાયલ કર્યો અને બારીમાંથી ફૂટકો મારવા પ્રેર્યો હતો. ભય અને ડરના કારણે એના મનની બધી જ શક્તિ અધોરી અને મૂઠ્ઠની ભ્રમણા પર કેન્દ્રિત થઈ હતી. આવું તોફાની બનેલું મન સ્ટેશ્યોસ્કોપ અને થર્મોમીટરના કાર્યમાં અવરોધ પેદા કરી શકે છે એ વિશે જેને શંકા હોય તેણે આ વિશ્વમાં રહેલી ધ્વંશાત્મક સંહારક શક્તિનો વિચાર કરી લેવો જોઈએ.

પ્રકૃતિનો અકસ્માત કરવાનો ગુણ જાણી લેવાથી આ વધુ સ્પષ્ટ થશે, પણ અકસ્માતના ગુણ વિશે વાત કરીએ તે પહેલાં અહમ અને મનની શક્તિ હાથ મેળવી કેવી રીતે ઈશ્વરનું સર્જન કરે છે તે પણ સમજ લઈએ.

‘ઈશ્વર નામની વ્યક્તિ અને આત્મા નામનો પદાર્થ મનુષ્યની કલ્પનાની પેદાશ છે. એમાં જેને શંકા હોય એણે મનને અને એની શક્તિને ઓળખી નથી. ઈશ્વર અને આત્મા બંને અહમના પોષક છે. અહીં ચાર હાથવાળા અને ધર્મના ઉદ્ધાર અર્થે વારંવાર જન્મ લેવાની ઈચ્છા ધરાવનારા ઈશ્વર વ્યક્તિ વિશેષની વાત કરું છું... એમની ઈશ્વરની કલ્પના એમના અહમને પોષે છે. એ એમના પાપ માફ કરે છે. એ દયાળુ છે. એ જ એમને ભૂલો કરાવે છે. એને એમની જરૂર એટલે એમને એ જન્મ આપે છે અને મૃત્યુ આપી એમને એ પાછા બોલાવે છે. ઈશ્વરને ખુશ કરવા એ પુણ્ય કરે છે. ઈશ્વર નારાજ થશે એ ડરે એ પાપ નથી કરતા. આમ પોતાના અહમને પોષવા ધર્માચરણનું આશ્વાસન એમણે મેળવ્યું છે. મૃત્યુ પછી પણ અમર, અવિનાશી રહેવાના અહમને પોષવા એમણે આત્મા શોધ્યો છે. કલ્પનાશીલ પણ ભ્રમણા ઉત્પન્ન કરનારા મને એમને અહીં સાથ આપ્યો છે. ભ્રમણાનું સ્વર્ગ ભ્રમણાની જમીન પર ભ્રમણાનાં વૃક્ષ અને ભ્રમણાના ફળ!

ખૂબ જ નિયમબદ્ધ અને શિસ્તમાં રચતી પ્રકૃતિનો એક ગુણ અકસ્માત છે. કદાચ એ એનો મૂળભૂત ગુણ પણ હોઈ શકે. રોજ સૂર્ય નક્કી કરેલા સમયે ઊગે છે અને આશ્ચર્ય છે. એ ખૂબ જ નિયમિત હોય એમ આપણને લાગે છે. હકીકતમાં આપણે કાળનો જે ટુકડો માપી રહ્યા છીએ તે આપણને કદાચ ખૂબ મોટો લાગતો હશે, પણ અનંતકાળની ગણનામાં એ તો માત્ર એક બિંદુ જ છે, ક્ષણ છે. સૂર્ય અબજો વર્ષ પહેલાં આજના સમયે ઊગતો નહીં હોય અને એકાદ કરોડ કે અબજ વર્ષ પછી ભવિષ્યમાં, આમાં ફેરફાર થવાની શક્યતા નક્કી શકાય એમ નથી. અબજો વર્ષના સંદર્ભમાં જોવામાં આવે તો સૂર્યને ખૂબ જ અનિચ્છિત અને બેકામૂ રીતે વર્તનાર પદાર્થ તરીકે માનવો પડે. પૃથ્વીની ગતિને પણ આજ લાંછન લાગુ પાડી શકાય... પૃથ્વી અને સૂર્યનું અંતર એક અકસ્માત છે. આ અકસ્માતના કારણે જ જીવસૃષ્ટિ આ જગત પર શક્ય બની છે. વ્યક્તિનો જન્મ પણ અકસ્માત છે, મૃત્યુ પણ અકસ્માત છે. પુરુષના કરોડો શુકાણુઓમાંથી એકાદ અકસ્માત સ્ત્રીનો અંડને

ફલિત કરે છે અને વ્યક્તિનો જન્મ થાય છે. આ અકસ્માત છે અને અકસ્માત હંમેશાં ચમત્કાર હોય છે. અકસ્માત - અનિચ્છિતતાના એકાદ અંશને તમે વૈજ્ઞાનિક કસોટીએ યાગવી કોઈ નિયમ નક્કી કરી શકો ખરા, પણ અકસ્માત હંમેશાં અકસ્માત રહેતો હોય છે. આ અકસ્માત - આકસ્મિકતા અનિચ્છિતતા અનિવાર્ય અને આવશ્યક છે. એ જ માનવીને અહમના પ્રાશમાંથી છોડાવી ઈશ્વરને વ્યક્તિના બદલે શક્તિ તરીકે ભાવના તરીકે ઓળખાવવામાં સમર્થ છે. નિયમમાં બધાં જ બંધનોમાંથી મુક્ત શક્તિનો પરિચય આ અકસ્માત જ કરાવી શકે છે.

બૌદ્ધિકો, મનોવિજ્ઞાનીઓ જ્યારે તાગ લેવા બેસે છે, ત્યારે આ અકસ્માતના, ચમત્કારના પ્રકૃતિના ગુણને અવગણે છે. સ્કાઈડોર્ફેનિયા, સ્પ્લીટપર્સનાલિટી સુધી પહોંચેલું મનોવિજ્ઞાન કે અન્ય ભૌતિક શારીરિક વિજ્ઞાન જ્યાં સુધી આ અકસ્માતના ગુણને સ્વીકારશે નહીં, ત્યાં સુધી એ અધૂરું જ રહેવાનું.’

ઊંડો શ્વાસ લઈને મેં મારી વાત પૂરી કરી.

‘પણ અકસ્માતના ગુણને સ્વીકારવાથી ક્યો ફરક પડે છે?’

અત્યાર સુધી શાંત બેસી મારી લાંબી વાત સાંભળી રહેલા નિર્કુમ્ભઆનંદે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે મને આનંદ થયો. એ મારી વાતમાં રસ લેવા લાગ્યો હતો એ જોઈ મેં ઉત્સાહથી કહ્યું :

‘અકસ્માત, આકસ્મિકતા, અનિચ્છિતતાને સ્વીકારી લેવાથી જ જડતામાંથી, કમિકતામાંથી એને નિયમિતતામાંથી મુક્તિ મળે છે. બૌદ્ધિક બંધનોનો અંત આવે છે અને ભાવનાત્મક વિશાળતાની - મુક્તિની શરૂઆત થાય છે. ધર્મ નિયમ છે, પુનર્જન્મ અથવા આત્મ કમિકતા છે અને શરીર જડતા છે. અકસ્માતના ગુણને સમજવા માટે કાળના અબજો વર્ષના ટુકડાને સમજવો પડે છે. એ સમજાવે કે તરત જ અહમ બદલાવા લાગે છે. પરમ ચેતનાના પ્રથમ સંકલ્પના કારણે પ્રચંડ વિસ્ફોટ થયો ત્યારથી એ વિસ્ફોટના કારણે નિમ્બેલું આ બ્રહ્માંડ ઊભી ભાવનામાં સંપૂર્ણ રીતે પરિવર્તન પામે એ કાળને સમજ શકે એ મનુષ્ય પૃથ્વીના સૂર્યના અબજો વર્ષના ઊંડાણની શુદ્ધલક્ષતા આપોઆપ સમજાય જાય છે. બુદ્ધિથી નહીં મનથી સમજવાનું - અનુભવવાનું. આ જ્ઞાન જ બધા અહમને ઓગાળી નાખે છે ત્યારે કોઈ પ્રશ્ન રહેતો નથી. કોઈ શંકા રહેતી નથી. આ મહાન કાળને પાછા કરનાર, સંકલ્પથી વિસ્ફોટ કરનાર મહાન શક્તિના આ ચમત્કારોનો અનુભવ થયા પછી એને કશો ચમત્કાર દેખાતો નથી. અકસ્માત એના માટે સ્વાભાવિક બને છે. અનિચ્છિતતા જ એનો નિયમ બને છે...અહમ નાશ થતાં જ મનુષ્ય ધર્મ, ઈશ્વર અને આત્માથી ભ્રમણામાંથી મુક્તિ મેળવે છે...આ અનુભવ, ફક્ત કલ્પનાઓથી જ શક્ય બને છે અને કલ્પનયોગ જ મારી શક્તિ છે.’

‘આમ છતાં તમે જગજિતના મૃત્યુનો બદલો આનાથી કેવી રીતે લઈ શકશો તે મને સમજાતું નથી.’ નિર્કુમ્ભઆનંદ બોલ્યો.

‘તમને તમારા આ ચમત્કારોની, શક્તિની, બલિદાનની વ્યર્થતા સમજાશે કે તરત જ મને જગજિતના મૃત્યુનો બદલો મળી જશે.’ આ સાંભળીને નિર્કુમ્ભઆનંદ ખડખડાટ હસી પડ્યો:

‘મહાશય, અમારા આ અધોરીઓનો અહમ તમે સમજો છો એટલો નરમ નથી.’

‘જાણું છું. વિકટતા ન સમજું એટલો નાદાન તો નથી જ, છતાં પ્રયત્ન કરવા ઈચ્છું છું.’

‘આજે દેવી સમક્ષ તમારા પ્રાણની રક્ષા માટે હું પ્રાર્થના કરીશ.’ નિર્કુમ્ભઆનંદ ફરીને ઉપહાસ કરતો હસ્યો.

થોડા સમયની ખામોશી પછી મેં આકાશ તરફ જોયું ત્યારે અધોરીઓ સાથેના બીજા દિવસની શરૂઆતની છડી પોકારતી ઉપાની લાલી પૂર્વ બાજુના પહાડ પાછળ ડોકાટ રહી હતી.

શહેરમાં જે સંકોચ આપણને અળગેલો રહે છે તે આવા જંગલમાં આપોઆપ સરી પડે છે. મુંબઈ જેવા શહેરમાં રેલવે લાઈનની આસપાસ વહેલી સવારે કે મોડી સાંજે શૌચ કરવા બેઠેલાં સ્ત્રી-પુરુષોને જોઈએ છીએ ત્યારે જુગુપ્સા જાગે છે, પણ એમણમાં એ જ કિંપા સાવ સ્વાભાવિક બની જાય છે. નાનાં બાળકોની જેમ સાવ સહજ રીતે શૌચ કરતા અધોરીઓ અને સ્ત્રીઓને વાતો કરતાં જોઈ મને કશું જ અજુગતું લાગતું નથી. દિવસ અને રાત દરમિયાન એમની અધોર સાધનામાં વ્યસ્ત આ અધોરીઓ ખૂબ ભયાનક લાગતા હતા, પણ તે સમયે સાવ નિદ્રાપિ દેખાતા હતા.

હું અને નિર્કુમ્ભ પાછા ફરી રહ્યા હતા ત્યારે ઝાડના ઘડ પાસે બેઠેલી માતા અદિતીએ બૂમ પાડી અમને બોલાવ્યાં. સહજ સંકોચ સાથે હું એમની સામે ઊભો રહ્યો ત્યારે એમણે સ્વાભાવિકતાથી કહ્યું:

‘નિર્કુમ્ભ, આમનો પરિચય આજે બાબા અલખઆનંદ સાથે કરાવજે.’

‘એમનો પરિચય એમને છે જ. માંડલાથી એમની સાથે જ આલ્યા હતા.’ નિર્કુમ્ભઆનંદે કહ્યું.

‘અચ્છ, પણ આત્માને બોલાવવાની બાબાની શક્તિનો પરિચય તારા અતિથિને નહીં હોય. એ પ્રયોગ બતાવવાનો પ્રબંધ જરૂર કરજે.’

‘અવશ્વ.’ નિર્કુમ્ભઆનંદે કહ્યું અને અમે આભાર માની વિદાય લીધી.

‘મૃતાત્માને બોલાવવાના પ્રયોગો તો તમે જોયા જ હશે’ નિર્કુમ્ભઆનંદે મને પૂછ્યું.

‘ઘણાં.’ જવાબમાં મેં કહ્યું હતું.

‘બાબા અલખઆનંદ જે પ્રયોગ કરે છે તેવો પ્રયોગ તમે તમારી જિંદગીમાં જોયો નહીં હોય.’ નિર્કુમ્ભઆનંદે ખૂબ દટાટાથી કહ્યું.

‘જ્યારે આત્મા નામના પદાર્થની એની માન્યતાથી મુક્તિ મળી ગઈ હોય પછી મૃતાત્માઓનું આકર્ષણ રહે?’ મેં પૂછ્યું.

‘આ પ્રયોગ જોયા પછી કદાચ તમે તમારી માન્યતા બદલાવો પણ ખરા!’

‘તમે એટલે કે આ અધોરીઓ આત્મા વિશે કેવી માન્યતા રાખો છો?’ મેં પૂછ્યું.

‘દેવતત્ત્વને સૃષ્ટિનું કારણ કહેનારા તત્ત્વજ્ઞાનીઓથી કદાચ વિરુદ્ધ મત ધરાવતા સ્વભાવવાદીઓ, યદુચ્છવાદીઓ, ભૂતવાદીઓ અને યોનિવાદીઓની મૂળ વિચારસરણી અધોરપંથીઓના વિચારના મૂળમાં છે. તાંત્રિકો અને માંત્રિકાએ યોનિવાદને વિશેષ મહત્ત્વ આપ્યું છે. યોનિવિચાર, યોનિઆચાર, યોનિપ્રચાર જે વર્ષો પહેલાં આ વિચારસરણીના મૂળમાં હતો. આ યોનિવાદીઓ સાથે એ પછી લિંગાયતો ભળ્યા અથવા તો એમને સ્વીકારી લેવામાં આલ્યા. એ શક્તિ કહેવાયા. એ જમાનામાં આ દેશમાં અનેક શક્તિપીઠો હતાં. યોનિ અને લિંગને જ શક્તિના ધારક માનવામાં આવે છે. આત્મા શક્તિરૂપે અવતરવા ઈચ્છે છે ત્યારે એ યોનિ અને લિંગનો સંયોગ ઈચ્છે છે. આત્મા સનાતન તત્ત્વ છે. એ શક્તિમાં રહે છે. સ્ત્રી આત્મા અને પુરુષ આત્મામાં ભેદ હોય છે. શક્તિરૂપ અગ્નિના એ અને અધોર એવાં બે રૂપ છે. ધોર રુદ્ર અને અધોર શિવ છે. ધોર મૃત્યુ અને અધોર અમર્ત્ય છે. ધોર ધનુષ વડે કાળરૂપી ભાણેડો વર્ષા કરી મૃત્યુને પ્રગટ કરી શરીરના બંધનમાંથી આત્માને મુક્ત

મગજ મંથન
વિઠ્ઠલ વઘાસિયા
feedback@bombsamachar.com

વિચાર-વાણી-વર્તન કોઈની પણ પ્રગતિ કરાવે ને પડતી પણ...

વિચાર-વાણી અને વર્તન આ ત્રણ 'વ'થી શરૂ થતા શબ્દો વ્યક્તિની પ્રગતિ અને અધોગતિનું કારણ બની શકે છે. એમાંય વાણી અને વર્તનનો મૂળભૂત આધાર વિચાર પર છે. વ્યવહારિક કે આધ્યાત્મિક ક્ષેત્રમાં વિચારો જ વ્યક્તિને મહાન બનાવે છે.

કોઈપણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ માટે સવળો વિચાર એ સુખ અને આનંદનું કારણ બને છે, જ્યારે અવળો વિચાર કલેશ, ઝઘડા કે દુઃખનું કારણ બને છે. મનુષ્ય માત્રના જીવનમાં વિચાર-વાણી અને વર્તન અગત્યની ભૂમિકા ભજવે છે. આ ત્રણેય પરસ્પર જોડાયેલા છે અને વ્યક્તિના વ્યક્તિત્વ અને પ્રભાવને ઘડવામાં મદદ કરે છે, જેમકે:

- વિચાર:**
- વિચાર એ મગજમાં ઉદ્ભવતા વિચારો, તર્ક, કલ્પનાઓ અને માન્યતાઓનો સમૂહ છે. જે વ્યક્તિ વિચારે છે તે જ તેના વર્તન અને વાણીમાં દેખાય છે. વ્યક્તિ જેવું વિચારે છે તેવું જ થઈને રહે છે. કહેવાય છે કે મગજમાં ઉદ્ભવતો વિચાર પરિણામ લાવીને જ રહે છે. જાહેર જીવનમાં ખેલાતું યુદ્ધ પહેલાં મગજમાં ખેલાઈ ગયું હોય છે.
 - એક ભાઈ દરરોજ સવારે ઊઠીને પોતાના ઘર પાસેના ઓટલે બેસીને દાનપા કરે. ઓટલાની સામે મોટા શિંગડાં વાળી એક ભેંસ કાચમ બાંધેલી રહેતી. આ ભાઈ કાચમ દાનપા કરતી વખતે મોટાશિંગડાં વાળી ભેંસ સામે જોતા રહે અને મનમાં એ ભેંસ વિશે વિચારે: 'આ ભેંસનાં શિંગડાં કેવડા મોટાં છે. આ ભેંસનાં શિંગડાં વચ્ચે માથું

જાય કે નહીં? જાય તો શું થાય?' આનું દરરોજ વિચારે. વિચારતાં વિચારતાં એક દિવસ એવું વિચાર્યું કે એમાં વળી વિચારવાનું શું? અમલ કરીને પાકું જ કરી લઈએ. પોતે ઊભા થઈ અને પેલી ભેંસના શિંગડાં અંદર પોતાનું માથું ઘુસાડી દીધું. પરિણામ શું આવ્યું હશે એ આપણે સૌ જાણીએ છીએ!

- વિચારના ઘણા પ્રકાર છે:**
- સકારાત્મક વિચાર - જે આશાવાદી, ઉત્તરિતરેક અને ખુશહાલ જીવન તરફ દોરી જાય છે.
 - નકારાત્મક વિચાર - જે હતાશા, ડર અને શંકા જન્માવે છે.
 - સંશયાત્મક વિચાર - જે અનિશ્ચિતતા અને શંકા પેદા કરનારો વિચાર છે.
 - ઉદાસીન વિચાર - જે કોઈપણ દિશામાં ન જવાનું વિચારી સ્થિર રહેવામાં માને છે.

દરેક મનુષ્યના વ્યક્તિત્વ ઘટતરમાં વિચાર મહત્વની ભૂમિકા ભજવે છે...વિચાર મગજ અને શરીર પર સીધો પ્રભાવ પાડે છે. હોર્મોન્સ, આરોગ્ય અને ઊર્જા પર વિચારની અસર જબરી રહેતી હોય છે.

વિચાર શુદ્ધ રાખવા માટે સારા પુસ્તકો વાંચવા જોઈએ. ધ્યાન અને આત્મમંથન કરવું જોઈએ. સારા અને સંસ્કારી લોકોની સંગત રાખવી જોઈએ.

- વાણી:**
- વાણી એ વિચાર અને વર્તનની મુખ્ય અભિવ્યક્તિ છે. દરેક વ્યક્તિના વ્યક્તિત્વનું એ પરિબળ છે.
 - સદ્ભાવ પૂર્ણ વાણી - જે મીઠી, ઉદીપક અને શાંતિપ્રદ હોય છે.
 - કઠોર વાણી - જે બીજા માટે નુકસાનકારક અને દુઃખ ઉત્પન્ન કરનારી વાણી છે.
 - સત્ય ને નિષ્કપટ વાણી - જે સત્ય અને સાફ વાણી છે.
 - અસત્ય વાણી - જે અવિશ્વાસ અને ધોખો ઉત્પન્ન કરે છે.
 - મૌન પણ વાણીનો એક પ્રકાર છે. આવશ્યક હોય ત્યારે બોલવું અને બિનજરૂરી મૌન રાખવું.

સારી વાણી લોકોમાં અસરકારક પ્રભાવ પાડે છે. તેમ જ શાંતિ અને શિસ્તનું નિર્માણ કરે છે. જીવન જીવવા માટે મદદરૂપ થાય છે. અપશબ્દ અને ઉગ્ર વાણીથી બચવું જોઈએ. હંમેશાં સત્ય અને વિવેક સાથે ચાલવું જોઈએ. ગેરસમજ ટાળવા માટે સ્પષ્ટ અને સમજદારી પૂર્વક વાણી વાપરવી જોઈએ.

- વર્તન:**
- વર્તન એ વ્યક્તિના વિચાર અને લાગણીઓનું પ્રત્યક્ષ પ્રદર્શન છે. વર્તન દ્વારા જ અન્ય લોકો અને સમાજ પર વ્યક્તિની છાપ પડતી હોય છે. વર્તનના પણ ઘણા પ્રકાર છે, જેમકે
 - સંસ્કારી અને શિસ્તબદ્ધ વર્તન - જે સામાજિક નિયમો અને નૈતિક મૂલ્યોનું પાલન કરાવે છે.
 - આક્રમક વર્તન - જે ગુસ્સા ભરેલું, અવિચારી અને નુકસાનકારક હોય છે.
 - સ્વૈચ્છિક વર્તન - જે માત્ર પોતાના હિત માટે જ કામ કરે છે. સારાં વર્તનથી સમાજમાં સન્માન મળે છે અને વિશ્વાસ પ્રાપ્ત થાય છે. સંબંધો મજબૂત બને છે. એક સારી અને સ્વસ્થ સમાજની રચના થાય છે. તેમજ આંતરિક શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે.

અડગાનનગનન
નગનનગન
નગનન

ફોકસ
મનોજ કુમાર
feedback@bombsamachar.com

ચાર ધામ યાત્રા પર મંડરાતા ડિજિટલ સ્કેમના વાદળ

પ્રયાગરાજમાં શિવરાત્રીના અંતિમ સ્નાન સાથે મહાકુંભનું સમાપન થયું. તેમાં ૬૬ કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું. કેટલીક અપ્રિય ઘટનાઓને બાદ કરતાં, મહાકુંભના તમામ સ્નાન ઉત્સવો સુરક્ષિત રીતે સંપન્ન થયા હતા. પરંતુ દેશમાં ઊંડે સુધી ઉતરી ગયેલા ડિજિટલ સ્કેમનો પડવો આમાં સંભળાયો. આજના આ ડિજિટલ યુગમાં, ઓનલાઈન છેતરપિંડી એક સામાન્ય ખતરો બની ગયો છે અને પોલીસથી લઈને સંતો અને સામાન્ય ભક્તો સુધી દરેક વ્યક્તિ ડિજિટલ સ્કેમર્સનો શિકાર બન્યા છે. જો કે હજુ સુધી મહાકુંભના તમામ પ્રકારના ડેટા જાહેર થયા નથી. તેથી, આ ઘટનામાં કેટલા લોકો ડિજિટલ સ્કેમનો ભોગ બન્યા તે કહેવું થોડું મુશ્કેલ છે. પરંતુ હેલિકોપ્ટરનું બુકિંગ, આશ્રમોમાં રહેવું, રેલ્વે ટિકિટ બુક કરાવવી, બોટ બુક કરવી વગેરે કેસોમાં પ્રવાસીઓ ભોગ બન્યા છે. અલગ-અલગ છેતરપિંડીના અનેક અહેવાલો પ્રકાશમાં આવ્યા છે. ઓનલાઈન નકલી વેબસાઇટ દ્વારા ભક્તોને મોટી રકમ ગુમાવવી પડી હતી. અવી સ્થિતિમાં, જ્યારે આગામી એપ્રિલ મહિનામાં ચાર ધામ યાત્રા શરૂ થશે, ત્યારે ચાર ધામ યાત્રામાં યાત્રિકોને ડિજિટલ છેતરપિંડીથી બચાવવા માટે સરકારની સાથે એઆઈએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે.



ઘટના એવી ચાર ધામ યાત્રામાં દર વર્ષે હોટલ ધર્મશાળા, હેલિકોપ્ટર બુકિંગ, વહેલા દર્શન તેમજ પ્રસાદ વગેરેના નામે હાલના વર્ષોમાં ઘણી છેતરપિંડી જોવા મળી રહી છે. હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ માટે બુક કરાવતી વખતે થતી છેતરપિંડીના મોટાભાગના કેસ પ્રકાશમાં આવ્યા છે. ઉત્તરાખંડ સરકાર ઉપરાંત, તમામ ટ્રાવેલ એજન્સીઓ પણ આહવારસીટીસી (ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) દ્વારા જ બુકિંગ કરાવવાનો આગ્રહ રાખે છે, પરંતુ ઘણી વખત,

મુસાફરો ઉતાવળને કારણે અથવા સમાન બનાવટી સાઇટ્સ દ્વારા બુકિંગ કરવાને કારણે ડિજિટલ છેતરપિંડીનો ભોગ બને છે. ડિજિટલ સ્કેમર્સ નકલી વેબસાઇટ્સ બનાવે છે જે હેલી બુકિંગ સાઇટ્સ જેવી લાગે છે. કેટલાક સ્કેમર્સ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ગૂગલ પર એવી જાહેરાતો આપે છે કે સામાન્ય માણસ છેતરાઈ જાય છે. આજે, કેન્સર જેવા રોગોથી લઈને અન્ય કાર્યોમાં એઆઇ વધુને વધુ મદદરૂપ બની રહ્યું છે. તો ચાર ધામ યાત્રા જેવી વાર્ષિક યાત્રાઓમાં પણ એઆઇએ મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ. ચાર ધામ યાત્રા વ્યવસ્થાપન માટે પણ એઆઇ નો ઉપયોગ એક મહત્વપૂર્ણ સાધન બની શકે છે.

વર્ષ ૨૦૨૩માં આ સંખ્યા ૫૦ લાખને પાર કરી ગઈ હતી. વર્ષ ૨૦૨૪ માં, આ યાત્રા ૧૦ મે થી ૧૭ નવેમ્બર સુધી ચાલી હતી અને કુલ દિવસોની સંખ્યા ૧૫૩ આસપાસ હતી, જેમાં લગભગ ૪૮ લાખ ભક્તોએ મુલાકાત લીધી હતી. જો યાત્રા આખો સમય ચાલુ રાખવામાં આવી હોત તો આ સંખ્યા ઘણી વધારે હોત. એઆઇ કેવી રીતે મદદ કરી શકે?

જો ચાર ધામ યાત્રા માટે ઓનલાઈન બુકિંગ સિસ્ટમમાં એઆઇને એકીકૃત કરવામાં આવે, તો સિસ્ટમ મુસાફરોની બુકિંગની માહિતીનું વિશ્લેષણ કરી શકે છે અને ડિજિટલ છેતરપિંડીની પેટર્નને ઓળખી શકે છે. આ પછી સ્કેમર્સ પર રોક લગાવી શકાય છે. જો એઆઇ અધારિત ફ્રોડ ડિટેક્શન અલ્ગોરિથમ વિકસાવવામાં આવે તો મુસાફરોની બુકિંગની માહિતીનું વિશ્લેષણ સરળતાથી કરી શકાશે. તેના દ્વારા, કોઈપણ જે ડિજિટલ છેતરપિંડી કરી શકે છે અથવા કરી રહ્યો છે તેની ઓળખ કરીને રોકી શકાય છે. આજકાલ, એક બોક્સ દ્વારા એકસાથે અનેક સિમ નાખીને કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે, તેમાં પણ આ સિસ્ટમ ખૂબ મદદરૂપ થઈ શકે છે. જ્યારે કોઈ મુસાફર બુકિંગ કરે છે, ત્યારે એઆઈ સિસ્ટમ દ્વારા, મુસાફરોને નકલી એજન્સીઓથી ચેતવણી આપવા સાથે એક એડવાઈઝરી મોકલી શકાય છે, જે તેમને ડિજિટલ છેતરપિંડીથી બચાવવામાં મદદરૂપ થઈ શકે છે.

આ વર્ષે જ્યારે ચારધામ યાત્રા માટે બુકિંગ શરૂ થાય ત્યારે કયા સમયે પ્રવાસીઓ વધુ બુકિંગ કરી રહ્યા છે? કયા દિવસોની બુકિંગ તેમની પ્રાથમિકતા છે, તેની પણ એઆઇ સિસ્ટમ રિયલ ટાઈમમાં મોનિટર કરી શકે છે. આ પ્રક્રિયામાં ડિજિટલ ફ્રોડ ઓળખી શકાય છે. સ્કેમર્સની પેટર્ન દરરોજ બદલાઈ રહી છે. પહેલા તેઓ લોટરીના નામે છેતરપિંડી કરતા હતા, પછી તેઓએ બેંકના ઓટીપી વગેરેનો તેમના માધ્યમ તરીકે ઉપયોગ કર્યો અને હવે તેઓ સાયબર અરેસ્ટની આગળ નવી યુક્તિઓ વિશે વિચારી રહ્યા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ એઆઇના માધ્યમ દ્વારા તેઓ નકલી અવાજો બનાવીને ડરાવે છે અને જો ચારધામ યાત્રામાં આ કૌભાંડો શરૂ થઈ ગયા તો યાત્રાળુઓ માટે આખી યાત્રા ઘાતક બની શકે છે. તેથી જો એઆઇ દ્વારા આ શંકાસ્પદ છેતરપિંડી અટકાવી શકાય તો મુસાફરો માટે રાહતની વાત બની રહેશે. આમાં સુરક્ષિત પેમેન્ટ સિસ્ટમ પર મહત્તમ ધ્યાન આપવું પડશે. એઆઇ સિસ્ટમ સુરક્ષિત પેમેન્ટ સિસ્ટમ વિકસાવી શકે છે, જે મુસાફરોને સુરક્ષિત યુઝવણી કરવામાં મદદ કરી શકે છે.

...એઆઈ બીજું શું કરી શકે?

પ્રવાસ દરમિયાન મુસાફરોને સ્થાનિક માહિતી પૂરી પાડવી, મુસાફરી દરમિયાન તેમને સલામતી અને સગવડતા પૂરી પાડવી, તેમને મુસાફરી દરમિયાન વિવિધ સેવાઓનો લાભ લેવામાં મદદ કરવી. આ બધા ઉપરાંત, એઆઇ એ પણ કરી શકે છે કે જો તમને લાગે કે તમે ડિજિટલ છેતરપિંડીનો શિકાર બન્યા છો તો તરત જ પોલીસ અને અધિકારીઓનો ક્યાં અને કેવી રીતે સંપર્ક કરવો.

ફનવર્લ્ડ
મુંબઈ સમાચારના ફનવર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોષ્ટકના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઇલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ...

અંગ્રેજી - ગુજરાતી શબ્દોની જોડી જમાવો

A	B
DON	સોદો
DONE	પરોઢ
DAWN	લુમ
DEAL	શારડી
DRILL	અપરાધીનો સરદાર

ઓળખાણ પડી?

૧૯૪૫થી ૧૯૮૦ દરમિયાન યુગોસ્લોવિયાના પ્રાર્થમ મિનિસ્ટર ને પ્રેસિડેન્ટ એમ બે હોદ્દા સંભાળનારા સામ્યવાદી ક્રાંતિકારીની ઓળખાણ પડી?

અ) બોરિસ યેલ્ટસિન બ) મોલોટોવ ક) માર્શલ ટીટો ડ) હેરોલ્ડ વિલ્સન

ચતુર આપો જવાબ અર્થ જણાવો

હૈયાની હુતાશનને બસ હૈયામાં સંઘરીએ વાક્યમાં હુતાશન શબ્દનો અર્થ જણાવો.

અ) ગભરાટ બ) ગુસ્સાપુસ ક) અગ્નિ ડ) યુપકીદી

ગુજરાત મોરી મોરી રે

સમસ્યાને દૂર કરવા અનુકૂળ ઉપાય જડી જવો એ ભાવાર્થની કહેવતના શબ્દો આડાઅવળા થઈ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.

તેવું દર્દીને ફરમાવું ભાવ્યું વૈદે

માતૃભાષાની મહેક

હવાના પર્યાવવાયી શબ્દો છે પવન, વાયુ, અનિલ, સમીર, મસ્ત. એક હવા સો દવા એટલે તંદુરસ્તી પર હવાની સૌથી સારી અસર થાય છે. હવામાં અધ્ધર લટકવું - હાંચકા ખાવા એટલે કામ ધંધા વિના રહેવું, ઝોલાં ખાવાં અથવા ટિચાયા કરવું. હવામાં કિલ્લા બાંધવા એટલે અસંભવિત ઈચ્છાઓ કરવી.

ઈર્શાદ

તારાં સ્વપ્નોમાં છું એવો લીન કે, તું જગાડે તોય હું જાગું નહીં.

- ભગવતીકુમાર શર્મા

માઈબ્લ ગેમ

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની ઓસ્ટ્રેલિયા - વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ ટાઈ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કોણ હતા?

અ) કલાહડ વોલકોટ બ) રોહન કન્હાઈ ક) ગેરી સોબર્સ ડ) ફેન્ક વોરેલ

ગયા બુધવારના જવાબ

ભાષા વૈભવ	ઓળખાણ પડી?
A	ઉજિત પટેલ
MAD	પાગલ
MADE	બનાવ્યું
MAID	નોકરાણી
MEND	સુધારવું
MEADOW	ઘાસવાળી જમીન

ગુજરાત મોરી મોરી રે જર જમીન ને જોડે એ ત્રણેય ક્રિયાનાં છોલું

ગયા વખતનો ઉકેલ

૧	૨	૩	૪	૫	૬	૭	૮	૯	૧૦
૧૫	૧૬	૧૭	૧૮	૧૯	૨૦	૨૧	૨૨	૨૩	૨૪
૨૫	૨૬	૨૭	૨૮	૨૯	૩૦	૩૧	૩૨	૩૩	૩૪

શબ્દલાલિત્ય સતીશ વ્યાસ

૧	૨	૩	૪	૫	૬	૭	૮	૯	૧૦
૧૨	૧૩	૧૪	૧૫	૧૬	૧૭	૧૮	૧૯	૨૦	૨૧
૨૨	૨૩	૨૪	૨૫	૨૬	૨૭	૨૮	૨૯	૩૦	૩૧

- આડી ચાવી**
૧. લખ વખતે ગવાતા મંગળ ઇચ્છતા ૮ શ્લોક (૫)
 ૪. --- ભક્તિ એટલે મૂર્તિપૂજા (૩)
 ૬. ઢાંકપિછોડા, છાવરવું તે (૫)
 ૮. પ્રવચન આપનાર (૬)
 ૧૦. અંગરખું ભીડવાની નાની દોરી (૨)
 ૧૨. શત્રુવટ, ઘેપ, ગેર (૨)
 ૧૩. વાઢ વિવાદ, ખંચતાણ (૪)
 ૧૫. મડદું (૨)
 ૧૭. કિનારો (૨)
 ૧૮. સૂર્ય (૨)
 ૧૯. ગુજરાતીના જાણીતા વાતકાર (૪)
 ૨૩. જેને કોઈ ઉપમા ન આપી શકાય તે (૪)
 ૨૫. ઘરમાં થતો કંકાસ (૫)
 ૨૭. વિનાશ, કતલ, ઉચ્છેદ (૩)
 ૨૯. શ્રેષ્ઠ (૨)
 ૩૦. મોટાપણું (૪)
 ૩૧. સંસ્કાર પામેલું, એક ભાષા (૩)
 ૩૨. શિલ્પ વગેરેનો મન પર પડેલો પ્રભાવ (૩)
- ઊભી ચાવી**
૧. તખ્તા પર આવતું તે (૫)
 ૨. લોખ, લાલસા, લાંચ (૩)
 ૩. કથા કહેનાર (૪)
 ૪. મેળવડો, પરિષદ, બેઠક (૨)
 ૫. કસોટીનો મૂલ્યાંક, પ્રાપ્તકાંક (૩)
 ૭. સમૃદ્ધિ, ફોલ, લાભ (૪)
 ૯. લખ કરતાં છોકરી અને છોકરો (૪)
 ૧૧. સમાવેશ કરવો તે (૪)
 ૧૪. જલદી, ફટફટ (૨)
 ૧૬. ગમે ત્યારે કંઈ પણ થય - (૨)
 ૨૦. --- આપણે એટલે નમનું જોખવું (૩)
 ૨૧. સમાપન, સારાંશ (૫)
 ૨૨. સ્પર્ધા, કલહ (૩)
 ૨૪. મોઢું, ભવ્ય, મહત્વાણું (૩)
 ૨૬. જીવિત, જીવન (૩)
 - ૨૬-અ. દોસ્ત, મિત્ર (૨)
 ૨૮. એક જાતનું કંદ (૩)
 ૩૦. --- મારવા એટલે ખોટાં વપાણ કરવાં (૨)

અજુબ ગણબની દુનિયા

હેન્ડ્રી શાસ્ત્રી henry.shastri@bombsamachar.com

પૂરી દો મારી માને જેલમાં!



સમસ્ત યુએસએના રહેવાસીઓ કટોકટીના સમયમાં તાકીદની સહાય, રાહત માટે '૯૧૧' ટેલિફોન નંબર રાખલ કરી શકે છે. ચીઝ માટે પ્રખ્યાત અને અમેરિકાના 'ડેવિડ્સન' તરીકે ઓળખાતા વિસ્કોન્સિન રાજ્યમાં આ ઈમરજન્સી નંબર પર એક મજેદાર કોલ આવ્યો. ફોન પર ચાર વર્ષના બાળકે પોલીસને ફરિયાદ કરી કે 'પ્લીઝ, અહીં આવી મારી માને પકડી જાઓ અને એને જેલમાં પૂરી ઘો.' સામે છેડેથી બાળકને પરેશાનીનું કારણ પૂછવામાં આવ્યું, પણ બાળકે તે એક

જ રટ પકડી હતી કે 'મારી માને લઈ જાઓ.' પછી બંબર પડી કે દીકરાને કીધા વિના મા અને ઓઈસકીમ ઝાપટી ગઈ એટલે દીકરો રિસાણો અને માતૃશ્રીને પાઠ ભણાવવા કોલ કર્યો. પોલીસ ત્વરાએ ઘટનાસ્થળે પહોંચી પણ ત્યારે બાળકની મા માટેની મમતા જાગી ઊઠી અને પોલીસ મમ્મીને પકડીને લઈ જાય એવી એની કોઈ ઈચ્છા નહોતી. હસતા મોઢે પોલીસ પાછી ફરી પણ પોલીસ બીજે દિવસે પાછી આવી, ચાર વર્ષના બાળક માટે આઈસકીમની સરપ્રાઈઝ ગિફ્ટ સાથે !

આંખના પલકારામાં પર્વત પર

ચીન ટેકનોલોજીમાં ગજબનાક હરણફાળ ભરી રહ્યું છે. વાત છે ચીનના હુનાન પ્રાંતના ઝાંગજિયાજી વિસ્તારમાં સ્થિત એક એલિવેટર એટલે કે એક લિફ્ટની. ૧૦૭૦ ફૂટ ઊંચી આ મહાકાય લિફ્ટ પૃથ્વી પરની સૌથી ઊંચી, સૌથી વધુ વજન ખમવાની ક્ષમતા ધરાવતી અને સૌથી ઝડપી લિફ્ટનું બિરુદ ધરાવે છે. હુનાન પ્રાંતના સુંદર



પર્વતની ટોચ પર પહોંચવા વાહનમાં ઘણા કલાક લાગતા હતા. હવે આ લિફ્ટ સહેલાણીઓને તળેટીથી શિખર બે મિનિટથી ઓછા સમયમાં પહોંચાડી દે છે. ૧૮ કરોડ યુઆન (આશરે બે અબજ ૧૫ કરોડ રૂપિયા)ના ખર્ચે તૈયાર થયેલા આ બાંધકામમાં ત્રણ ડબલ ડેકર કાચની લિફ્ટ એકબીજાને સમાંતર આનન્દજાન કરી શકે છે. દર કલાકે ૪૦૦૦ સહેલાણીઓ પર્વતની ટોચે પહોંચી શકે છે. ધરતીકંપની સૂચના આપતી સુવિધા સહિત કેટલીક અદ્યતન સગવડ પણ છે. લિફ્ટના પ્રવાસની રિટન ટિકિટ માટે ૩૨ અમેરિકન ડોલર(આશરે ૨૮૦૦ રૂપિયા) ચૂકવવા પડે છે જે સગવડના હિસાબે પાણીનો ભાવ કહેવાય.

જ રટ પકડી હતી કે 'મારી માને લઈ જાઓ.' પછી બંબર પડી કે દીકરાને કીધા વિના મા અને ઓઈસકીમ ઝાપટી ગઈ એટલે દીકરો રિસાણો અને માતૃશ્રીને પાઠ ભણાવવા કોલ કર્યો. પોલીસ ત્વરાએ ઘટનાસ્થળે પહોંચી પણ ત્યારે બાળકની મા માટેની મમતા જાગી ઊઠી અને પોલીસ મમ્મીને પકડીને લઈ જાય એવી એની કોઈ ઈચ્છા નહોતી. હસતા મોઢે પોલીસ પાછી ફરી પણ પોલીસ બીજે દિવસે પાછી આવી, ચાર વર્ષના બાળક માટે આઈસકીમની સરપ્રાઈઝ ગિફ્ટ સાથે !

૧૦૮ની ઉંમરે કેશ - કાતર - કાંસકીની કમાલ

'ના ઉંમર કી સીમા હો, ના કર્મ કા હો બંધન, જમ કામ કરે કોઈ તો દેખે કેવલ મન...' ગીતકાર ઈન્દીવરની મૂળ રચનામાં થોડા ફેરફાર સાથેનું જીવન ૧૦૮ વર્ષનાં જેપનીઝ દાદીમા જીવી રહ્યાં છે. ભજન, કીર્તન કરવાની અને મંદિરના ઓટલે બેસી ૧૦૮ની માળા ફેરવવાની ઉંમરે ૧૦૮ વર્ષનાં હાકોઈશીના ધરાવતા દાદીમા



કેશ કર્તન, કેશ ગુંકન કરી ગ્રાહકોના મુખારવિંદ મોહક બનાવવાની જહેમત ઉઠાવી રહ્યાં છે. વિશ્વના સૌથી વયસ્ક કેશ કર્તનકારની સિદ્ધિ મેળવનારાં દાદીમાએ છેક ૧૯૩૧થી આ વ્યવસાય અપનાવ્યો છે. ૧૯૩૬માં વાળદંનું અધિકૃત લાઇસન્સ મેળવ્યું અને ૨૩ વર્ષની ઉંમરે ૧૯૩૯માં પતિની સાથે સ્વતંત્ર સેલો શરૂ કર્યું. જોકે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બોમ્બમારમાં સેલો ઉધ્વસ્ત થઈ ગયું અને સરહદે ગયેલા પતિ શહીદ થયા બાદ શ્રીમતી હાકોઈશીએ ૧૯૫૪માં વતનમાં એક ગ્રાહક બેસી શકે એવું કેશ કર્તનાલય શરૂ કર્યું, જે આજે ૭૧ વર્ષ પછી પણ કાર્યરત છે. ૭૦ વર્ષની ઉંમરે દરરોજ વ્યાયામ કરવાની આદત પાડનારાં દાદીમાની વરણી ૧૦૪ વર્ષની ઉંમરે ટોક્યો ઓલિમ્પિક્સમાં મશાલધારી તરીકે થઈ હતી. છેલ્લા દોઢેક વર્ષથી ઘૂંટણની તકલીફ થવાથી દાદીમાએ ગ્રાહકોની સંખ્યા પર કાતર ફેરવી છે. 'કામ તો થાય ત્યાં સુધી કરવું' એ સિદ્ધાંતને અનુસરતાં શ્રીમતી હાકોઈશી નિયમિત ગ્રાહકોના કેશ કર્તનનું કામ કરે છે. 'કિશોરાવસ્થાથી સંવર્ષ કરતી આવી છું, પણ આજે મોજમાં જીવી રહી છું', દાદીમાના લેખાંજોમાં છે, 'શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ટકાવી રાખવું હોય તો પૂર્વગ્રહ રાખવા નહીં, કોઈની ઈર્ષ્યા કરવી નહીં અને લગાઈ ઝઘડાથી દૂર રહેવું.'

દીર્ઘ આયુષ્યના સમીકરણ કેટલા સીમ્પલ હોય છે ને અને હા, આવી સિમ્પલ વાતો જ આપણને ગળે નથી ઉતરતી, હૈં ને!

તૈયાર ભાણાને હડસેલો

મોસાળમાં જમણ હોય ને મા પીરસણ હોય તો પછી જલસા જ પડે ને... તૈયાર ભાણે જમવા મળે તો પલ્લાંકીવાળી ભલભલા તૈયાર થઈ જાય. અલબત્ત, જગતમાં સામા વહેણે તરનારા લોકો હોય છે. તૈયાર ભાણે બેસવા તૈયાર ન હોય એવા લોકો 'કેટલી વીસે સો થાય' એની ખબર પડવી જોઈએ એવું માનતા હોય છે. ૨૭ વર્ષની ભર યુવાનીમાં યુએસની પ્રખ્યાત ફાસ્ટ ફૂડ ચેનની પ્રેસિડેન્ટ બની અખજોમાં આજોટવા લાગેલી લિન્સી સ્નાઈડરે ભર કિશોરાવસ્થામાં ૧૭ વર્ષની ઉંમરે ઉનાળા વેકેશનની જોખ મેળવવા પોતાની જ કંપનીની બહાર બે કલાક લાઈનમાં તડકામાં આજોટી હતી. મોસાળમાં જમણ અને મા પીરસણ વ્યવસ્થા એને સ્વીકારી નહોતી. માલિકની દીકરી તરીકે સ્પેશિયલ ટ્રીટમેન્ટ એને નહોતી જોઈતી. સગપણ નહીં, આવડતના આધારે કામનું મૂલ્યાંકન કરવામાં આવે એવી લિન્સીની ઈચ્છા હતી. લાચકાતના જોરે કંપનીના



સ્ટોરમાં જોખ મળ્યા પછી શાકભાજી સમારવા, ગ્રાહકોને સર્વ કરવા જેવા કામ હોંશે હોંશે કર્યા. સ્ટોર મેનેજર સિવાય એની અસલિયત કોઈ નહોતું જાણતું. પરિણામે અન્ય કર્મચારીઓ સાથે થતો તેવો જ વ્યવહાર એની સાથે પણ થતો હતો. આ વાતાવરણમાં રહેવાથી પોતાનું ઘડતર થયું એવું લિન્સી માને છે. પોતાની જ કંપનીમાં કેટલાક ડોલરનો જોખ લેનારી લિન્સી આજની તારીખમાં ૩.૭ બિલિયન ડોલરની સંપત્તિની માલિક છે.

લ્યો કરો વાત!


કોર્પોરેટ કંપનીમાં કામ કરતી મહિલાની બદલી અચાનક બીજા શહેરમાં કરવામાં આવી. હસબંધ ઓફિસના કામે બહારગામ ગયા હોવાથી એમને જાણ ન કરી શકાઈ. એટલે પતિને મેસેજ મોકલી જાણ કરી દેવામાં આવી. થયું એવું કે એ મેસેજ પતિને પહોંચવાને બદલે ભૂલથી અન્ય વ્યક્તિના નંબર પર

ગયો. વાત એમ હતી કે એ ભાઈની પત્નીનું હજી એક દિવસ પહેલા જ અવસાન થયું હતું. મેસેજ વાંચીને અજાણ્યા ભાઈ તો ધરધરી ગયા, કેમ? મેસેજ આવો હતો: 'હું અહીં સુખમ્મ પહોંચી ગઈ છું. જોકે, મને તમારી બહુ યાદ આવે છે. બે-ત્રણ દિવસમાં જ હું તમને અહીં બોલાવી લઈશ.'


ઔર યે મૌસમ હંસી... દેવલ શાસ્ત્રી

હોળી તો આવે અને જાય, ગરમીની ઋતુ આવે અને જાય પણ એક દોસ્ત કાયમી સાથે નિભાવે છે એનું નામ છે સાબુ. અહીં સાબુ એટલે 'સામાન્ય બુદ્ધિ'ની વાત નથી થતી, પણ સાબુ એટલે બાથમથાળો સાબુ. આપણે એવું માનીએ છીએ કે સાબુને શરીર પર રગડવાનો પણ રોમાનિયાવાળાઓએ બે હજાર કિલો વજન ધરાવતો સાબુ બનાવ્યો હતો. તેના પર આપણે જાતે જ રગડાવું પડતું હશે. એક કાલ્પનિક કથા એવી છે કે માઉન્ટ સેપો નામની જગ્યા પર પ્રાણીઓના બલિ આપવામાં આવતાં હતા, એ પછી એનો અગ્નિના ઉપયોગથી ભોજન તરીકે ઉપયોગ થતો હતો. પ્રાણીઓની ચરમી અને લાકડાની રાખ નદીમાં આવતી, જેનાથી મહિલાઓ કપડાં ધોતી હતી. આ સેપો પર્વત પરથી 'સોપ' શબ્દ આવ્યો હોવાનું માનવામાં આવતું હતું. સરવાળે ભોજન સામગ્રીમાંથી યોગાનુયોગ સાબુ બન્યો હોવાની પણ માન્યતા છે. આ કથાઓમાં સાબુને દેવતાઓના આશીર્વાદ સાથે પણ જોડવામાં આવ્યા હતા. વિદેશના સોપ ઓપેરામાં હાજરી આપવી એ કળા સાથે સંકળાયેલી વ્યક્તિ માટે પ્રતિષ્ઠાનો ભાગ ગણવામાં આવે છે. સોપ કંપનીઓ નાટકો તથા શોને પ્રાધોજિત કરતી હોવાથી 'સોપ ઓપેરા' શબ્દ ચલાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. સાબુ એક સમયે ક્રિમી જણાસ ગણવામાં આવતો, આફ્રિકાના ઘણા દેશોમાં નાણાકીય વ્યવહાર માટે સાબુનો ઉપયોગ કરવામાં આવતો હતો. આમ તો સાબુનો ઉપયોગ વ્યક્તિગત હોય છે. મહદંશે દરેક વ્યક્તિ સાબુ પર સ્વતંત્ર અધિકાર ધરાવતાં હોય છે. આરોગ્યની દ્રષ્ટિએ સાબુ પર સ્વતંત્ર અધિકાર હોય તો બીમારીઓથી દૂર રહી શકાય. આજકાલ તો એવું માનવામાં આવે છે કે જો પરિવારમાં કોમન સાબુ હોય તો તેના ઉપયોગ પછી ઘોઈ નાખવો જોઈએ. એનો અર્થ એ થયો કે સાબુથી શરીર ધોયા પછી સાબુને

માણસજાતનો એક કાયમી દોસ્ત નામ છે એનું 'સાબુ'!



પણ ધોવો જોઈએ. સાબુથી સ્વચ્છતા જોખવવી હોય તો કમસેકમ વીસ સેકન્ડ સુધી સાબુ ધસવો જોઈએ. સાબુનો ઉપયોગ કોવિડના સમયે આપણને વિશેષ રીતે સમજાયો હતો. આમ તો સ્વચ્છતાનો આગ્રહ ભારતીય પરંપરામાં યુગોથી છે. ત્રણ હાર નહાવું અને એક વાર ભોજનની વાત સદીઓથી ભારતીયોને શીખવવામાં આવી છે. ઘણીવાર નદીઓમાં કે તળાવમાં સ્નાન કરતી વ્યક્તિ સાબુ- પોતાની સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરતો નથી અને સાબુ વડે સ્નાન કરીને પાણીને પ્રદૂષિત કરે છે. સાબુનો ઇતિહાસ પાંચેક હજાર વર્ષ જૂનો છે. ગ્રીસ, ઇજિપ્ત કે રોમમાં સાબુની ગાથાઓ લખવામાં આવી છે, આપણે બનારસ જેવા પૌરાણિક શહેરમાં અભ્યાસ કરીએ તો અહીં પણ સાબુ જેવા દ્રવ્ય મળી શકે છે. અમેરિકામાં મીણભત્તીઓનું ઉત્પાદન કરતાં પ્રોક્ટરબાઈએ સાબુ જેવી પ્રોક્ટર પર કામ કર્યું અને તેના ગેમ્બલ નામના મિત્ર સાથે મળીને છેલ્લી સદીમાં દુનિયાની પ્રતિષ્ઠિત કંપની 'પ્રોક્ટર એન્ડ ગેમ્બલ' ઊભી કરી દીધી. પ્રારંભિક સમયમાં સાબુ પાણીમાં તરતો હોવાની વાતને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવ્યું. સાબુની પરિકલ્પનાથી ટિર્જન્ટ જેવી પ્રોક્ટર શોધવામાં આવી. યુરોપમાં સાબુનો પ્રારંભિક ઉપયોગ પછી ઘોઈ નાખવો જોઈએ. એનો અર્થ એ થયો કે સાબુથી શરીર ધોયા પછી સાબુને



ઉપયોગ થતો હતો, આ કારણે પ્રાકૃતિક નુકસાન થવાના ડરથી સાબુ પર જાતજાતના ટેક્સ નાખીને તેને અમીરો માટેની પ્રોક્ટર બનાવી દેવામાં આવી હતી. દોઢસો વર્ષ પહેલાં વિલિયમ લીવર નામના સર્જને સાબુના ઉત્પાદનમાં હાથ નાખ્યો અને જ્વલંત સફળતા મેળવી. લીવર સાહેબે પોતાના કેમિસ્ટ્રીઓને સુવિધા માટે 'પોર્ટ સનલાઇટ' નામનું નગર બનાવ્યું હતું. પહેલાં અને ખાસ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિકોની સ્વચ્છતાનો ખ્યાલ પર વિસ્તૃત ચર્ચાઓ થતાં સાબુની દુનિયાભરમાં ડિમાન્ડ વધવા લાગી હતી. અજાણ્યાના બાથરૂમમાં જઈએ તો એ ક્યાં બ્રાન્ડનો સાબુ વાપરે છે એ પરથી સામાન્ય વ્યક્તિ સ્વચ્છતા અને આર્થિક માપદંડ નક્કી થતો હોય છે. આપણે ત્યાં તો ફિલ્મ હીરોઈનોની 'સુંદરતા' નો રાહ એક ચોક્કસ બ્રાન્ડના સાબુને આભારી છે એવો વર્ષોથી તગડો પ્રચાર થાય છે ! એ અલગ વાત છે કે મોસાળમાં જતાં હતાં ત્યારે એ જ સાબુથી પંદર જણા સ્નાન કરતાં હોવા છતાં એ સમયે કોઈએ સ્વચ્છતાના પાઠ ભણાવ્યા ન હતાં. સાબુ છે સામાન્ય પ્રોક્ટર, પણ સ્નાનથી મોંઘીને ક્યાં ધોવા તથા વાસણ માંજવા સુધીના કામમાં નેતૃત્વ ધરાવે છે. નજીકના ભવિષ્યમાં AI ની મદદથી સાબુની નવી ટેકનોલોજી શોધશે, પણ સાબુ વગર માનવજાતને ચાલશે નહિ.

દા એન્ડ : સુંદરતાનો સ્વચ્છતા સાથે ગાઠ સંબંધ છે. (વેરા એલન)



રમૂજ સવાલના મનમોજી જવાબ દર્શન ભાવસાર

- બત્રીસ કોઠે દીવા થાય. તો લાઈટ કેમ નહીં?
- * કહેવત રચનારાના જમાનામાં ઇલેક્ટ્રિસિટી નહોતી.
- ડ્રીમ ગર્લ હોય તો ડ્રીમ વુમન કેમ નહીં?
- * ડ્રીમ ગર્લ યોજના માત્ર અપરિણીત યુવકો માટે છે.
- ગાંધીજી ફરીથી ભારતમાં જન્મ લે તો એમને કોઈ ઓળખે ખરાં?
- * હા, આધાર કાર્ડ- પાન કાર્ડ ને ચૂંટણી કાર્ડ હોય તો તરત ઓળખે.
- ઘરજાઈ બનવાના ફાયદા શું?
- * પત્ની વારંવાર પિયર જવાની જિદ ન કરે આત્મકથા ક્યારે લખવી જોઈએ?
- * તમારો આત્મા ને પુસ્તક પ્રકાશક જાગે ત્યારે!
- સોલો કેરી ટોપલાની બધી કેરી કેવી રીતે બગાડી શકે?
- * એક ભ્રષ્ટ નેતા જેમ આપા પક્ષને બગાડી શકે તેમ !
- મામાનું ઘર કેટલે દીવો બળે એટલે ?
- * ગૂંચળ જેટલું દૂર બતાવે એટલે!
- પંખીડાને પિંજરું જૂનું જૂનું કેમ લાગતું હશે?
- * જૂનું આપીને નવું લઈ જવાની કોઈ સ્કીમ વાંચી હશે.
- પ્રદક્ષિણા કરનારને દક્ષિણા મળે કે આપવી પડે?
- * કોની પ્રદક્ષિણા કરો છો એના પર બધો આધાર છે.
- ઝીરો બેલેન્સ -, ઝીરો કાઉન્ટ- ઝીરો ફિગર. હવે બાકી શું રહ્યું. ?
- * ઝીરોનું ઝીરો ઝીરો ! .
- ભગત કેટલા પ્રકારના હોય?
- * અઠંગ ભગત, ઠગ ભગત, મિલી ભગત, ઈત્યાદિ..
- ઘર અને બહારના યુદ્ધમાં શું ફરક?
- * બહારનું યુદ્ધ બધા જુએ- ઘરનું યુદ્ધ પાડોશી સાંભળે !
- પ્રાણ જાય પર વચન ન જાયે... આ જૂની કહેવત- આજે નવી કંઈ ?
- * હવે 'વચન જાયે, પર પ્રાણ નહીં...'
- રસગુલ્લા અને હસગુલ્લા ભેગા કરો તો?
- * મસ્તગુલ્લા બને !
- જીતે એ સિક્કદર... અને હારે એ?
- * છછુંદર. !

કરછી ચોવક કિશોર વ્યાસ

લોભી વૃત્તિ સામે લાલબત્તી



આપણે ગુજરાતી ભાષામાં પણ એક કહેવત નો ઉપયોગ કરીએ છીએ: પાઇની પેદાસ નહીં ને ઘડીની ફૂરસદ નહીં. એવી જ ચોવક પણ પ્રચલિત છે: 'પહ જ પેદાસ ન તે ઘડીજી ફૂરસત ન.' મતલબ કમાણી પણ નહીં અને સમય પણ નહીં. તો વળી ઘણા એવી પરિસ્થિતિનો પણ પોતાની પ્રસિદ્ધિ વધારવા માટે લાભ લેતા હોય છે. કામ કે સેવા ઓછી કરે પણ વાહવાલ ઘણી બોલાવે ! એવા લોકોને ચાબૂક ફટકારતી

ચોવક છે: 'પાટણ પેડીને હજાર જો હુલ્લ' અહીં 'પાટણ' શબ્દ વપરાયો છે, જે કચ્છમાં એક 'માપ'નું સાધન હતું. અને 'હુલ્લ' એટલે હલોળગલો કે અફવા એવો અર્થ થાય છે. 'પાટણ' એક નાનકડો માપ હતો. ચોવકનો મતલબ એવો કાઠી શકાય કે, કામ તો મુઠ્ઠીમાં સમાય તેટલું જ કર્યું હોય પણ યશ ખોબા જેટલો મેળવે! 'પાટણ' શબ્દ અન્ય કેટલીક ચોવકોમાં પણ વાપરવામાં આવ્યો છે. 'પાટણ પવાલા ખોટા ય માપ ય ખોટા?' સીધો અર્થ એવો થાય છે કે 'નાના' સાથે 'મોટા'ની સરખામણી ન થઇ શકે. આ ચોવક પર ફરી એકવાર નજર નાખજો મિત્રો. ચોવકમાં બે વખત માત્ર એક અક્ષરનો જ પ્રયોગ કરવામાં આવ્યો છે. એ ટૂંકાક્ષરી કચ્છી ભાષાનાં દર્શન કરાવે છે. અહીં એ 'ય' 'પણ' ના અર્થમાં વપરાયો છે. કોઇ મોટા કામનો પ્રારંભ થઇ જાય એટલે એમ કહેવાય કે 'પા શેરે મેં પેલી પૂણી'. ગુજરાતીમાં પણ આપણે બોલતા હોઇએ છીએ કે, 'પા શેરામાં પહેલી પૂણી' પણ એવા મોટાં અને મહત્વનાં કામમાં વિલંબ થાય કે, ઢીલાશ વરતાય ત્યારે ચોવક કહે છે કે, 'પાટણ મિંજા પવાલો પ પાંચ પીસાણું' અર્થ સમજાવે : એક પાટી માપનો લોટ દળવાનો હોય, પણ તેમાંનો એક પવાલો અનાજ પણ નથી દબાવ્યું! એ રીતે અહીં મોટાં કામ ન થવા બાબતે રૂપકનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એક ચોવક છે : 'બરે ઘર મિંજા કામ નિકરે સે ખાસા' ચોવકમાં જોકે ભારોભાર વ્યથા ભરેલી છે. સીધો અર્થ એ થાય કે ઘર બળી ગયા પછી જો એમાંથી બે તણખલાં પણ બચી ગયાં હોય અને હાથ લાગે, એ પણ સારાં ! ઉદાહરણ બળતાં ઘરનું આપ્યું છે પણ, જયારે બધું જ જવા બેઠું હોય ત્યારે જે કંઇ બચાવી શકાય તે કામ લાગે છે. સંબંધિત કહેવતો છે: 'ભાગતા ભૂતની ચોટલી' અને 'જે અચ્યું તે બાપનું.' તમે જોયું હશે કે, ઘણા લોકો કરકસરના નામે લોભ કરતા હોય છે. તેમ કરતાં ક્યારેક મોટું નુકસાન પણ વેકવું પડતું હોય છે. ત્યારે ચોવક કહે છે કે, 'પંજ ન ખરચીયે સે પિંજ ખરચીયે.' જે પાંચ રૂપિયા પણ ન ખરચે તેણે પચીસ ખરચી નાખવા પડે! આવા જ સંજોગોને સ્પર્શતી, પણ થોડી અલગ પડતી એક ચોવક છે: 'પાયલે જો કપા ને પોણી કોરી પિંજાણી' 'પાયલો' એ કચ્છ રાજ્યનું ચલણ હતું. જેનું મૂલ્ય 'એક ટકા' જેટલું જ હતું. એવા એક પાયલાથી ખરીદેલા કપાસની પિંજાણી પોણી કોરી ચૂકવવી પડે. તો એ સરવાળે મોંઘું જ ગણાય ને! આ 'કોરી' પણ કચ્છી ચલણનું નામ છે. ગુજરાતીમાં આપણે બોલતા જ હોઇએ છીએ કે : 'ઘાટ કરતાં ઘડામણ મોંઘું' બસ એવો જ અર્થ થાય છે કે, મૂળ ચીજ કરતાં તેની માવજત મોંઘી પડે ! આપણે હમણાં લોભી વૃત્તિના લોકો અંગેની ચોવક માણી. એવી લોભી વ્યક્તિને જયારે કંઈ જ ફાયદો ન થાય ત્યારે એમ કહેવાય કે, 'બાઇ રિખ બીં કનાં' મતલબ કે બધી બાજુથી લાભ ગુમાવવો. અહીં 'બાઇ' શબ્દ સ્ત્રીના પ્રતિકાત્મક રૂપે મૂકવામાં આવ્યો છે. 'બીંકના' એટલે બન્ને બાજુથી સ્ત્રીને પ્રતીક રાખીને બનાવેલી બીજી પણ એક ચોવક છે: 'બાઇ જા બેર આંને અઢશ શેર' મતલબકે, લેખાં જોખાં કે કોઇકની સરખામણીમાં ફાયદો જોવા ન મળે કે ઉતરતી કક્ષા જણાય ત્યારે આ ચોવક વપરાય છે.

નાગપુર હિંસા પૂર્વનિયોજિત, 'છાવા'એ ભડકાવી લોકલાગણી

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઔરંગઝેબના નામે થયેલી હિંસા પર વિધાનસભામાં આપ્યું નિવેદન



(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યું હતું કે, નાગપુરમાં થયેલી હિંસા પૂર્વનિયોજિત લાગે છે જેમાં ટોળાએ ચોક્કસ ઘરોને નિશાન બનાવ્યા હતા, અને કહ્યું કે 'છાવા' ફિલ્મે મોગલ સમ્રાટ ઔરંગઝેબ વિરુદ્ધ લોકોની લાગણીઓને ફરી ભડકાવી હતી.
વિધાનસભામાં બોલતા ફડણવીસે કહ્યું કે છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત વિકી કૌશલ અભિનીત ફિલ્મ 'છાવા'એ મરાઠા રાજાનો સાચો ઇતિહાસ લોકો સમક્ષ રજૂ કર્યો છે, એમ તેમણે કહ્યું હતું.
તે (ફિલ્મ) પછી, લોકોની લાગણીઓ ફરી ભડકી ઊઠી છે. ઔરંગઝેબ સામેનો ગુસ્સો મોટા પાયે પ્રદર્શિત થઈ રહ્યો છે, એમ મુખ્ય પ્રધાને કહ્યું હતું.
સોમવારે ઔરંગઝેબની કબર સામેના વિરોધ પ્રદર્શનને કારણે હિંસા ભડકી ઊઠી હતી. જે દરમિયાન અનેક ઘરો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, જેના કારણે નાગપુર શહેરના અનેક વિસ્તારોમાં કફરૂં લાદવામાં આવ્યું છે. ગુહ મંત્રાલય સંભાળતા ફડણવીસે જણાવ્યું હતું કે હિંસામાં ત્રણ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સહિત અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા અને એક વરિષ્ઠ અધિકારી પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જે લોકોએ પોલીસ પર હુમલો કર્યો છે તેમને બક્ષવામાં આવશે નહીં. 'ટોળાએ ચોક્કસ ઘરો અને સંસ્થાઓને નિશાન બનાવી હતી. આ (હુમલો) પૂર્વનિયોજિત લાગે છે,' એમ ફડણવીસે કહ્યું હતું. 'કેટલાક લોકોનો પૂર્વનિયોજિત પેટર્ન હોય તેવું લાગે છે. ચોક્કસપણે તેમની સામે (જુઓ પાનું ૪) >>>



હાઉ ઇમ ઘ બેશ?
નાગપુરમાં હિંસા દરમિયાન કુહાડીથી જેના પર હુમલો કરાયો હતો એ ડીસીપી સાથે વીડિયો કોલ પર વાત કરી રહેલા દેવેન્દ્ર ફડણવીસ. (પીટીઆઈ)

રાજ રમખાણોની:
નાગપુરમાં સોમવારે રાત્રે ફાટી નીકળેલી હિંસાને પગલે અનેક વાહનોને આગ ચાંપવામાં આવી હતી. (પીટીઆઈ)

ત્રણ ઘટના હિંસાની ને ડીસીપી નિકેતન કદમ પર કુહાડીથી હુમલો...

ખરેખર શું બન્યું હતું?

નાગપુરમાં છેલ્લા બે દિવસમાં હિંસાની ત્રણ અલગ અલગ ઘટનાઓ બની છે. નાગપુરના મહાલના ઝંડા ચોક ખાતે બે જૂથ વચ્ચે થયેલી અથડામણ બાદ સોમવારે આગ લાગવાના તેમ જ વાહનોની તોડફોડના કિસ્સા જોવા મળ્યા હતા. બીડને વિખેરતી વખતે લોકોના એક જૂથે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જવાબમાં પોલીસે ટિયર ગેસના સેલ છોડીને ટોળાને વિખેરી નાખ્યું હતું. આ ઘટનામાં કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. આમાં ડીસીપી સ્તરના અધિકારી નિકેતન કદમ પર પણ હુમલા થયા હતા. એક ડીસીપી પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હોવાનું મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
૧૭ માર્ચે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ ઔરંગઝેબની કબર દૂર કરવાની માગણી કરતા સુત્રોચ્ચાર કર્યા હતા. આ વખતે, તેઓએ ઔરંગઝેબની પ્રતીકાત્મક કબરને બાળી નાખી. આ પછી, ગણેશપેઠ પોલીસે બપોરે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યા. તે સાંજે પછી અફવા ફેલાઈ કે સવારે સળગાવવામાં આવેલી પ્રતીકાત્મક કબર પરના કપડા પર ધાર્મિક લખાણ લખેલું છે. અટ્ટારોલમાં પ્રાર્થના પૂર્ણ થયા પછી ૨૦૦થી ૨૫૦ લોકોના ટોળાએ સુત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. આ જ લોકોએ ઇમારતને આગ લગાવી દેવાની હિંસા નિવેદનો આપ્યા બાદ પોલીસે ઘટનાસ્થળે બળપ્રયોગ કર્યો હતો.
આ પછી, પોલીસે ફરિયાદીઓને તે સવારે બનેલી ઘટના સામે કાર્યવાહી કરવા માટે બોલાવ્યા. કેટલાક પર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો અને ઘણા વાહનો સળગાવી દેવામાં આવ્યાહતા, એવું ફડણવીસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું.
હિંસાની ત્રીજી ઘટના ભાલકારપુરા વિસ્તારમાં (જુઓ પાનું ૪) >>>

પોલીસ પર હુમલો કરનારાને પાકિસ્તાનમાંના અબ્બા યાદ કરાવી દેશે દેવાભાઉ: નિતેશ રાણે

મુંબઈ: ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન નિતેશ રાણેએ નાગપુર હિંસાની ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે 'પોલીસ સામે હાથ ઉપાડનારાઓને અમે છોડીશું નહીં. આવી ઘટના કંઈ પહેલી વાર નથી બની. આ કેવો વિરોધ છે? શા માટે આ જેહાદીઓ હંમેશા પોલીસને નિશાન બનાવે છે? અમારી પોલીસ પર હુમલો કરનારાઓને પાકિસ્તાનમાં તેમના 'અબ્બા' યાદ કરાવી દેશે.'
અહેવાલો અનુસાર નાગપુરના મહલ વિસ્તારમાં ભડકેલી હિંસામાં ૩૩ પોલીસ કર્મચારી અને પાંચ નાગરિકો ઘાયલ થયા છે. એક પોલીસ અધિકારી પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુર પોલીસને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ વિસ્તારમાં સીઆરપીએફના પાંચ યુનિટ તહેનાત કરવામાં આવ્યા છે.
નિતેશ રાણેએ વધુમાં જણાવ્યું હતું કે 'સાચું બોલવામાં અને હિન્દુઓ પડખે ઊભા રહેવામાં કશું ખોટું નથી. સનાતન ધર્મને મારો ટેકો છે. પાઠ્યપુસ્તકમાંથી ઔરંગઝેબની હકાલપટ્ટી થવી જ જોઈએ - આ કોંગ્રેસનું પાપ છે. અગાઉ ભિવંડી (જુઓ પાનું ૪) >>>

પાંચ એફઆઈઆર, ૫૦ કસ્ટડીમાં, ૩૪ પોલીસ જખમી

નાગપુર: ઔરંગઝેબની કબરની સામે થયેલા વિરોધ પ્રદર્શન બાદ થયેલી હિંસાના એક દિવસ બાદ પચાસથી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તથા નાગપુરના અમુક ભાગમાં કફરૂં લગાવી દેવામાં આવ્યું છે. આ હિંસા પૂર્વનિયોજિત હોવાનો દાવો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યો હતો.
ઔરંગઝેબનો ગુણગાણ વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) ક્યારેય સહન કરશે નહીં અને નાગપુર હિંસા પૂર્વનિયોજિત હોવાનો પણ દાવો કર્યો હતો.
આ હિંસા પ્રકરણે અત્યાર સુધી પાંચ એફઆઈઆર નોંધવામાં આવી હોવાનું નાગપુર પોલીસ કમિશનર રવિન્દ્ર કુમાર (જુઓ પાનું ૪) >>>

ભાભીની હત્યા કરી ભત્રીજાનું અપહરણ કરવાના કેસમાં આરોપી ૨૩ વર્ષે પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિરારમાં ગળું ચીરીને ભાભીની હત્યા કર્યા બાદ ભત્રીજાનું કથિત અપહરણ કરવાના કેસમાં ૨૩ વર્ષથી ફરાર આરોપી આખરે ડોમ્બિવલીમાં પકડાયો હતો. મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની કાઈમ બ્રાન્ચ યુનિટ-૩ના ઇન્ચાર્જ અવિરાજ કુરોડેની ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ મોહમ્મદ તબરેઝ મોહમ્મદ ઈદ્રિસ અન્સારી (૫૨) તરીકે થઈ હતી. મોટી ઓળખ ઊભી કરીને અન્સારી બે દાયકાથી ડોમ્બિવલીમાં રહેતો હતો. પોલીસના જણાવ્યા મુજબ ઘટના છઠ્ઠી જૂન, ૨૦૦૨ના રોજ વિરારમાં બની હતી. અન્સારીના ભાઈની પહેલી પત્ની શબાના પરવીન (૩૦)ની તીક્ષ્ણ હથિયારથી ગળું ચીરી કરપીણ હત્યા કરવામાં આવી હતી. ■

ઑક્ટોબર પછી જ થશે બીએમસીની ચૂંટણી

મુંબઈ: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ ઑક્ટોબર પછી જ યોજાશે, એવી માહિતી પાલિકાનાં સૂત્રોએ આપી છે. મહાનગરપાલિકા અને રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ વચ્ચે તાજેતરમાં એક બેઠક યોજાઈ હતી. આ વખતે ચૂંટણીને લઈને ચર્ચા થઈ છે. એવું કહેવાય છે કે જો સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપે તો પણ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ ઑક્ટોબર પછી જ યોજાશે.
બીએમસીની ચૂંટણી અંગે આગામી સુનાવણી ૪ મેના રોજ

થશે. જો પરિણામ મે મહિનામાં જાહેર થાય તો પણ ચોમાસા પહેલાં મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાશે નહીં. પ્રાથમ માહિતી અનુસાર પરિણામ જાહેર થયા પછી વહીવટકર્તાઓને ચૂંટણીની તૈયારી કરવામાં લગભગ ૧૦૦ દિવસનો સમય લાગશે. આમાં વોર્ડની રચના, યાદી ચકાસણી, વાંધા અરજીઓ માટે આમંત્રણ અને અનામત મુક્તિનો સમાવેશ થશે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ પછી, બધાનું ધ્યાન હવે નગરપાલિકાની ચૂંટણીઓ ક્યારે યોજાશે તેના પર કેન્દ્રિત છે. વિધાનસભા ચૂંટણી પછી રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી ક્યારે (જુઓ પાનું ૪) >>>

કાલબાદેવીમાં ગે સંબંધ બાંધતી વખતે પ્રૌઢ બેભાન, પછી થયું મોત

મુંબઈ: દક્ષિણ મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં સમલૈંગિક સંબંધ બાંધતી વખતે બેભાન થઇ ગયેલા પંચાવન વર્ષના પ્રૌઢનું મૃત્યુ થયું હતું. બેભાન પાઈનરને સારવારથી હોસ્પિટલમાં લઇ જવાને બદલે તેને મરવાની હાલતમાં છોડી તેનો મોબાઇલ લઇ પલાયન થયેલા ૩૪ વર્ષના યુવક વિરુદ્ધ એલ.ટી. માર્ગ પોલીસે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન તામ્બેએ જણાવ્યું હતું કે આ કેસમાં અમિત દિવેકરની ધરપકડ કરવામાં આવી હતી. દિવેકરને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને ૨૧ માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. કાલબાદેવી વિસ્તારમાં રહેનારા

પ્રૌઢનો મૃતદેહ ૧૬ ફેબ્રુઆરીએ ઘરમાંથી મળ્યો હતો. ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હોવાની જાણ પ્રૌઢના પિતરાઇએ પોલીસને કરી હતી. મૃતદેહને જી. ટી. હોસ્પિટલમાં મોકલ્યા બાદ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે પ્રૌઢ અને આરોપી વચ્ચે ઘણાં વર્ષોથી સમલૈંગિક સંબંધ હતા. ૧૪ ફેબ્રુઆરીએ પણ બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. એ સમયે પ્રૌઢ બેભાન થઇ ગયો હતો. આરોપી ત્યારે ડરી ગયો હતો અને પ્રૌઢને બેભાન હાલતમાં છોડી તેનો મોબાઇલ લઇ પલાયન થઇ ગયો હતો. પોલીસનું કહેવું છે કે જો પ્રૌઢને સમયસર તબીબી મદદ મળી હોત તો તેનો જીવ બચી ગયો હોત. ■

ડોમેસ્ટિક

વિમાન પ્રવાસ પહેલી જૂનથી મોંઘો થશે?

મુંબઈ: મુંબઈ એરપોર્ટથી ઉપડતા ડોમેસ્ટિક વિમાન પ્રવાસીઓ માટે જૂનથી હવાઇ ભાડાં વધી શકે છે, કારણ કે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ. (એમઆઇએએલ)એ એરલાઈન્સ પાસેથી યુઝર ડેવલપમેન્ટ ફી (યુડીએફ) વસૂલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમ છતાં એમઆઇએએલએ વિમાનોના લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જસ ઘટાડવાનો પ્રસ્તાવ મૂકીને આ ફીને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે.
એમઆઇએએલએ ૧૭મી માર્ચના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઇએ)ના ચોથા નિયંત્રણ સમયગાળા માટે એરોનોટિકલ ટેરિફ માટે તેનો વાર્ષિક ટેરિફ રજૂ કર્યો હતો જે પહેલી એપ્રિલ, ૨૦૨૪થી શરૂ થયો હતો અને ૩૧મી માર્ચ, ૨૦૨૬ સુધી ચાલશે.
એમઆઇએએલએ એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એઇઆરએ)ને સોંપેલા પોતાના પ્રસ્તાવમાં અદાણી ગ્રૂપે મુંબઈ એરપોર્ટનું સંચાલન હાથે લીધા બાદ પ્રથમ વખત ટેરિફમાં સુધારો કરવાની માગણી કરી હતી. ૬૫નીએ પ્રથમ વખત (જુઓ પાનું ૪) >>>

ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બેંક કેસ ૧૮ કરોડ લઈ જનાર ભાજપના નેતાના નાના ભાઈ જાપેદ આઝમની ધરપકડ

અમારી વ્યથા આરબીઆઇ સમજે...

બેંકના ૩૩ કરોડ રૂપિયાની ઉંચાપત ધરપકડ કરી હતી. દરમિયાન આ કેસના મુખ્ય આરોપી હિતેશ મહેતા પર ૧૧ માર્ચના રોજ પોલીસ ટેસ્ટ કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ પોલીસને મળ્યો હતો. હિતેશ મહેતા પૂછપરછ દરમિયાન પૈસાના વ્યવહારો અંગે પોતાનાં નિવેદનો બદલતો રહ્યો હતો અને તે તપાસમાં સહકાર પણ આપતો નહોતો. આથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતો દ્વારા મહેતા પર આ ટેસ્ટ કરાવાઇ હતી અને મહેતા ખોટું બોલ્યો હોવાની આ પર પહોંચી છે. આ કેસમાં મહિનાથી ફરાર અરુણાચલમ રવિવારે આર્થિક ગુના શાખાને શરણે થયો હતો અને તેની બાદમાં ધરપકડ કરાઇ હતી.

ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બેંક કેસ



ઉન્નનાથનની પૂછપરછમાં જાવેદ આઝમનું નામ સામે આવ્યું હતું, જે તેના સંપર્કમાં હતો. તપાસમાં જણાવ્યું હતું કે ઉન્નનાથન અને તેના પુત્ર મનોહરે આઝમના નાના ભાઇ જાવેદ આઝમની ઉંચાપત ધરપકડ કરી હતી. આ કેસના આરોપી ઉન્નનાથન અરુણાચલમે જાવેદને વ્યવસાય માટે ૧૮ કરોડ રૂપિયા આપ્યા હતા, એવું તપાસમાં જણાવ્યું હતું. ક્રાંદિવલીના રહેવાસી અને ઇલેક્ટ્રિકલ ડીલર જાવેદ આઝમને મંગળવારે અદાલતમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને ૨૪ માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. જાવેદની ધરપકડ સાથે હવે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા સાત પર પહોંચી છે. આ કેસમાં મહિનાથી ફરાર અરુણાચલમ રવિવારે આર્થિક ગુના શાખાને શરણે થયો હતો અને તેની બાદમાં ધરપકડ કરાઇ હતી.

અમારી વ્યથા આરબીઆઇ સમજે...

બેંકના ડિપોઝિટરોએ કરી અરજી: બેંકને ફરી ધમધમતી કરવાની અરજ

થાણે: ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેંકના ૧૨૨ કરોડ રૂપિયાની ઉંચાપત સામે આવ્યા બાદ તેના ડિપોઝિટર્સનું પ્રતિનિધિત્વ કરતી એક સંસ્થાએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજ કરી છે, જેમાં તેમની નાણાકીય મુશ્કેલીઓનો અંત લાવવા માટે બેંકને ફરી ધમધમતી કરવા માટે ત્વરિત પગલાં લેવાની માગણી કરવામાં આવી છે. એ અરજીમાં સંસ્થાએ જણાવ્યું છે કે તેમને શંકા છે કે જાહેર કરાયેલ નોન-પર્ફોર્મિંગ અસેટ્સ (એનપીએ) અથવા વધારાની છેતરપિંડી જેવી નાણાકીય ગેરરીતિ કટોકટીમાં વધારો કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બેંકની પ્રબાદેવી અને ગોરેગામ બ્રાન્ચમાંથી ૧૨૨ કરોડ રૂપિયાની ઉંચાપત કરવામાં આવી હતી. આ કેસમાં આર્થિક ગુના શાખાએ બેંકના ભૂતપૂર્વ જનરલ મેનેજર હિતેશ મહેતાની ૧૫ ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. બેંકની પ્રબાદેવી અને ગોરેગામ બ્રાન્ચની સેફમાં રોકડ નોંધપાત્ર રીતે ઓછી થઇ હોવાનું આંતરિક આર્કાઇવમાં બહાર આવ્યા બાદ તપાસ શરૂ કરાઇ હતી. અસરગ્રસ્ત નાગરિકો અને કો-ઓપરેટિવ સોસાયટીઓનો સમાવેશ ધરાવતા ન્યૂ ઇન્ડિયા કો-ઓપરેટિવ બેંક ડિપોઝિટર્સ ફાઉન્ડેશન દ્વારા આરબીઆઇના ગવર્નર સંજય મલહોત્રાને વિધિસર રીતે વિવિધ માગણીઓ સાથેનું આવેદનપત્ર સુપરત કર્યું છે, જેમાં તેમની નાણાકીય મુશ્કેલીઓ દૂર કરવા અને બેંકને ફરી ધમધમતી કરવા માટે તાત્કાલિક સુધારણા પગલાં લેવાની વિનંતી કરવામાં આવી છે. (પીટીઆઇ) ■

અનધિકૃત મસ્જિદ તોડવામાં નિષ્ફળ

થાણે પાલિકાને હાઈ કોર્ટે બરાબર ફટકારી

મુંબઈ: કાયદાનું ઉલ્લંઘન કોઈ કાળે ચલાવી નહીં લેવાય એ વાત કાયદાનો અમલ કરનારાઓએ નાગરિકોના મનમાં ઠસાવી દેવી જરૂરી છે કે એમ બોમ્બે હાઇકોર્ટે અનધિકૃત મસ્જિદ તોડી પાડવામાં નિષ્ફળ થવા બદલ થાણે મહાનગરપાલિકાની ઝાટકણી કાઢી જણાવ્યું છે.
અથવા સંગઠનને તે દેશના કાયદાનું પાલન કરશે નહીં અને કોઈ પણ આધાર પર તેનો વિરોધ કરશે એમ કહેવાની મંજૂરી પણ ઠસાવી દેવી જરૂરી છે કે એમ બોમ્બે હાઇકોર્ટે પાલન કરે એ કાયદાનો અમલ કરવાનારાઓની ફરજ છે.
ખંડપીટે ઉમેર્યું હતું કે કાયદાનું ઉલ્લંઘન અને/અથવા રાજ્ય દ્વારા કાયદાનો અમલ કરવા સામેનો વિરોધ કોઈ કાળે ચલાવી લેવામાં નહીં આવે એ બાબત કાયદાનો અમલ કરનારાઓએ નાગરિકોના મનમાં ઠસાવી દેવી જરૂરી છે. આ દેશના એક પ્રાઈવેટ પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો. બોરિવડે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજ પર આપ્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે થાણે જિલ્લામાં તેની માલિકીની જમીન પર ગેરકાયદે અને અનધિકૃત રીતે એક મસ્જિદ અને પ્રાર્થના શાસનમાં કોઈ વ્યક્તિ / વ્યક્તિના જૂથ હોલ બનાવવામાં આવ્યા હતા. (પીટીઆઈ)

માથેરાનમાં જડબેસલાક બંધ

અલીબાગ: માથેરાનની મુલાકાતે આવતા પ્રવાસીઓ સાથે વધતી જતી છેતરપિંડીનો અંત લાવવાની માંગણી સાથે ગઇ કાલથી માથેરાનમાં અનિશ્ચિતકાળ માટે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. માથેરાન પ્રવાસન બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવેલી આ અપીલનો માથેરાનના લોકોએ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો.
માથેરાન આવતા પ્રવાસીઓને ઘોડસવારો, કુલીઓ અને દસ્તૂરી નાકા પર ભીડમાં ઉભા રહેલા એજન્ટો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવે છે. તેમ જ તેમને મોટી માહિતી આપીને છેતરવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું. આથી માથેરાન પ્રવાસન બચાવ સંઘર્ષ સમિતિએ પ્રવાસીઓ સામે થતી છેતરપિંડી અટકાવવા માથેરાનના વહીવટકર્તાઓને લેખિત નિવેદન સુપરત કરીને માંગ કરી હતી.
જોકે, વહીવટીતંત્રે આ માગણીઓ પર ધ્યાન આપ્યું ન હતું. તેથી, માથેરાન પ્રવાસન બચાવ સંઘર્ષ સમિતિએ મંગળવારથી માથેરાનમાં અનિશ્ચિત સમય માટે બંધનું એલાન કર્યું હતું.
માથેરાન બિઝનેસ એસોસિએશન, હોટેલ એસોસિએશન, રાજકીય પક્ષો, ઇ-રિશ્તા એસોસિએશન અને વિવિધ સામાજિક સંગઠનોએ બંધને ટેકો આપી માર્કેટ, હોટલો, હાથ રિક્ષાઓ અને ઇ-રિક્ષાઓ બંધ રાખી હતી.
બંધને પગલે માથેરાનમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ મેયર અજય સાવંતે જણાવ્યું કે 'માથેરાન એક વિખ્યાત પર્યટન સ્થળ બની ગયું છે. આવી છેતરપિંડીથી પ્રથમથી કારણે માથેરાન બદનામ થઈ રહ્યું છે. ભવિષ્યમાં માથેરાનને આના દૂરગામી પરિણામો ભોગવવા પડી શકે છે. તેથી, આ પ્રકારની વસ્તુ બંધ કરવી જરૂરી છે.' ■



થાણેમાં સીસીટીવી સર્વેલન્સ શરૂ
ચેન સ્પેસિંગ, રેસ ફાઇવિંગ જેવી વધતી જતી ઘટનાઓને કાબૂમાં લાવવાના પ્રયાસ રૂપે મહારાષ્ટ્રના થાણે જિલ્લા ગ્રામીણ પોલીસે ગઈ કાલે સીસીટીવી સર્વેલન્સ પહેલ શરૂ કરી છે.

તેજના જબર ઉછાળા સાથે સેન્સેક્સે ૭૫,૦૦૦ની સપાટી ફરી હાંસલ કરી, જ્યારે નિક્કી ૩૨૬ની જમ્પ સાથે ૨૩,૦૦૦ની વધુ નિકટ સરક્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: તેજ માટે એકથી વધુ પરિબળો એકત્ર થતાં ઉછાળાની ચાલ બીજા દિવસે પણ ચાલુ રાખતા સેન્સેક્સે ૧,૧૩૧ પોઈન્ટની છલાંગ સાથે ૭૫,૦૦૦ની સપાટી પાછી મેળવી લીધી છે. વૈશ્વિક શેરબજારોમાં તેજના વલણ વચ્ચે વ્યાપક ખરીદીને કારણે મંગળવારે એનએસઈ બેન્ચમાર્ક નિક્કી પણ ૧.૪૫ ટકા ઉછળ્યો હતો. સત્રને અંતે સેન્સેક્સ ૧,૧૩૧.૩૧ પોઈન્ટ અથવા ૧.૫૩ ટકા ઉછળીને ૭૫,૩૦૧.૨૬ પોઈન્ટના સ્તર પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન, તે ૧,૨૧૫.૮૧ પોઈન્ટ અથવા ૧.૬૩ ટકા વધીને ૭૫,૩૮૫.૭૬ની સપાટી પર બંધ થયો હતો. નિક્કી ૩૨૫.૫૫ પોઈન્ટ અથવા ૧.૪૫ ટકા ઉછળીને ૨૨,૮૩૪.૩૦ પર બંધ થયો.

સેન્સેક્સ પેકમાંથી ઝોમેટો, આઇસીઆઇસીઆઇ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ અને લાર્સન એન્ડ ટુબ્રો સૌથી વધુ વધ્યા હતા; જ્યારે માત્ર બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોપ લુઝરની યાદીમાં હતા. તેજ માટે આજે અનેક પરિબળ ભેગા થયાં હતાં, જેમાં મજબૂત વૈશ્વિક સંકેતો સાથે ટેકનિકલ સ્થિતિસ્થાપકતાનું પણ સંચોજન હતું. વોલ સ્ટ્રીટ અને એશિયન શેરબજારની તેજ પાછળ ભારતીય શેરબજારોમાં પણ જોરદાર તેજ જોવા મળી હતી. ચીનના આર્થિક દૃષ્ટિકોણ અંગે રોકાણકારોનો આશાવાદ વધ્યો

હોવાથી મંગળવારે હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ત્રણ વર્ષની ટોચે પહોંચ્યો હતો. હેંગ સેંગ ઇન્ડેક્સમાં આજ સુધીમાં ૨૩ ટકાનો વધારો થયો છે, જે તેને શ્રેષ્ઠ પ્રદર્શન કરતું મુખ્ય વૈશ્વિક બજાર બનાવે છે. એશિયાના અન્ય ભાગોમાં, ચીની મુખ્ય ભૂમિના શેરોમાં નજીવો વધારો થયો, જ્યારે એમએસસીઆઇના એશિયા-પેસિફિક શેરના સૌથી વ્યાપક સૂચકાંકમાં એક ટકાનો વધારો થયો. સિએલ, સિડની અને તાઈપેઈના બજારોમાં પણ તેજ જોવા મળી. દરમિયાન, જાપાનના નિકી ૧.૫ ટકા ઉછળ્યો, જે ત્રણ અઠવાડિયામાં તેનો સૌથી મોટો દૈનિક વધારો છે. અમેરિકામાં, શેરબજારો રાતોરાત સ્થિર થયા, જોકે એપ્રિલમાં ટ્રમ્પ દ્વારા પ્રસ્તાવિત પારસ્પરિક ટેરિફ અમલમાં આવવાની હોવાથી રોકાણકારોનું વલણ સાવચેતીપૂર્ણ રહ્યું છે. ચીનના સ્ટિમ્યુલસ પેકેજથી બજારને ઇંધણ મળ્યું છે. ચીને સ્થાનિક માગને વધારવા માટે પ્રયાસો ઝડપી બનાવ્યા છે, જેમાં બાળ સંભાળ સબસિડી અને વપરાશને ટેકો આપવા માટે ખાસ કાર્ય યોજના જેવા નવા પગલાંનો સમાવેશ થાય છે.

જાન્યુઆરી-ફેબ્રુઆરીના સમયગાળામાં ચીનમાં છૂટક વેચાણમાં વધારો થયો હતો, જેનાથી સ્થાનિક ખર્ચને પુનઃજીવિત કરવાનો પ્રયાસ કરી રહેલા નીતિ નિર્માતાઓને રાહત મળી હતી. આ હિલચાલથી ખાસ કરીને મેટલ સેક્ટરમાં મોટો આશાવાદ જોવા મળ્યો છે. આ ક્ષેત્રની મુખ્ય ખેલાડી હિન્દાલ્કો



ઇન્ડસ્ટ્રીઝના શેરમાં બે ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. એકદંદરે, વિશ્વના ટોચના કોમોડિટી ગ્રાહકો તરફથી મજબૂત માગની અપેક્ષાઓ પર ધાતુના શેરોમાં વધારો થયો

હતો. ફેબ્રુઆરીમાં યુએસ રિટેલ વેચાણમાં ૦.૨ ટકાનો વધારો થયો હતો. રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો થયો હતો. એશિયા-પેસિફિક બજારોએ વોલ સ્ટ્રીટના સુધારાને

ટ્રેક કર્યો, કારણ કે ગુલાબી રિટેલ વેચાણના ડેટાએ નિકટવર્તી મંદીના ભયને ઓછો કરવામાં મદદ કરી. જોકે, વૃદ્ધિ અપેક્ષાઓ કરતાં ઓછી રહી, જે વેપાર ટેરિફ અને યુ.એસ. દ્વારા દબાયેલી હતી. ફેડરલ રિઝર્વમાં તાજેતરના પગલાં છટકાને લગતી ચાલી રહેલી અનિશ્ચિતતા પર પ્રકાશ પાડે છે. એક અલગ અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે ન્યુ યોર્ક રાજ્યમાં ફેબ્રુઆરી પ્રવૃત્તિમાં લગભગ બે વર્ષમાં સૌથી તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી આર્થિક મંદીની અપેક્ષાઓ વધુ મજબૂત બની છે. રિટેલ અને ફેબ્રુઆરી પ્રવૃત્તિના ઓછા ડેટાએ યુ.એસ. પર ભાર મૂક્યો. ડોલર અને બોન્ડ યીલ્ડ દબાણ બનાવ્યું, જ્યારે સોનાના ભાવને ટેકો મળ્યો.

યુરો અને અન્ય મુખ્ય ચલણો સામે યુએસ ડોલર. રોકાણકારોએ વધતા વૈશ્વિક વેપાર તણાવની અસરનું મૂલ્યાંકન કરતા ડોલર પાંચ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. મંગળવારે ચલણ બજારમાં, ભારતીય રૂપિયો ૮૬.૭૬૨૫ પ્રતિ યુએસ ડોલર પર નજીવો વધારો થયો હતો, જે અગાઉના બંધ ૮૬.૮૦ ની સરખામણીમાં ડોલરની નબળાઈનો ફાયદો હતો.

દરમિયાન, ઓલા ઇલેક્ટ્રિકના શેર મોટા કડકા સાથે ઓલ ટાઇમ નીચા સ્તરે પટકાતાં, કંપનીના બજારમૂલ્યમાં પાછલા સત્રમાં ૧,૬૦૧ કરોડ રૂપિયાનું ધોવાણ જોવા મળ્યું હતું. આ કંપનીએ જણાવ્યું હતું કે તેની વહીવટ રજિસ્ટ્રેશન સર્વિસ પ્રોવાઇડર (વાહન નોંધણી

સેવા પ્રદાતા: કંપની રોજમેટા ડિજિટલ સર્વિસીસ લિમિટેડ તેની સંપૂર્ણ માલિકીની શાખા ઓલા ઇલેક્ટ્રિક ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ સામે નાદારીની કાર્યવાહી શરૂ કરવાની માગ કરી છે. પાછલા સપ્તાહે ટોચની ૧૦ સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી પાંચના માર્કેટ કેપમાં ૮૩,૩૫૭.૫૨ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો, જેમાં આઇટી જાયન્ટ્સ ઇન્ફોસિસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસને સૌથી મોટો ફટકો પડ્યો હતો. જે સ્થાનિક ઇક્વિટીમાં નબળા વલણને અનુરૂપ છે. ગયા અઠવાડિયે, બીએસઈ સેન્સેક્સ બેન્ચમાર્ક ૫૦૩.૬૭ પોઈન્ટ અથવા ૦.૬૮ ટકા ઘટ્યો અને એનએસઈ નિક્કી ૧૫૫.૩ પોઈન્ટ અથવા ૦.૬૮ ટકા ઘટ્યો. શેરબજાર શુક્રવારે ઊંચીના તહેવાર નિમિત્તે બંધ રહ્યા હતા.

દરમિયાન, જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવો (ડબલ્યુપીઆઇ) આધારિત કુલાવો ૨.૩૧ ટકા હતો. ફેબ્રુઆરી ૨૦૨૪માં તે ૦.૨ ટકાના સ્તરે હતો. સતત ત્રણ મહિનાના ઘટાડા પછી ડબલ્યુપીઆઇમાં સાધારણ વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરીની સરખામણીમાં ફેબ્રુઆરી મહિનામાં ડબલ્યુપીઆઇમાં માસિક તુલનાત્મક ધોરણેનો ફેરફાર ૦.૦૬ ટકા રહ્યો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, ફેબ્રુઆરી, ૨૦૨૪માં કુલાવો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિનખાદ્ય ચીજો અને કાપડના ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.

રિઝર્વ બેન્ક વ્યાજદરમાં ફરી ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરશે?

મુંબઇ: ફેબ્રુઆરીમાં છૂટક કુલાવો ઘટીને સાત મહિનાના નીચલા સ્તરે ૩.૬૧ ટકા થયો છે. ભારતીય રિઝર્વ બેંક ૮ એપ્રિલના રોજ દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરવા જઈ રહી છે. એવી અપેક્ષા છે કે સેન્ટ્રલ બેંક વ્યાજદરમાં વધુ ૦.૨૫ ટકાનો ઘટાડો કરી શકે છે. ભારતની કેન્દ્રીય બેંક આરબીઆઇ એપ્રિલ મહિનામાં રેપો રેટ અંગે મોટી જાહેરાત કરી શકે છે. એપ્રિલના બીજા અઠવાડિયામાં યોજનારી આરબીઆઇ મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા છે. ફેબ્રુઆરી મહિના માટે જાહેર કરાયેલા છૂટક કુલાવોના આંકડા ૪ ટકાના લક્ષ્યાંકથી નીચે આવી ગયા છે.

મંત્રાલયે જાહેર કરેલા છૂટક કુલાવોના આંકડા મુજબ ફેબ્રુઆરી મહિનામાં છૂટક કુલાવોનો દર ઘટીને ૩.૬૧ ટકા થયો છે, જે જાન્યુઆરીમાં ૪.૩૮ ટકા હતો. એપ્રિલના બીજા અઠવાડિયામાં ૭ થી ૮ એપ્રિલ દરમિયાન આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં નાણાકીય નીતિની બેઠક યોજાશે અને આ બેઠકમાં મોંઘા ઇએમઆઈથી ચિંતિત લોકોને ફરી એકવાર રાહત મળી શકે છે.

આ પહેલા ૭ ફેબ્રુઆરીએ આરબીઆઇએ રેપો રેટ ૬.૫૦ ટકાથી ઘટાડીને ૬.૨૫ ટકા કર્યો હતો. હવે એવી અપેક્ષા રાખવામાં આવે

છે કે જ્યારે નવા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ની શરૂઆતમાં એપ્રિલ મહિનામાં આરબીઆઇની એમપીસી બેઠક યોજાશે, ત્યારે છૂટક કુલાવોમાં મોટા ઘટાડાને કારણે, આરબીઆઇ ફરી એકવાર રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. ફેબ્રુઆરી મહિનામાં ખાદ્ય કુલાવોમાં મોટો ઘટાડો થયો છે. ફેબ્રુઆરીમાં ખાદ્ય કુલાવોનો દર ઘટીને ૩.૭૫ ટકા થયો છે, જે જાન્યુઆરીમાં ૫.૮૭ ટકા હતો. ખાદ્ય કુલાવો લાંબા સમયથી આરબીઆઇ માટે ચિંતાનો વિષય રહ્યો છે. શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને કારણે કુલાવો ઘટ્યો છે અને રવિ પાક સારા થવાને કારણે કુલાવો વધુ ઘટવાની અપેક્ષા છે. આરબીઆઇ કુલાવોમાં ઘટાડો થયા પછી, રેપો રેટ ઘટાડવાની પ્રક્રિયા ચાલુ રાખી શકે છે, જેથી વપરાશને પ્રોત્સાહન મળી શકે. કોઈપણ પુરવઠા-બાજુના આંકડા વિના ખરીદી પાકનું ઉત્પાદન સારું થવાથી, શિયાળાની ઋતુમાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાથી અને રવી પાકના બમ્પર ઉત્પાદનની અપેક્ષાઓને કારણે આગામી દિવસોમાં ખાદ્ય કુલાવોના દબાણમાં ઘટાડો થઈ શકે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કુલાવોનો દર ૪.૮ ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે ચોથા ક્વાર્ટરમાં કુલાવોનો દર ૪.૪ ટકા રહી શકે છે.

બુલિયન માર્કેટમાં જોરદાર તેજી: શુદ્ધ સોનાએ ₹ ૮૮,૧૦૦ની સપાટી વટાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: શેરબજાર સપ્તાહના પહેલા દિવસે સ્થિર થવા મથી રહ્યું છે ત્યારે સોનાચાંદી બજારમાં જોરદાર ઉછાળા સાથે તેજનો પવન ફૂંકાયો છે. ખૂલતા બજારમાં સોનાના ભાવમાં દસગ્રામે રૂ. ૧૦૪૪થી ૧૦૪૪૮નો ઉછાલો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીમાં રૂ. ૧૬૬૩ પ્રતિ કિલોનો ઉછાળો છે.

ઝવેરી બજારમાં ખૂલતા સત્રમાં ૮૮૮૮ ટયુનું શુદ્ધ સોનું રૂ. ૮૮,૧૦૧ના પાછલા બંધ સામે રૂ. ૧૫૫ના ઉછાળા સાથે રૂ. ૮૮,૨૫૬ પ્રતિ દસ ગ્રામ બોલાયું છે, જ્યારે ૮૮૫ ટયુના શુદ્ધ સોનાના ભાવ રૂ. ૮૭,૭૪૮ પ્રતિ દસ ગ્રામના પાછલા બંધ સામે રૂ. ૧૫૫ના ઉછાળા સાથે રૂ. ૮૭,૮૦૩ની સપાટીએ ખૂલ્યા છે.

આ તરફ ચાંદી પણ રૂપિયા એક લાખ તરફ ધસમસી રહી છે. મુંબઇના ઝવેરી બજારમાં .૯૯૯ ટયુની હાજર ચાંદી રૂ. ૯૯,૭૬૭ના બંધ સામે રૂ. ૧૬૨ના ઉછાળા સાથે ખૂલતા સત્રમાં રૂ. ૯૯,૯૨૯ બોલાઈ હતી. નોંધવું રહ્યું કે, દિલ્હી અને ગુજરાતના અમુક શહેરોમાં ચાંદીએ સોમવારે જ એક લાખ રૂપિયાની સપાટી વટાવી નોંખી હતી.

સત્રને અંતે શુદ્ધ સોનું રૂ. ૨૫૩ના વધારા સાથે રૂ. ૮૮,૩૫૪ની સપાટી પર સ્થિર થયું હતું, જ્યારે સ્ટાન્ડર્ડ સોનું દસ ગ્રામે રૂ. ૨૫૨ના વધારા સાથે રૂ. ૮૮,૦૦૦ની સપાટીએ પહોંચ્યું હતું, એ જ સાથે હાજર



ચાંદી કિલોએ રૂ. ૬૩૩ના ઉછાળા સાથે રૂ. ૧,૦૦,૪૦૦ની સપાટીએ સ્થિર થઈ હતી. સોનામાં ભાવ વધારા માટેના ત્રણ મુખ્ય કારણોમાં ડોનલ્ડ ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા સાથે જ વધેલા ભૂરાજકીય તણાવ, ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધી રહેલી નબળાઈ અને શેરબજારમાં ઘટાડાને સ્થાન આપી શકાય, જેને કારણે લોકો સોનામાં રોકાણ વધારી રહ્યા છે.

ટોચના બુલિયન ડીલરે જણાવ્યું હતું કે, તાજા કારણો જોઈએ તો અમેરિકા પછી ચુકે દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો અને વધતા ભૂરાજકીય તણાવને કારણે સોનાને ટેકો મળી રહ્યો છે. તેમજ, ગોલ્ડ ઇટીએફમાં રોકાણ પણ વધી રહ્યું છે. આ કારણે પણ સોનાની માગ વધી રહી છે.

ઓનલાઇન એક્સચેન્જ પર સોનાના ભાવ

રૂ. ૮૮,૦૦૦થી ઉપર નવા ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા છે, જ્યારે કોમેક્સ ગોલ્ડે ૩,૦૦૦ ડોલરની સપાટી પાર કરી દીધી છે. આ તેજને અનેક દેશોમાં વિવિધ ઉત્પાદનો પર સતત યુએસ ટેરિફ દ્વારા વેગ મળ્યો છે, જેમાં આલ્કોહોલ અને કોન્કો જેવા યુરોપિયન માલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ટેરિફની ચિંતાઓ બજારના સહભાગીઓને સાવચેત રાખી રહી છે, જેના કારણે સોનાની ખરીદી સતત ચાલુ રહી છે. આ અઠવાડિયે, યુએસ રિટેલ સેલ્સ ડેટા અને ફેબ્રુઆરી નીતિ બેઠક અને નિવેદન જેવી મુખ્ય ઘટનાઓ સોના માટે આગામી ચાલ નક્કી કરવામાં નિણાયક રહેશે.

યુએસ ટેરિફ અંગે અનિશ્ચિતતા, ટ્રેડ વોર તથા ભૂરાજકીય સંકટ ફરી ત્રાટકવાની આશંકા તેમ જ ફેડરલ રિઝર્વ દ્વારા નાણાકીય નીતિમાં

છૂટછાટની વધતી અપેક્ષાઓ વચ્ચે વૈશ્વિક બજારોમાં મજબૂત વલણને પગલે સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવ નવા વિક્રમી સ્તરે પહોંચ્યા છે.

દિલ્હી અને ગુજરાતના અમુક શહેરોમાં ચાંદીએ સોમવારે જ એક લાખ રૂપિયાની સપાટી વટાવી નોંખી છે. સિનિયર કોમોડિટી એનાલિસ્ટના જણાવ્યા અનુસાર, કિંમતી ધાતુઓમાં રેકોર્ડબ્રેક તેજ માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં કેન્દ્રીય બેંક દ્વારા ખરીદી અને વૈશ્વિક આર્થિક અસ્થિરતાનો સમાવેશ થાય છે. વધુમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર અને આર્થિક નીતિઓને કારણે વિશ્વભરમાં આર્થિક અનિશ્ચિતતામાં વધારો થવાથી સેફ હેવન એસેટની માગમાં વધારો થયો છે.

કુલાવોમાં ઘટાડો થવાને કારણે યુએસ ફેડરલ વ્યાજ દરમાં વધુ ઘટાડો કરશે એવી અપેક્ષાઓ મજબૂત થતાં સોનાચાંદીના ભાવ રોજ નવી વિક્રમી સપાટી નોંધાવી રહ્યા હોવાનું બજારના સાધનો જણાવે છે.

અમેરિકાએ પુષ્ટિ આપી છે કે જ્યાં સુધી યમનના હુથીઓ લાલ સમુદ્રના શિપિંગ પર હુમલા બંધ ન કરે ત્યાં સુધી તેમના પર હુમલા ચાલુ રહેશે, જેના કારણે ભૂરાજકીય જોખમોએ સોનાના ભાવમાં વધારો કર્યો છે, જેનાથી આ ક્ષેત્રમાં તણાવ વધ્યો છે. આ ઉપરાંત મંગળવારે ઇઝરાયેલે હમાસ પર અરે સ્ટ્રાઇફ કરીને ૨૦૦ જેટલા લોકોને કાર કર્યા હોવાના અહેવાલ પણ છે.

વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં રૂપિયા ચાર લાખ કરોડ ઠાલવ્યા

મુંબઇ: ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ)ના ઈન્કલોની ટ્રેન્ડિંગે ચાલુ નાણાં વર્ષ ઈકિવટી બજાર માટે એકદમ ખરાબ રહ્યું હોવાનો એક અભ્યાસ જણાવે છે, જે મુજબ વર્તમાન નાણાં વર્ષમાં વિદેશી રોકાણકારોની કેશમાં રૂપિયા ચાર લાખ કરોડથી વધુની વેચવાલી નોંધાઇ છે.

વર્તમાન નાણાં વર્ષના ઓક્ટોબર મહિનાથી દેશના શેરબજારોમાં વિદેશી સંરચાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની એકધારી વેચવાલી ચાલુ રહેતા ભારતીય ઈકિવટી બજારમાંથી એફઆઈઆઈના આઉટફોલોની ટ્રેન્ડિંગે વર્તમાન નાણાં વર્ષ એકદમ જ ખરાબ

પૂરવાર થયું છે. વર્તમાન નાણાં વર્ષમાં વિદેશી રોકાણકારોની ઈકિવટી કેશમાં વેચવાલી રૂપિયા ચાર લાખ કરોડને પાર કરી ગઈ છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ અઠવાડિયા મહિનામાં ભારતીય ઈકિવટીસમાં વિદેશી રોકાણકારોની કેશમાં અત્યારસુધીમાં રૂપિયા ૪.૨૩ લાખ કરોડથી વધુની નેટ વેચવાલી રહી છે. ગયા નાણાં વર્ષ એટલે કે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં વિદેશી રોકાણકારોની રૂપિયા ૧૪૩૮૫ કરોડની નેટ વેચવાલી જોવા મળી હતી.

વર્તમાન નાણાં વર્ષના ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતીય ઈકિવટીસમાં મોટું

કરેકશન જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ ૭.૩૦ ટકા અને નિક્કીમાં ૮.૩૦ ટકા ઘટાડો થયો હતો, જે ૨૦૨૨ના જૂન ત્રિમાસિક બાદ સૌથી મોટો ત્રિમાસિક ઘટાડો જોવા મળ્યો હતો.

અમેરિકામાં નવા પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના શાસનમાં ટેરિફ વોર ઉપરાંત વેપાર ખોરવાઈ જવાની ધારણાંએ ઈકિવટી બજારમાં વેચવાલી આવી હતી. આ ઉપરાંત અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થીમો પડવાના સંકેતે પણ વિદેશી રોકાણકારોનું માનસ ખરડાયેલું છે.

કેટલીક રેટિંગ એજન્સીઓ દ્વારા વર્તમાન

નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો આવી પડ્યો છે, જે દેશની એકંદર આર્થિક સ્થિતિના સંકેત આપે છે. સેકન્ડરી બજારમાં વેચવાલ રહીને વિદેશી રોકાણકારો પ્રાઈમરી માર્કેટમાં નાણાં ઠાલવી રહી છે, પરંતુ તેની માત્રા ઘણી જ સામાન્ય છે.

ડોલરમાં મજબૂતાઈને કારણે વિદેશી રોકાણકારો સતત વેચાણ કરી રહ્યાં બજારના વર્તુળો માની રહ્યા છે. તાજેતરના સમયમાં ડોલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ તથા અમેરિકન બોન્ડ યીલ્ડ ઊંચા રહેતા એફઆઈઆઈની વેચવાલી જળવાઈ રહી છે.

રૂપિયો અમેરિકન ડોલર સામે ૨૬ પૈસા વધીને ૮૬.૫૫ પર બંધ થયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઇ: સકારાત્મક સ્થાનિક ઇક્વિટી બજારો અને નબળા અમેરિકન ચલણ વચ્ચે મંગળવારે ફોરેક્સ માર્કેટમાં અમેરિકન ડોલર સામે રૂપિયો સતત ત્રીજા સત્રમાં મજબૂતી સાથે આગળ વધતાં ૨૬ પૈસાના સુધારા સાથે ૮૬.૫૫ (પ્રોવિઝનલ)ની સપાટી પર બંધ થયો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે અમેરિકાના નિરાશાજનક આર્થિક ડેટાને કારણે યુએસ ડોલર ઘટ્યો હતો. વધુમાં,

એશિયન ચલણોની મજબૂતાઈને પણ રૂપિયાને ટેકો આપ્યો હતો. જોકે, ફૂડ બજારો અને નબળા અમેરિકન ચલણ વચ્ચે મંગળવારે ફોરેક્સ માર્કેટમાં અમેરિકન ડોલર સામે રૂપિયો સતત ત્રીજા સત્રમાં મજબૂતી સાથે આગળ વધતાં ૨૬ પૈસાના સુધારા સાથે ૮૬.૫૫ (પ્રોવિઝનલ)ની સપાટી પર બંધ થયો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે અમેરિકાના નિરાશાજનક આર્થિક ડેટાને કારણે યુએસ ડોલર ઘટ્યો હતો. વધુમાં,

એનએસઈ પર આઈએલએન્ડએફએસ ઈન્વેસ્ટમેન્ટ્સ લિસ્ટિંગ

મુંબઇ: ઇન્ફોસ્ટ્રક્ચર લીમિટેડ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસીઝ (આઇએલએન્ડએફએસ) એનએસઈ પર રોસ્ટાર ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ઇન્વીટ (આરઆઇઆઇટી)નું લિસ્ટિંગ કર્યું હતું. છ મુખ્ય રોડ એસેટ્સ ધરાવતા ઇન્વીટના ડિસ્ટ્રીબ્યુશનના પગલે આરઆઇઆઇટીનું ૮,૫૮૨ કરોડના એન્ટરપ્રાઇઝ વેલ્યુએશન પર લિસ્ટિંગ થયું હતું, જે ડેટ રિસોલ્યુશનના વૈવિધ્યપૂર્ણ ફાઇનાન્સિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો અસરકારક રીતે ઉપયોગ કરવાની આઇએલએન્ડએફએસ યુપીની ક્ષમતાને દર્શાવે છે. રોસ્ટાર ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સ્પોન્સર્ડ રોસ્ટાર ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની સ્થાપના પ્રત્યક્ષ કે પરોક્ષપૂર્ણ ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં માલિકી, સંચાલન અને રોકાણના ઉદ્દેશ્યો કરવામાં આવી હતી અને તે ઇન્વીટ નિયમનો હેઠળ રજિસ્ટર્ડ છે.

પ્રત્યક્ષ કર વસૂલાત ૧૬ ટકા વધીને ₹ ૧૬.૯૦ ટ્રિલિયનના સ્તરે પહોંચી

નવી દિલ્હી: સોમવારે જાહેર કરાચલા સરકારી આંકડા મુજબ, આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ચોખ્ખી પ્રત્યક્ષ કર વસૂલાત ૧૫.૮૮ ટકા વધીને લગભગ રૂ. ૧૬.૯૦ ટ્રિલિયનના સ્તરે પહોંચી હોવાનું સત્તાવાર આંકડા મારફત જાણવા મળે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના ડેટા મુજબ, ચોખ્ખા બિન-કોર્પોરેટ કરવેરામાંથી કુલ આવક રૂ. ૮.૭૪ ટ્રિલિયનથી વધુ રહી છે, જેમાં મુખ્યત્વે વ્યક્તિગત આવક વેરો શામેલ છે. પહેલી એપ્રિલ, ૨૦૨૪ અને ૧૨ જાન્યુઆરી, ૨૦૨૫ વચ્ચે ચોખ્ખી કોર્પોરેટ કર વસૂલાત રૂ. ૭.૬૮ ટ્રિલિયનના સ્તરે રહી હતી. સિક્સિયોરિટીઝ ટ્રાન્સફરેન્સ ટેક્સ (એસટીટી)માંથી કુલ આવક રૂ. ૪૪,૫૩૮ કરોડ નોંધાઈ છે. આ સમયગાળા દરમિયાન રૂ. ૩.૭૪ ટ્રિલિયનથી વધુના રિફંડ જારી કરવામાં આવ્યા છે, જે એક વર્ષ પહેલાના સમયગાળા કરતા ૪૨.૪૯ ટકા વધુ છે. પહેલી એપ્રિલથી ૧૨ જાન્યુઆરી દરમિયાન કુલ પ્રત્યક્ષ કર વસૂલાત ૨૦ ટકા વધીને રૂ. ૨૦.૬૪ ટ્રિલિયનથી વધુ થઈ ગઈ છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રત્યક્ષ કરમાંથી રૂ. ૨૨.૦૭ ટ્રિલિયન એકત્રિત કરવાનું બજેટ રાખ્યું છે. જેમાં રૂ. ૧૦.૨૦ ટ્રિલિયનનો કોર્પોરેટ કર વસૂલાત, રૂ. ૧

અબડાસા તાલુકામાં ઘઉંનું વિક્રમી વાવેતર: ૩૫૦ કરોડથી વધુની આવકનો અંદાજ

(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજ: કચ્છના પશ્ચિમ કાંઠાના અબડાસા તાલુકાના વિસ્તારને દાયકાઓથી સ્થાયી થયેલા પંજાબ-હરિયાણાના પ્રયોગશીલ ખેડૂતોએ હરિયાણો બનાવ્યો છે અને દર વર્ષે ઘઉંના પાકમાં પંજાબ-હરિયાણાની જેમ

મોટું ઉત્પાદન કરી અબડાસાના ઘઉંને દેશના વિસ્તારોમાં મોકલી રહ્યા છે, તેવામાં આ વર્ષે તો વિક્રમી એક લાખ એકરમાં વાવેતર કર્યું હોવાથી અંદાજે ૩૫૦ કરોડથી વધુની આવક એક માત્ર ઘઉં રળી આપે તેવો અંદાજ બાંધવામાં આવ્યો છે. ઘઉં કાઢવા માટે ખાસ

પંજાબ, હરિયાણા, રાજસ્થાનથી ૬૦ જેટલાં હાર્વેસ્ટર મશીન અબડાસામાં આવી પહોંચ્યાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અબડાસાના લગભગ તમામ વિસ્તારમાં આ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે, ગત

ચોમાસામાં વધુ વરસાદ અને બિપરજોય વાવાઝોડાંના લીધે અબડાસાના ખેડૂતોને કપાસમાં મોટી નુકસાની ખમવી પડી હતી. જો કે આ વર્ષે થયેલા વિક્રમી ઘઉંના ઉત્પાદનનાં કારણે ખેડૂતોને નુકસાનીનું સાટું વાળી દેશે અને ભાવ સારા મળવાની આશા છે.


અમદાવાદમાં મંગળવાર રાતથી બે દિવસનું કોમ્બિંગ શરૂ: પોલીસે ૧૫૦ ટપોરી ઝડપ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: શહેરના વજ્રાલ વિસ્તારમાં તાજેતરમાં બનેલી ઘટના બાદ શહેર પોલીસ ફરીથી ગુનેગારોને કંટ્રોલ કરવા માટે કોમ્બિંગ શરૂ કર્યું હતું. ગુનેગારોને શિસ્તના પાઠ

શીખવાડવા માટે મંગળવાર રાતથી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તમામ જગ્યાએ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વિસ્તારમાં ગુનેગારોને કંટ્રોલ કરવા માટેની

કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે ૧૫૦ ટપોરીને રાઉન્ડ અપ કર્યા હતા. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં કાર્ડમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ ડેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરતા

ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો. આગામી બે દિવસ સુધી આ કાર્યવાહી ચાલશે અને અત્યાર સુધીમાં ૧૫૦ જેટલા લોકોને રાઉન્ડ ઓફ કર્યા હોવાની વિગત અમદાવાદ કાર્ડમ બ્રાન્ચના અધિકારી પાસેથી જાણવા મળી હતી.



રાજકોટ મનપા દ્વારા શહેરના રેસકોર્સ રિંગરોડ પર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. (તસવીર-પ્રવીણ સેદાણી, રાજકોટ)

૧૫ વર્ષથી કાયમી ભરતી ન થતાં વ્યાયામ શિક્ષકોના ગાંધીનગરમાં ધરણા

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: ગુજરાત માં છેલ્લા ૧૫ વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થવાના મુદ્દે શિક્ષકોએ આંદોલન હેતુ ઇ. ગાંધીનગરના રામકથા મેદાનમાં એકઠા થયેલા વ્યાયામ શિક્ષકોની પોલીસે અટકાયત કરી હતી. આંદોલનકારી શિક્ષકોએ સરકારની ખેલ સહાયક યોજના સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમના મતે આ યોજના શાળાના બાળકો અને વ્યાયામ શિક્ષકોના હિતમાં નથી. શિક્ષકોનું કહેવું છે કે ૧૧ માસના કરાર આધારિત આ યોજનામાં અનેક ખામીઓ છે. વ્યાયામ શિક્ષકોની મુખ્ય ફરિયાદો છે કે રજાઓ

માટે કોઈ સ્પષ્ટ નિયમો નથી. વળી, ૧૧ માસ પૂરા થયા પહેલાં જ કોઈ લેખિત સૂચના વગર મૌખિક રીતે છુટા કરી દેવામાં આવે છે. પગારની બાબતમાં પણ અસમાનતા છે. કેટલાક જિલ્લાઓમાં પગાર મળે છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં પગાર જ ચૂકવવામાં આવતો નથી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ખેલ સહાયકોને છૂટા કરવા માટે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે. જોકે, પ્રાથમિક વિભાગ માટે કોઈ પરિપત્ર જારી કરવામાં આવ્યો નથી. શિક્ષકોએ આ મુદ્દે અનેક વખત સરકારમાં રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી.

માટે કોઈ સ્પષ્ટ નિયમો નથી. વળી, ૧૧ માસ પૂરા થયા પહેલાં જ કોઈ લેખિત સૂચના વગર મૌખિક રીતે છુટા કરી દેવામાં આવે છે. પગારની બાબતમાં પણ અસમાનતા છે. કેટલાક જિલ્લાઓમાં પગાર મળે છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં પગાર જ ચૂકવવામાં આવતો નથી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ખેલ સહાયકોને છૂટા કરવા માટે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે. જોકે, પ્રાથમિક વિભાગ માટે કોઈ પરિપત્ર જારી કરવામાં આવ્યો નથી. શિક્ષકોએ આ મુદ્દે અનેક વખત સરકારમાં રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ બહાર ૨૫૦૦ વાહનની ૧૨ કિ.મી. લાંબી લાઈનો: ઘાણા, ઘઉં, જીરું, કપાસ, મગફળીના ખડકલા

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી ઘઉં, જીરું, યજ્ઞ સહિતના શિયાળુ પાકની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મંગળવાર સવારથી જ યાર્ડની બહાર વિવિધ જણસીઓ લઈને આવેલાં વાહનોની ૧૨ કિમીથી વધુ લાંબી લાઈનો જોવા મળી હતી. યાર્ડ દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે કમવાર ૨,૫૦૦ કરતાં વધુ વાહનને પ્રવેશ આપી તમામ

જણસીઓની ઉત્તરાર્ધ કરાવવામાં આવી હતી. એમાં ઘઉં અને ઘાણાની સૌથી વધુ આવક નોંધાઈ હતી. ઘાણાની બે લાખ મણ અને ઘઉંની દોઢ લાખ મણ આવક નોંધાઈ હતી, જ્યારે જીરું, કપાસ અને મગફળી સહિતની વિવિધ જણસીના ખડકલા યાર્ડમાં થયા હતા. પ્રાપ્ત વિગત મુજબ, આજે માર્કેટિંગ યાર્ડમાં કુલ ૨,૫૦૦ કરતાં વધુ વાહનોમાં વિવિધ જણસીઓ લઈને ખેડૂતો આવી પહોંચ્યા હતા, જેમાં ઘઉંની ૧.૫ લાખ મણ જેવી આવક

થતાં લોકવનના રૂ. ૪૮૨થી ૫૪૧ અને ઘઉં ટુકડા રૂ. ૪૮૩થી ૬૦૪ના ભાવ બોલાયા હતા, જ્યારે ઘાણાની પણ ૨ લાખ મણ આવક નોંધાવામાં રૂ. ૧૨૫૦થી રૂ. ૧૮૩૫ સુધીના ભાવ મેથીના રૂ. ૯૨૦થી રૂ. ૧,૩૨૫, ૨૫/૨૫ યોગના રૂ. ૬૬૦થી રૂ. ૧,૨૩૫ના ભાવ બોલાયા હતા. ખેડૂતો શિયાળુ પાકનું વેચાણ કરવા માટે સતત મોટી સંખ્યામાં ઊભટી રહ્યા છે. આ ઉપરાંત મગફળી ૨૫,૫૦૦ મણ, તુવેર ૭,૫૦૦ મણ, મેથી ૨૫,૦૦૦ મણ, ૨૫-૨૫ યોગ

૫,૦૦૦ મણ અને કપાસ ૫,૦૦૦ મણની આવક થઈ હતી, જેમાં મગફળીના રૂ. ૯૪૦થી રૂ. ૧૨૦૫, તુવેરના રૂ. ૧,૧૦૧થી રૂ. ૧,૪૨૬, ૧૨૫૦થી રૂ. ૧૮૩૫ સુધીના ભાવ મેથીના રૂ. ૯૨૦થી રૂ. ૧,૩૨૫, ૨૫/૨૫ યોગના રૂ. ૬૬૦થી રૂ. ૧,૨૩૫ના ભાવ બોલાયા હતા. ખેડૂતો શિયાળુ પાકનું વેચાણ કરવા માટે સતત મોટી સંખ્યામાં ઊભટી રહ્યા છે. આ ઉપરાંત મગફળી ૨૫,૫૦૦ મણ, તુવેર ૭,૫૦૦ મણ, મેથી ૨૫,૦૦૦ મણ, ૨૫-૨૫ યોગ

લોકસાહિત્યકાર દેવાયત ખવડના આગોતરા જામીન મંજૂર: જાનથી મારી નાખવાની ધમકી મામલે ફરિયાદ નોંધાઈ હતી

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: લોકસાહિત્યકાર દેવાયત ખવડના આગોતરા જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મંજૂર કર્યા હતા. દેવાયત ખવડ સામે ફરિયાદી ભગવતસિંહ ચૌહાણ દ્વારા અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. જેની સામે દેવાયત ખવડે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજ દાખલ કરી હતી. તેની ઉપર ચુકાદો આપતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ગાયક દેવાયત ખવડને આગોતરા જામીન આપ્યા હતા. આ મામલે ફરિયાદીએ પોતાની ફરિયાદમાં લખાવ્યું હતું કે, ૨૦ ફેબ્રુઆરીના રોજ તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી અને

લોક ડાયરાનું આયોજન કર્યું હતું, જેમાં પોતાના સગા સંબંધી અને સમાજના લોકોને બોલાવ્યા હતા. તેના માટે લોક સાહિત્યકાર દેવાયત ખવડની એપોઇન્ટમેન્ટ લઈને ૮ લાખ રૂપિયામાં કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. ફરિયાદીના ભત્રીજાએ રોકડા ૮ લાખ રૂપિયા દેવાયત ખવડને આપ્યા હતા. પરંતુ તેઓ ડાયરામાં હાજર થયા નહોતા. આમ દેવાયત ખવડે એક તરફ રૂપિયા લઈને પ્રોચામમાં હાજર ના થઈને ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. વળી ફોન ઉપર ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બીજી તરફ દેવાયત ખવડે પણ કોસ ફરિયાદ આપી હતી. જેમાં તેમના ડાહ્યવર પર હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું.



રાજકોટમાં સતત બીજા દિવસે આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત હતી, જેથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવા ખોરવાઈ હતી. (તસવીર-પ્રવીણ સેદાણી, રાજકોટ)

વડોદરામાં આઠ લોકોને અડકેટ લેનારા રક્ષિત ચૌરસિયા વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદ

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ: વડોદરાના કરેલીબાગ વિસ્તારમાં ૮ લોકોને ઉડાવ્યા બાદ ભૂમખૂમ કરનાર આરોપી રક્ષિત ચૌરસિયાને કોર્ટે જુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરતાં મંગળવાર સવારે વડોદરા સેન્ટ્રલ જેલના પોલીસ અધિકારી સામે પાર્સિંગ માટે રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ તેનું નામ અને કયા કેસમાં લાવવામાં આવ્યો છે એ બાબતે સવાલો કર્યા હતા. ત્યાર બાદ કેદી તરીકે રક્ષિતનું એડમિશન કરવામાં આવ્યું હતું અને આરોપી રક્ષિતને યાર્ડ નંબર-૧૨ સ્થિત બેરેક નંબર ૧૪ ફાળવવામાં આવી હતી. ત્યાર બાદ તેને બેરેકમાં લઈ જવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી કાર્યાલયક રક્ષિત ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ)નો વતની છે અને તેની સામે પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો. આ ઉપરાંત પોલીસે આરોપીની બાજુમાં ખેસલા પ્રાણુ ચોડાણની પણ અટકાત કરી હતી. કાર્યાલયક રક્ષિત ચૌરસિયા એમ.એસ. યુનિવર્સિટીમાં કાયદાનો અને પ્રાણુ ચોડાણ પાસલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.

કચ્છ પોલીસે ૧૯૦૦ જેટલા અસામાજિક પ્રવૃત્તિ આચરતા શખ્સોની યાદી બનાવી

(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજ: આગામી ૧૦૦ કલાકમાં અસામાજિક પ્રવૃત્તિ આચરનાર આવાસો તત્વોની યાદી તૈયાર કરવાના આદેશને પગલે પૂર્વ કચ્છ પોલીસે ૧૯૦૦ જેટલી વ્યક્તિઓની યાદી તૈયાર કરી છે. રાજ્યના ડી.જી.પી. વિકાસ સહાયના આદેશ બાદ પૂર્વ કચ્છ પોલીસના પોલીસવડા સાગર બાગમારની સૂચનાથી હરકતમાં આવેલી પોલીસે પૂર્વ કચ્છમાં આવેલા જુદા જુદા પોલીસ મથકોમાં અસામાજિક પ્રવૃત્તિ આચરનાર ૧૯૦૦ જેટલા વ્યક્તિઓની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં શરીર સંબંધના ૨૨૪, દારૂ (પ્રોહિબિશન)ના

૧૧૦૦, મિલકત સંબંધી ગુના આચરતા ૨૮૦ તેમજ વારંવાર જુગારમાં પકડાતા, પતિજ ચોરી કરતા અને અન્યો મળીને આશરે ૧૯૦૦ જેટલા શખ્સોના નામ તૈયાર કરવામાં આવ્યા છે. પૂર્વ કચ્છ પોલીસે યાદી કરવાની સાથે કાર્યવાહીનો પણ પ્રારંભ કરી દીધો હતો, જેમાં દબાણ હટાવ, વીજબિલ ફટકારવું, વીજ જોડાણ કાપવું વગેરે કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આગામી સમયમાં આવા અમુક અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ જુદા જુદા રીતે કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું.

(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજ: શહેરમાં મટન શોપ ચલાવતાં ૨૫ વર્ષિય યુવકને આદિપુરની યુવતી મારફતે પ્રેમ જાળમાં ફસાવી પાંચ જણે કાવતરું ઘડીને નકલી પતિ અને નકલી પોલીસ બનીને ૨૧ લાખ રૂપિયા પડાવી લીધાં હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો હતો. ગત ૧૭-૧૧-૨૦૨૪થી ૨૫-૦૨-૨૦૨૫ દરમિયાન બનેલા હનીટ્રેપના બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસે આદિપુરની મુસ્કાન નામની યુવતી સહિત પાંચ સામે ગુનો દાખલ કરીને

ભુજમાં હનીટ્રેપ વડે યુવકને ફસાવી, ૨૧ લાખ પડાવાયા: કોંગ્રેસી કાઉન્સિલર સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવાઈ

કેટલાંક આરોપીઓની અટક કરી ગહન પૂછપરછ હાથ ધરી હતી. શહેરના હાલુન જ્વેલર્સ પાસે ખાટકી ફળિયામાં રહેતા અને મટન શોપ ધરાવતા મહેબૂબ શખ્તિખાન ખાટકીએ બનાવ અંગે મુસ્કાન, કોંગ્રેસી રોડ પર ધારાનગરમાં રહેતા કોંગ્રેસી કાઉન્સિલર અબ્દુલ્લ હમીદ સમા, ખાટકી ફળિયામાં રહેતા સરફરાઝ રજાક ખાટકી, અંજારના મામદ નોરે તથા પોલીસ તરીકે ખોટી ઓળખ આપનાર મોબાઈલ નંબરધારક મળી પાંચ લોકો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ ભેગાં મળીને તેને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા

પડાવવાનું પડ્યંતર રચ્યું હતું. જેના ભાગરૂપે મુસ્કાન નામની સ્ત્રી તેને હિલગાંડનમાં ફરવા લઈ ગઈ હતી. બેઉ જણ બાઈક પર હિલગાંડનથી પરત જતા હતા ત્યારે અબ્દુલ્લ સમાએ બેઉના ફોટોગ્રાફ પાડીને અન્ય આરોપીઓને મોકલી આપ્યાં હતાં. અંજારના મામદ નોરેએ આ ફોટોના આધારે મુસ્કાન પોતાની પત્ની હોવાનું જણાવીને ફરિયાદીને ડાટી ડફારા કરી બ્લેકમેઈલ કરીને મામલાની પતાવટ માટે ૧૯ લાખ રૂપિયાની માગણી કરી હતી જે રૂપિયા તેણે ચૂકવી દીધાં હતાં. આરોપીઓએ ફરિયાદીને દબાણમાં લાવવા

ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ખોટી અરજી દાખલ કરી હતી, જેમાં સમાધાનના નામે અજાણ્યા મોબાઈલ પરથી પોલીસ કર્મચારી તરીકે ખોટી ઓળખ આપીને ત્રણ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. અબ્દુલ્લ સમા અને સરફરાઝે નકલી પોલીસ વતી આ ત્રણ લાખ રૂપિયા મેળવ્યાં હતાં. આમ આરોપીઓએ કાવતરું રચીને ૨૧ લાખ રૂપિયા પડાવી લીધાં હોવાનું સ્પષ્ટ થતાં પોંચેય સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ મહેબૂબે ફરિયાદ નોંધાવી હતી.

એફઆઈઆર સંદર્ભે નિયમિત જામીન માટે હતી. ગત વર્ષે માર્ચમાં ગુજરાત હાઇ કોર્ટે તેમની નિયમિત જામીન અરજી ફગાવી દેવાના આદેશને પડકારતી હોલની એસએલપી દાખલ કરવામાં આવી હતી. ઉચ્ચ સરકારી પદ પરના કાર્યકાળ દરમિયાન સમાન ગુનાઓ માટે તેમની સામે નોંધાવેલી અસંખ્ય એફઆઈઆરનો ઉલ્લેખ કરીને, હાઈ કોર્ટે શર્માની તરફેણ કરવામાં અનિચ્છા વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું હતું.

ભાવનગરમાં અલંગમાં સગીરા સાથેના શારીરિક સંબંધો મામલે યુવકની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી) ભાવનગર: સગીરા સાથેના શારીરિક સંબંધો પ્રેમ અને એકબીજાની સહમતીથી બંધાયા હોય તો પણ કાયદાની દ્રષ્ટિએ ગંભીર ગુનો બને છે. આવા જ પ્રકારનો બનાવ અલંગ મરીનના પોલીસ અધિકારી સમક્ષ આવ્યો હતો. પોલીસે કાયદાની જોગવાઈ મુજબ કરેલી કાર્યવાહીના પગલે તજાજા કોર્ટે પોલીસે કસ્ટડી આપી હતી. હવે આ યુવક ને જેલના સળિયા પાછળ ધકેલાવ્યું પડશે. મળતી માહિતી મુજબ, ભાવનગર જિલ્લાના અલંગમાં સાથે શ્રમિક કાર્ય કરતા વિજ્ઞાતીય પાત્રો એકબીજા તરફ આકર્ષાયા હતા. બંને એકબીજા સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. ૧૫ વર્ષ અને પાંચેક માસની સગીરાને મિસ ડિલિવરી થઈ હતી. મિસ ડિલિવરી સમયે ગર્ભમાનું બાળક પાંચેક માસનું થઈ ગયું હતું. જે મૃત અવસ્થા હતું. આ ઘટનામાં આરોપી તરીકે અલંગના આશિષ ચૌહાણ ઉ.વ. ૨૧ની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસે એક દિવસીય કસ્ટડી મેળવી હતી. સગીરા સાથે સંબંધ બંધવાના કારણે આરોપી યુવક ને જેલના સળિયા પાછળ જવું પડશે. જો ડિવેન્શને રિપોર્ટ એક બીજાના મેચ થશે તો આરોપીને આકરી સજા પણ થઈ શકે છે.

નખત્રાણાના કોટડા (જડોદર)માં માટલામાં પીવાનું પાણી ન હોવા બાબતે પતિએ પૂછતા પત્નીએ આત્મહત્યા કરી

(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજ: પ્રવર્તમાન સમયમાં લોકોની સહનશક્તિ કેટલી હદે ઘટી ગઈ છે તેના પુરાવારૂપ બનાવ કચ્છના નખત્રાણા પંથકના કોટડા (જડોદર) ખાતે બનવા પામ્યો હતો. જેમાં માટીના માટલામાં પાણી ન ભર્યું હોવાના નજીવા મુદ્દે પતિએ આપેલો કપકો સહન ન થતાં યુવાન પરિણીતાએ ગળેફાંસો ખાઈ, અનંતની વાટ પકડી લેતાં પંથકમાં અસ્પર્શી સાથે ગમગીની પ્રસરી જવા પામી હતી. આ અંગે નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કોટડા (જડોદર) ખાતે રહેનારી ૩૦ વર્ષિય રિન્કુબેન સંતોષપુર ઉર્ફે શાંતિલાલ રામપુરી ગુંસાઇએ બપોરના અરસામાં પોતાના ઘરે સીલિંગ ફેનમાં કપડાં સૂકવવાની દોર વડે ગળેફાંસો ખાઈ આપવાત કરી લીધી હતી. રિન્કુબેનના પતિએ માટીના માટલામાં પીવાનું ડુંડુ પાણી શા માટે ભર્યું ન હોવા અંગે પૂછાણું લેતાં ઉછેરાટમાં આવી ગયેલી પરિણીતાએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આ સમગ્ર બનાવની ગહન તપાસ હાથ ધરી છે.

ભુજમાં ૨૨ વર્ષ પુરાણા જમીન ફાળવણી કેસમાં સુપ્રીમ કોર્ટે તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્માની જામીન અરજી ફગાવી

(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજ: દેશની સર્વોચ્ચ અદાલતે કચ્છના ભુજ ખાતે દાખલ થયેલા વર્ષ ૨૦૦૩ના ગેરકાયદેસર જમીન ફાળવણીના કેસમાં નિવૃત્ત આઈએએસ અધિકારી પ્રદીપ નિરંકરનાથ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીને ફગાવી દીધી હતી. વિનાશકારી ભૂકંપ બાદ ભાંગી પડેલા કચ્છ જિલ્લાના તત્કાલીન કલેક્ટર તરીકે પ્રદીપ શર્મા પર અંગત નાણાકીય લાભ માટે સરકારી

જમીનની ગેરકાયદેસર ફાળવણી બદલ ભ્રષ્ટાચાર અને ગુનાહિત વિશ્વાસઘાતનો આરોપ છે. તેમની સામે ૨૦૨૩માં ફોજદારી કાર્યવાહી સંહિતા, ૧૯૭૩ની કલમ ૪૩૯ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જે સીઆઈડી કાઠમ બોર્ડર ઝોન પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૪૦૯, ૨૧૭, ૧૨૦બી, ૧૧૪ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ હેઠળ સજાપાત્ર ગુના માટે નોંધાયેલી

એફઆઈઆર સંદર્ભે નિયમિત જામીન માટે હતી. ગત વર્ષે માર્ચમાં ગુજરાત હાઇ કોર્ટે તેમની નિયમિત જામીન અરજી ફગાવી દેવાના આદેશને પડકારતી હોલની એસએલપી દાખલ કરવામાં આવી હતી. ઉચ્ચ સરકારી પદ પરના કાર્યકાળ દરમિયાન સમાન ગુનાઓ માટે તેમની સામે નોંધાવેલી અસંખ્ય એફઆઈઆરનો ઉલ્લેખ કરીને, હાઈ કોર્ટે શર્માની તરફેણ કરવામાં અનિચ્છા વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું હતું.

જમીનની ગેરકાયદેસર ફાળવણી બદલ ભ્રષ્ટાચાર અને ગુનાહિત વિશ્વાસઘાતનો આરોપ છે. તેમની સામે ૨૦૨૩માં ફોજદારી કાર્યવાહી સંહિતા, ૧૯૭૩ની કલમ ૪૩૯ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જે સીઆઈડી કાઠમ બોર્ડર ઝોન પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૪૦૯, ૨૧૭, ૧૨૦બી, ૧૧૪ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ હેઠળ સજાપાત્ર ગુના માટે નોંધાયેલી

એફઆઈઆર સંદર્ભે નિયમિત જામીન માટે હતી. ગત વર્ષે માર્ચમાં ગુજરાત હાઇ કોર્ટે તેમની નિયમિત જામીન અરજી ફગાવી દેવાના આદેશને પડકારતી હોલની એસએલપી દાખલ કરવામાં આવી હતી. ઉચ્ચ સરકારી પદ પરના કાર્યકાળ દરમિયાન સમાન ગુનાઓ માટે તેમની સામે નોંધાવેલી અસંખ્ય એફઆઈઆરનો ઉલ્લેખ કરીને, હાઈ કોર્ટે શર્માની તરફેણ કરવામાં અનિચ્છા વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું હતું.

પૂર્વ કચ્છના લિસ્ટેડ બુટલેગરની પાસા હેઠળ કચ્છ પોલીસે ધરપકડ કરી

(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજ: 'ગતિશીલ ગુજરાત'માં સતત વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિ કરતા રહેતા ગુનાહિત માનસ ધરાવતા શખ્સો વિરુદ્ધ કડક પગલાંના રાજ્યસ્તરના આદેશ બાદ હરકતમાં આવી ગયેલી પૂર્વ કચ્છની સ્થાનિક ગુનહારોષક શાખાએ એક બુટલેગરની પાસા હેઠળ ધરપકડ કરી તેને સુરતની જેલમાં ધકેલી દીધો હતો. અંજાર તાલુકાના વરસામીની બાગેશ્રી સોસાયટી-૧ માં રહેનાર

કાનજી ઉર્ફે કાના વેલા બઢિયા નામના શખ્સ વિરુદ્ધ અંજારમાં પાંચ, ભયાઉમાં પાંચ તથા ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે દારૂ સંબંધિત ગુના નોંધાયેલા છે. તેના વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા સમાહર્તાને મોકલવામાં આવી હતી. ત્યાંથી પોલીસને લીલીઝંડી મળતાં પોલીસે ધરપકડ કરી આ લિસ્ટેડ બુટલેગરને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

કાનજી ઉર્ફે કાના વેલા બઢિયા નામના શખ્સ વિરુદ્ધ અંજારમાં પાંચ, ભયાઉમાં પાંચ તથા ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે દારૂ સંબંધિત ગુના નોંધાયેલા છે. તેના વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા સમાહર્તાને મોકલવામાં આવી હતી. ત્યાંથી પોલીસને લીલીઝંડી મળતાં પોલીસે ધરપકડ કરી આ લિસ્ટેડ બુટલેગરને સુરતની લાજપોર જેલમાં ધકે